

પ્રકાશ

અનુકૂળ

સાહિત્ય : સમાજ સોની

બોલદાર-ડિસ્પેલાઇન ૨૦૦૭

અંકડા | નાણી | અંકડા

અંકડા | અંકડા

માટેના | માટેના

પ્રત્યક્ષીય

મિત્રાણામ્ભ સૂચિકારોડસ્થિ ૩

સમીક્ષાવિશેષ

Catalogue of Native Publications (સંપા. ગ્રાન્ટ અને પીલ) દીપક મહેતા ૭

ગુજરાતી આદિમુદ્રિત ગ્રંથોની સૂચિ (સંપા. અચ્યુત યાશ્વિક, કિરીટ ભાવસાર) દીપક મહેતા ૮

ગુજરાતી સામયિક લેખ સૂચિ : ૧૯૭૫, ૧૯૭૬ (સંપા. કનુભાઈ શાહ, કિરીટ ભાવસાર)

કિશોર વ્યાસ ૧૨

સામયિક લેખ સૂચિ : ૧૯૭૬-૨૦૦૦ (સંપા. રમણ સોની) મણિભાઈ પ્રજાપતિ ૧૪

પરબસૂચિ (સંપા. ઈતુભાઈ કુરકુટિયા, પારુલ દેસાઈ, રમેશ દવે) જ્યંત મેઘાણી ૧૬

સંદર્ભવિશેષ

અધ્યયનનો આધારસત્તંભ : સામયિક સૂચિ – જ્યંત મેઘાણી ૧૮

પ્રકાશ વેગડાનું સૂચિક્ષેત્રે પ્રદાન – મણિભાઈ પ્રજાપતિ ૨૩

ગુજરાતીમાં સૂચિકાર્ય (સૂચિઓની સૂચિ) – સંકલન : ભાર્ગવ જાની ૨૮

પ્રત્યક્ષાનાં પંદર વર્ષ : ૧૯૭૧-૨૦૦૬

સર્વગ્રાહી લઘુચિત્ર – રમણ સોની II

સીધા સંપર્કમાં મૂકી આપનાર હાથપોથી – કિશોર વ્યાસ III

સૂચિકાર્યના અનુભવની કેડી પર – ફૃતિ પટેલ, સપના મોદી VII

સૂચિ : ૧૯૭૧-૨૦૦૬ – સંકલન : ફૃતિ પટેલ, સપના મોદી IX

પત્રચાર્યા

રાજેન્દ્ર મહેતા, ડિલીપ જવેરી ૪૧

પત્રચાર્ય મિતાકશરી ૪૪

વાર્ષિક સૂચિ : ૨૦૦૭ ૪૭

આ અંકના લેખકો ૪૮

પ્રકાશક અને મુદ્રક : શારદા સોની ૧૮, હેમદીપ સોસાયટી, દિવાળીપુરા, જૂના પાદરા રોડ, વડોદરા ૩૬૦૦૧૫
ગઈપણેટિઝ : શારદા મુદ્રણાલય, ૨૦૧, તિલકરાજ, પંચવતી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ - ૦૬. ફોન : ૦૭૯-૨૬૫૬૪૨૭૮
મુદ્રણસ્થાન : મધુ પ્રિન્ટરી, કારેલીબાગ, ગુજરાત સમાચાર સામે વડોદરા - ૩૬૦ ૦૧૮, ફોન : ૦૨૬૫ - ૨૪૬૧૨૪૪

'પ્રત્યક્ષા'નું સભ્યપદ ચાર રીતે મેળવી શકાય છે : વાર્ષિક, દ્વિવાર્ષિક, આજીવન અને શુભેચ્છક સભ્ય.
વાર્ષિક / દ્વિવાર્ષિક સભ્યોએ મુદ્રણ પૂરી થતાં એમનાં સભ્યપદ તાજાં (દિનિયુ) કરાવી લેવાં સૌ સભ્યોને 'પ્રત્યક્ષ' નિયમિત
મોકલવામાં આવશે તથા પ્રત્યક્ષનાં પ્રકાશનો પર વળતર અપાશે.

સભ્યપદ અંગેની વિગતો	વાર્ષિક રૂ. ૧૫૦	દ્વિવાર્ષિક રૂ. ૨૫૦
આજીવન સભ્યપદ :	વ્યક્તિ રૂ. ૧૨૦૦	સંસ્થા રૂ. ૧૫૦૦
શુભેચ્છક સભ્યપદ :	વ્યક્તિ રેમઝ સંસ્થા	રૂ. ૨૫૦૦
વિદેશ માટે : વાર્ષિક : ડૉલર ૨૦, પાઉંડ ૧૫; આજીવન : ડૉલર ૧૦૦, પાઉંડ ૭૫.		

સભ્યપદની રકમ હાથોડાથ, મનીઓર્ડરથી કે ડ્રાફ્ટથી મોકલી શકાશે. બહારગામના ચોક સ્વીકારતા નથી.

ચોક / ડ્રાફ્ટ 'શારદા સોની પ્રકાશક પ્રત્યક્ષ' એ નામે જ લખવા વિનંતી.

મ. ઓ. મોકલનારે સંદેશાની જગાએ પોતાનું પૂરું સરનામું અવશ્ય લખતું.

સભ્યપદની રકમ મોકલવાનાં સરનામાં

વડોદરા : શારદા સોની, ૧૮, હેમદીપ સોસાયટી, યગોરનગર પાછળ, જૂના પાદરા રોડ, વડોદરા ૩૬૦૦૧૫

હાથોડાથ સભ્યની નીચેનાં સરનામે પણ આપી શકાશે : અહીં મ.ઓ. કે ચોક ન મોકલવાં.)

મુંબઈ : નિતિન મહેતા ૪૦૧/બી, શિલ્પા ટેરેસ (ન્યૂ), શિલ્પાલી રોડ બોરિવલી (૪.) મુંબઈ ૪૦૦૦૮૨ ભાવનગર :
જંત મેદાણી પ્રસાર, ૧૮૮૮ આત્માભાઈ એવન્યુ ભાવનગર ૩૬૪૦૦૨ રાજકોટ : નિતિન વડગામા 'તાંદુલ' સ્વાતિ
સોસાયટી, વિરાણી સાયંસ કોલેજ પાછળ, રાજકોટ ૩૬૦૦૦૫ વલસાડ : આકળ એજન્સી, ૧૮, મણિબાગ, ધરમપુર
રોડ, અંગ્રામા, વલસાડ - ૩૬૦૦૦૭ અમદાવાદ : ઈમેજ પલિકેશન : ૧-૨, અપર લેવલ, સેન્ટ્રૂરી માર્કેટ, આંબાવાડી,
અમદાવાદ - ૩૬૦ ૦૦૬ (ઇમેજમાંથી છૂટક નકલ પણ મળી શકશે.)

'પ્રત્યક્ષા'નું વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર મુજબ ગણાય છે એટાં અધવચ્ચે ન મોકલતાં ડિસેમ્બર (ભોડામાં મોદું ફેબ્રુઆરી)
સુધીમાં સભ્ય ઝી મોકલી આપવા વિનંતી.

'પ્રત્યક્ષ' વર્ષમાં ચાર વાર - માર્ચ, જૂન, સપ્ટેમ્બર અને ડિસેમ્બરના અંતે - પ્રકાશિત થાય છે.

સંપાદકીય પત્રવાહિની

રમણ સોની ૧૮, હેમદીપ સોસાયટી, દિવાળીપુરા, જૂના પાદરા રોડ, વડોદરા ૩૬૦૦૧૫

ફોન : (૦૨૬૫) ૨૭૫૭૧૮૭, ૮૨૨૮૨૧૫૨૭૫ E-mail : ramanson11@yahoo.com

p

Published with Financial Assistance from the Central Institute of Indian Languages (Ministry of Human Resource Development, Department of Secondary & Higher Education, Govt. of India.), Manasgangotri, Mysore - 570006
vide sanction letter 53-3(2)/2006-07/GUJ/LM/GRNT dated November 21, 2006
under the scheme of Grant-in-Aid

ભૂત્યકીએ

મિત્રાશામ્ર સૂચિકારોલસિ

આ સૂચિવિશેષ જોતાં કોઈકોઈને થશે – આ વળી શું માંડયું ? સર્જનાત્મક કૃતિઓ ભલે નહીં, એ કૃતિઓ વિશે તો વાંચવા મળતું હતું; અહીં તો એ પણ ગયું. આવા સૂચિઓના જંગલમાં અમને શા માટે રઝણપાટ કરાવો છો ?

સૂચિઓ જેવાં ને કોશ જેવાં જ્ઞાન-સંદર્ભનાં સાધનોનો મહિમા હજુ આપણા મનમાં પૂરો વસ્યો નથી. એમાં માહિતી ને સામગ્રીનું જંગલ આપણને દેખાય છે. એમાં નથી કલ્યનાશીલતા, નથી વિચારશીલતા – એવી આપણી છાપ છે. ખરેખર તો સૂચિ એ જંગલ પણ નથી ને એમાંની રઝણપાટ પણ નથી; વાસ્તવમાં એ આપણને રઝણપાટમાંથી છોડાવે છે. સાહિત્યસર્જન અને સાહિત્ય-વિવેચનસંશોધનનો આપણો વારસો, એક ગંજાવર મુદ્રિત-અમુદ્રિત મૂલ્યવાન ભંડાર રૂપે નજીકના ને દૂરદૂરના ભૂતકાળ સુધી ફેલાયેલો છે. એને કેવળ સ્મરણથી સંક્રિત કરી શકતો નથી – એટલે એ વેરવિભેર છે, ઢંકાયેલો છે, કેટલોક તો બુલાઈ ગયેલો છે. એને એકત્રિત કરીને અને શાસ્ત્રીય બવસ્થામાં ઢાળીને સૂચિકાર આપણા હાથમાં મૂકે છે – કહો કે, પેલા ગંજાવરને હાથવળું કરી આપે છે. કોઈ એક પ્રતિષ્ઠિત કવિનું ઉત્તમ નીવડેલું કાવ્ય પહેલી વાર ક્યાં ને ક્યારે પ્રગટ થયું હશે, એનું આપણને કુતૂહલ હોય; એ કવિની એકદમ પ્રારંભની રચના ક્યાં-ક્યારે પ્રગટ થઈ હશે એની જિજ્ઞાસા હોય; આપણે કોઈ એક સર્જક વિશે, કોઈ એક સાહિત્યસ્વરૂપ વિશે, કોઈ સંશા વિશે એક નાનોસરખો અભ્યાસલેખ કરવા બેઠા હોઈએ, ને એને વિશે કોણો કોણો, ક્યાં ક્યાં લખ્યું છે એ જાણાંનું જરૂરી હોય – જરૂરી હોય જ, ત્યારે એની શોધખોળ કરવી હોય; કોઈ મોટું કામ લઈને બેઠા હોઈએ ત્યારે તો અનેક સંદર્ભોની જરૂર પડે; એથી, હવે ક્યાં ક્યાં જરીશું, કેવી રીતે જરીશું એવી વિમાસણ થતી હોય – ત્યારે સૂચિકાર એની તીક્ષ્ણ ટોર્ચના પ્રકાશથી તે તે સ્થાન ચીંદી બતાવે છે, અજવાળી આપે છે : Let there be light, and there was light...

સંશોધન કરનાર જાણો છે કે ઘણી વાર એકબે વિગતોના અભાવે પણ તારણો ખોટાં પડતાં હોય છે. કેટલોક વાર તો એ સંશોધક, શોધાઈ ગયેલું હોય એને જ ફરી શોધવા ફંઝાં મારતો હોય;

કેટલીક વાર વળી શોધ-ખોળના બધા અંધારા ખૂણા એની નજરે ન ચડ્યા હોય ને એ અટવાતો હોય (ને એ સાહસિક જો પોતે ન અટવાતો હોય તો બીજાને, ભવિષ્યના અભ્યાસીને, અટવાવી દેતો હોય !) ત્યારે આકશવાણી થાય છે : મિત્રોમાં હું સૂચિકાર છું.

હા એ મજૂર છે, ધૂળધોયો છે, સામગ્રીચર છે – કલ્યાણ. પણ એ કોથળા ભરીભરીને એમના એમ ઠાવવતો નથી. એ વૈજ્ઞાનિક છે, શાસ્ત્રમાર્ગી છે; સઘન તાલીમથી કેળવાયેલો પણ છે ને કલ્યાણશીલ પણ છે. ‘વર્ગીકૃત પ્રમાણભૂત સૂચિ’ – એવા શબ્દો આપણે ઘણી વાર સાંભળીએ છીએ; એ શબ્દોને ખોલવા જોઈએ. સામગ્રીને વર્ગીકૃત કરવી એ, પહેલી નજરે દેખાય એટલું સરળ કામ નથી. બલાભલા તાલીમી ગ્રંથપાલ સૂચિકારો પણ મૂળીએ જાય એવું છે. વિગતો બહુવલક્ષણ હોય છે – એક વિગતને, ધારો કે, સાહિત્યસ્વરૂપ-જૂથ તરફ ખેસેરી તો એ સર્જક-જૂથથી દૂર પડી જવાની; કોઈ વિગતને ‘કવિતા-અભ્યાસ’ તરીકે ગણવી કે ‘વ્યાપક વિવેચન’ રૂપ ગણવી એ નિર્ણય લેવો પડે છે. બંને બાજુ રાખી શકાય એવી કોઈ પ્રતિનિર્દેશ-વ્યવસ્થા કરવી પડે છે. મેળવેલી તાલીમ ને શાસ્ત્રજ્ઞાન પણ ક્યારેક આ વિગત-વિનિયોગમાં આણાં કે અધૂરાં પડે છે, ને ત્યારે શાસ્ત્રજ્ઞાન તંત્રોને આલી રાખીને કલ્યાણને, સૂઝને અજમાવવાં પડે છે. વાચકને, અભ્યાસીને, પૂરેપૂરા મદદરૂપ થંબું એ જ લક્ષ્ય હોય છે. કમ્પ્યુટર સાયન્સો જે શબ્દ આપ્યો છે USER-FRIENDLY એ એનો સંકલ્પ હોય છે. જરાક સાહિત્યિક ભાષામાં કહીએ તો, સામગ્રીનો વ્યવસ્થામાં અંતર્ભર્વિ થાય છે સૂચિમાં. પેલો મજૂર માર્ગદર્શક બને છે.

P

‘પ્રત્યક્ષ’નું પરિરૂપ ઘણુંખરું સાચવીને આ સૂચિવિશેખનું આયોજન કર્યું છે. શરૂઆતમાં, આપણા કેટલાક સૂચિગ્રંથોની ‘સમીક્ષા’ છે; પછી ‘સંદર્ભવિશેષ’માં નિપાઈંચી યોજના છે : ‘અધ્યયનનો આધારસત્તંભ’ સૂચિની ઉપયોગિતાને લક્ષ્ય કરે છે; ‘પ્રકાશ વેગનું સૂચિકેત્ર પ્રદાન’ આપણા એક પ્રમુખ સૂચિકારનો કાર્યચરિત્રાલોખ આપે છે ને ‘ગુજરાતીમાં સૂચિકાર્ય’ આપણે ત્યાં થયેલી સૂચિઓની ગ્રંથનામ-અનુસારી સૂચિ આપે છે. – એ રીતે સૂચિ-સંદર્ભનો એક નક્શો ઉપસાવવાનો અહીં પ્રયત્ન છે.

‘પ્રત્યક્ષ’નાં ૧૫ વર્ષ (૧૯૯૧-૨૦૦૬)ની સૂચિ પહેલાં તો એક અલગ પુસ્તકા રૂપે પ્રગટ કરવા વિચારેલું, પણ એની આ આખા ‘સૂચિવિશેષ’ સાથે, એના એક અભિનન અંગ રૂપે, સંગતિ સાધી શકાઈ છે. મૂળે તો આ સૂચિએ જ સૂચિ-વિશેષનો વિચાર આપેલો; ‘પ્રત્યક્ષ’ની સૂચિ નોંધારી રહે એને બદલે એને એક વ્યાપક સંદર્ભ-પરિમાણ મળી રહે – એ યોજ્ય જણાયું એ સૂચિ અમારી સંશોધન-વિધાર્થીનો કૃતિ પટેલ અને સાપના મોદીએ કરી છે એ વિગતને અધોરેખિત કરું છું. બીજી હરોળ ઊભી થશે તો આવાં કાર્યો આગળ ચાલશે ને એવું મહત્વ જણાવાઈ રહેશે. કિશોર વ્યાસે આ નિમિત્તે, ‘પ્રત્યક્ષ’નાં સોળ વર્ષ પર એક નજર નાખી છે એની પ્રસ્તુતતા પણ આ સૂચિસંદર્ભે છે એ કહેવાની જરૂર ન હોય.

‘સૂચિવિશેષ’ તો કદ્યો આને, પણ એ દાવો મને એક રીતે સંપૂર્ણ લાગતો નથી. હજુ તો ઘણું ઉમેરી શકાય એમ છે : કોઈ હસ્તપત સૂચિ વિશે લેખ રૂપે વાત થઈ શકી નથી; ગુજરાતી સૂચિઓની સૂચિ annotated (વિષયનિર્દેશક નોંધો સાથેની) થઈ શકી હોત, એને પહોંચ્યો વળાયું નથી; બીજી ભાષાઓમાં – ભારતીય અને વિદેશી ભાષાઓમાં – થયેલાં સૂચિકાર્યોની વાત, ચર્ચા રૂપે અને સમીક્ષા રૂપે, થઈ શકી હોત એ, એવા સક્ષમ મિત્રો વિસ્ત હતા એથી, થઈ શકી નથી; સ્વતંત્ર ગ્રંથ રૂપે નહીં પણ કોઈ ગ્રંથ-અંતર્ગત થઈ હોય એવી કેટલીક મૂલ્યવાન સૂચિઓ પણ મારા ધ્યાનમાં છે – એની

વात પણ અહીં સામેલ કરી શકાઈ નથી. લાગ્યું કે, એક આપું વર્ષ આપવું પડે એવું આ કામ છે. એટલે આ કેટલીક નમૂનાની વાનગીઓ આપતો સૂચિવિશેષ પણ પ્રગટ કરવો એવો નિષ્ઠય કરવાનો થયો. આટલુંક કામ, આપણે ત્યાં સૂચિકાર્યોનો મહિમા કરવાની દિશામાં, સૂચિ અંગેની થોડીક પ્રેરક-ઉત્સજક આભોહવા. રચવામાં પણ જરા નિમિત્તરૂપ બનશે તોપણ એની સાર્થકતા રહેશે.

અલબત્ત, જે મિત્રોએ કામ કરી આપું એમણે, ટૂકા સમયમાં પણ, સરસ કરી આપું, દીપક મહેતાના બન્ને લેખો પૂર્વપ્રકાશિત છે પણ એ એટલાં મહત્વનાં કાર્યો વિશેના છે કે એની વાત અહીં સમાવવી જ પડે. અલબત્ત, એ બંને લેખો, એમની સંભાળિથી થોડીક કાટછાંટ કરીને લીધા છે. શંકર ઘાતેની ‘મરાઠી વાડુમય સૂચિ’ની સમીક્ષા પણ દીપકભાઈ કરી આપે એવું મેં દરછેલું પણ એ આટલા ટૂકા સમયમાં કરી શકે એમ ન હતા. એ જ રીતે મણિભાઈ પ્રજાપતિ ‘કેન્દ્રિજ બિલ્લીઓગ્રાહી ઓફ ઇન્ડિયા વિટરેચર’ વિશે લખી આપવાના હતા – પણ એમની વ્યસ્તતાને લીધે, એ છેલ્લી ઘડીએ કરી ન શક્યા.

જ્યંત મેઘાણી એટલું બધું નેપથ્યે રહેવાનું પસંદ કરે છે, ને સૌની સામે મૂકવા જેવી એમની વિચારણા પણ કાગળ પર ન ઉતારવાનો એવો વિલક્ષણ વૈરાગ્યભાવ ધરાવે છે કે એમનાં શાસ્ત્રીય સૂચને ક્ષમતાનો બધાંને ભાગ્યે જ ખ્યાલ હોય. જેવેરંદ મેઘાણીના ગ્રંથોનાં પુનઃપ્રકાશનોમાં એમણે નમૂનેદાર સૂચિઓ કરેલી છે. આગ્રહ અને ઉધરાણીનો નિર્દ્દય મારો ચલાવીને પણ એમની પાસેથી બે સરસ લખાણો કઢાવી શકાયાં એનો આનંદ છે. ભાર્ગવ જાની પણ જીણા અભ્યાસી ગ્રંથપાલ છે – એમણે સૂચિઓની સૂચિ આપીને આ અંકમાં એક મહત્વનું પ્રદાન કર્યું છે. કિશોર વ્યાસનો તો સાહિત્યિક પત્રકરત્વની દિશામાં સાતત્યભર્યો અભ્યાસ રહ્યો છે ને માર્ગ્યો ત્યારે તરત એમનો સહયોગ મળતો રહ્યો છે.

પ્રકાશ વેગડ પાસેથી ભલે કોઈ લખાણ મળી ન શક્યું (એ મળી શક્યું હોત તો મહત્વના ઉમેરારૂપ બન્યું હોત) પણ એમની સૂચિસાધનાને મણિભાઈ પ્રજાપતિએ યોગ્ય રીતે અહીં આદેખી આપી છે ને એમાં હિતિવલબ ભાવાણી, જ્યંત કોઈની વગેરે જેવા વિદ્વાનોના પ્રકાશભાઈનાં કાર્યો વિશેના સંતોષભર્યો ઉદ્ગારોને પણ સમાવ્યા છે એથી પ્રકાશભાઈના કાર્ય-મહિમાને વધુ પ્રમાણભૂતતા મળી છે.

મણિભાઈ પ્રજાપતિ એક કર્મચાર અભ્યાસી છે પણ એમનું કામ ગુજરાત કરતાં વધુ દિલ્હીમાં – વધુ વ્યાપક ક્ષેત્રમાં – જમા થયેલું છે એટલે આ વિનીત અભ્યાસીના કામનો આપણને વિશેષ પરિચય નથી. એમનું એક બહુ જ મહત્વનું કામ આપણા કોઈના, એ ક્ષેત્રના અભ્યાસીઓના પણ, ખ્યાલમાં આવ્યું નથી. ઈ. ૧૯૮૮માં દિલ્હીમાંથી પ્રકાશિત થયેલા, ડબલ કાઉન કદનાં ૩૫૦ પાનાંના ગ્રંથ *Bibliographical Survey of Indian Manuscript Catalogues (Being a Union List of Manuscript Catalogues)*ના એ સહસ્રાંપાદક છે. (એના સંપાદક સુભાષ વિશ્વાસે એમના આ સાથીનાં ‘Care and patience, [...] scholarly knowledge of language and script and judgement [...] required in the process’ની પ્રસંશા કરી છે.)

દેશ અને વિદેશમાં પ્રગટ થયેલી, ભારતીય ભાષાઓની હસ્તપત્રોને (પણ) સમાવવી ૨૦૦૦થી પણ વધુ ગ્રંથો/ગ્રંથાંડો (ને ૧૧૦ શીર્ષકો) ધરાવતી મુજિત સૂચિઓને, પ્રકાશનસ્થળના મુજય વણનુંકરે – ને પછી સંસ્થા, ગ્રંથનામ, સંપાદક, પ્રકાશનવર્ષના વિગતકરે – મૂકી આપતો આ

'Survey' ગ્રંથ પ્રત્યેક સૂચિની વિષય-વિગતો આપતો (annotated) પદ્ધતિચુસ્ત, ને એથી જ સંઘર્ષાયક ગ્રંથ છે. તે તે સૂચિ કયાં ગ્રંથાલયો / સંસ્થાઓમાં છે એ પણ નિર્દેશાંતું ને છેલ્લે ભાષાવાર ને વ્યાપક શબ્દસૂચિ આપતું આ મૂલ્યવાન પ્રકાશન અત્યારે તો અસુલભ છે – દુષ્ટીએ કે એ નવી આવૃત્તિ પામે.

એની Preface માંથી એક-બે ખૂબ મહત્વની બાબતોની અહીં નોંધ કરું. પ્રસ્તાવનાનું પહેલું જ વક્ય છે – દુનિયાના કોઈપણ દેશ કરતાં ભારતમાં વધુ હસ્તપતો સંઘર્ષાયેલી છે. ભારતીય ભંડારોમાં આશરે તેપ લાખ હસ્તપતો છે ને બીજી ૬૦ હજાર જેટલી ભારતીય (ભાષાઓની) હસ્તપતો યુરેપ-અમેરિકાના ભંડારોમાં છે. એશિયાના અન્ય દેશોમાં પણ દોડ લાખ જેટલી ભારતીય હસ્તપતો છે.

પરંતુ આમાંથી માત્ર ૧૦ લાખ હસ્તપતો જ મુદ્રિત સૂચિઓ કે સાદી યાદીઓ રૂપે નોંધાઈ છે. થયેલી સૂચિઓ અંગેનું એમનું નિરીક્ષણ એ છે કે ખૂબ જ ઓછી સૂચિઓ પદ્ધતિસર (systematically) તૈયાર થયેલી છે. ઘણીખરી હસ્તપતો તો ચોપડે કરેલી યાદીઓ (hand lists) રૂપે છે. સૂચિઓ તૈયાર કરનાર મોટા ભાગના ગ્રંથાલયો / સૂચિકારોએ આ ગ્રંથ (survey)ના સંપાદકોને કહ્યું કે સૂચિ કેમ કરવી એની કોઈ પર્યાપ્ત જાણકારી એમની પાસે નથી કે નથી એ માટેના કોઈ ફેરફાર !

સૂચિ કે સૂચિગ્રંથની ઉપયોગિતા વિશેના અજ્ઞાન કે એ અંગેની સાવ ઉપેક્ષાની, ડેટલીક ચોકાવનારી બાબતો પણ આ સંપાદકોએ કહી છે : (૧) આ જે ૨૦૦૦ જેટલા સૂચિગ્રંથો પ્રકાશિત થયેલા છે એમાંના ૫૦% જેટલા ગ્રંથો પણ, ભારતની કોઈ પણ લાઈબ્રેરીમાં વસાવવામાં આવ્યા નથી ! (૨) ભારતભરની મુદ્રિત સામગ્રીની, એક Repository Library (સર્વગ્રંથ-સંગ્રહ) તરીકે છેક ૧૮૫૪થી સ્થપાયેલી, કલકત્તાની નેશનલ લાઇબ્રેરી પાસે પણ ખૂબ ઓછા સૂચિગ્રંથો છે ! (૩) મદાસ યુનિવર્સિટીનો સંસ્કૃત વિભાગ, જેની જવાબદારી New Catalogus Catalogorum (NCC) તૈયાર કરવાની છે, એઝે પણ, છેલ્લા બે દાયકા (૧૯૮૮ પહેલાંના)થી કોઈ નવું કેટલોગ ખરીદ્યું નથી. એમાં કેવળ ૪૦૦ કેટલોગ છે.

આપણો સમૃદ્ધ વારસો છતાં આપણી પ્રતિષ્ઠિત ને જવાબદાર સંસ્થાઓની આવી ગુનાહિત ઉપેક્ષાવૃત્તિની આ વાત નારાજ કરનારી છે.

મેં માણિબાઈ પ્રજાપતિને કહ્યું છે કે, આ ગ્રંથની તમારી પ્રસ્તાવનાનો ગુજરાતી અનુવાદ કરીને પણ કયાંક પ્રગટ કરો તો આવા મહત્વના કામનો, કમ સે કમ, સૌને ખ્યાલ તો આવે.

p

આપણો ત્યાં, ગુજરાતમાં પણ, ડેટલાં ગ્રંથાલયો પાસે ને ડેટલા અત્યાર્સીઓ પાસે સૂચિગ્રંથો ને કોશગ્રંથો હશે ? પાયાનાં શાનસાધનો વિના જ આપણા વિદ્યાર્થીઓ-અધ્યાપકો-વિવેચકો-સંશોધકો સૌને ચાલે છે.

પરંતુ આવી વિષમ સ્થિતિમાં પણ, હમજુંં હમજુંં આપણે ત્યાં સંદર્ભગ્રંથો – સૂચિ અને કોશના ગ્રંથો – પ્રકાશિત કરવાનું વલણ વધ્યું છે એ એક સુચિક્ષ છે. એવા ટાણે આ સૂચિવિશેષ એક નાનકડી ચેષ્ટા હોવા છતાં, વિચારોતેજક બનશે કે છેવટે વિચારમાં નાખી દેનાર બનશે તોપણ, સૌનો આભાર માનવાનું સાર્થક બનશે.

રમાયણસોની

સૂચિગ્રંથ-સમીક્ષા

Catalogue of Native Publications of Bombay Residency

- એલેક્ઝાન્ડર ગ્રાન્ટ (૧૮૬૫ અને ૧૮૬૭); સુધારવધારા સાથેની બીજી આવૃત્તિ જેમ્સ પીલ (૧૮૬૯)

ગુજરાતી આદિમુદ્રિત ગ્રંથોની સૂચિ

દીપક મહેતા

મુંબઈના બોમ્બે કુરિયર પ્રેસમાં છાપાઈને ૧૮૦૮માં રેબર્ટ ડ્રમન્ડનું 'ઇલસ્ટ્રેશન્સ ઓફ ધી ગ્રામેટિકલ પાર્ટ્સ ઓફ ધ ગુજરાતી મહરણ એન્ડ ઇલિશ લેંગવેજિસ' બહાર પડવું તે સાથે આપણી ભાષામાં છાપેલાં પુસ્તકોનો યુગ શરૂ થયો. પણ એ પુસ્તકોની સૂચિ(કેટલોગ) બનાવવાનું લગભગ પંચાવન વર્ષ સુધી કોઈને સૂર્યાંધું નહીં. ૧૮૬૭માં પહેલી વાર રાજસ્ટ્રેશન ઓફ બુક્સ એન્ડ પિલિયોટિકલ્સ એક્ટ અમલમાં આવ્યો અને ત્યાર પછી પ્રગટ થયેલાં પુસ્તકોની વિગતો મુંબઈ સરકાર ટ્રેમાસિક સૂચિઓ દ્વારા પ્રગટ કરતી રહી, પણ તે પહેલાં પ્રગટ થયેલાં પુસ્તકોની સૂચિ તૈયાર કરવામાં અને પ્રગટ કરવામાં પણ મુંબઈ સરકારે જ પહેલ કરી. આવી સૂચિ મરાಠી અને ગુજરાતી પુસ્તકો માટે તૈયાર કરવાનો સરકાર શિક્ષણ ખાતાને હુકમ કર્યો. એટલે તે વખતના ડિરેક્ટર ઓફ પબ્લિક ઇન્સ્ક્રુક્શન સર એલેક્ઝાન્ડર ગ્રાન્ટ, આઠમા બેરોનેટે આવી સૂચિ તૈયાર કરવાનું કામ માથે લીધું. ૧૮૬૪ના ડિસેમ્બરની ૩૧મી સુધીમાં પ્રગટ થયેલાં પુસ્તકોની સૂચિ *Catalogue of Native Publications* તેમજે તૈયાર કરી અને સરકારે

તે પ્રગટ કરી. તેની સુધારેલી-વધારેલી બીજી આવૃત્તિ ૧૮૬૭માં પ્રગટ થઈ. મુંબઈમાં ભાયખલા ખાતે આવેલા એજયુકેશન સોસાયટીના પ્રેસમાં આ ૨૭૭ પાનાંની સૂચિ છાપાઈ હતી. તેમાંના સંસ્કૃત પુસ્તકોના વિભાગ સાથે ફાન્જ ક્લિબોર્નની નોંધ જોડવામાં આવી હતી. તેમનો જન્મ ૧૮૪૦માં, અવસાન ૧૮૦૮માં. મરાಠી પુસ્તકોના વિભાગ સાથે મહાઠેવ ગોવિંદ રાનેની નોંધ જોડવામાં આવી હતી. રાનેનો જન્મ ૧૮૪૨માં, અવસાન ૧૮૦૧માં. પણ ગુજરાતી પુસ્તકોના વિભાગ સાથે કોઈ જાણકારની નોંધ જોડવામાં આવી નથી.

આ સૂચિમાં કુલ ૧૬૭૮ પુસ્તકો નોંધવામાં આવ્યાં છે જેમાં ૬૫૦ ગુજરાતી પુસ્તકો છે. પણ ગ્રાન્ટની આ સૂચિમાં ઘણાંબધાં પુસ્તકો નોંધવાનાં રહી ગયાં હતાં. વળી ૧૮૬૫થી ૧૮૬૭નો સમયગાળો બાકી રહ્યો હતો. આથી સરકારે ગ્રાન્ટની સૂચિમાં જરૂરી સુધારવધારા કરવાનું હચાલ્યું. આ કામ કર્યું તે વખતના ડાયરેક્ટર ઓફ એજયુકેશન સર જેમ્સ પીલે. આ સૂચિમાં મરાಠી પુસ્તકોનો વિભાગ કુષ્ણશાસ્ત્રી ચિપલૂણકર જેવા વિદ્ધાનની દેખરેખ

નીચે તૈયાર થયો. આ સૂચિમાં કુલ ૬૬૫ પુસ્તકોનો સમાવેશ થયો છે. તે ઉપરાંત પીલની સૂચિમાં મુંબઈ ઇલાકામાંના છાપખાનાની યાદી પણ ઉમેરવામાં આવી. મુંબઈ ઇલાકામાંના મુદ્રણના ઇતિહાસ માટે આ યાદી ખૂબ મહત્વની છે. આ સૂચિ ૧૮૬૮માં પ્રગટ થઈ હતી.

ગ્રાન્ટની સૂચિમાં ૬૫૦ ગુજરાતી પુસ્તકોની નોંધ રોમન વિષિમાં કરવામાં આવી છે અને પુસ્તકોને તેમનાં નામના અક્ષરાનુક્રમે ગોડવવામાં આવ્યાં છે. પુસ્તકો વિષેની માહિતી કુલ દસ કોલમમાં વહેંચી છે. પહેલી કોલમ, પુસ્તકો સરળંગ કમાંક (બધી ભાષાનાં પુસ્તકોને એક જ સરળંગ કમાંક આપ્યો છે. ગુજરાતી પુસ્તકોની શરૂઆત ૮૭૫ કમાંકથી થાય છે અને છેલ્લા ગુજરાતી પુસ્તકનો કમાંક ૧૫૨૪ છે.) આ સૂચિમાં પુસ્તકો ઉપરાંત અખભારો અને સામયિકોને પણ સમાવી લેવામાં આવ્યાં છે. બીજા કોલમમાં પુસ્તક કે સામયિકનું નામ આપ્યું છે. ત્રીજા કોલમમાં પુસ્તકના લેખક કે અનુવાદકનું નામ તથા ચોથા કોલમમાં સામયિકના તંત્રીનું નામ નોંધ્યું છે. પુસ્તકના વિષયનો નિર્દેશ પાંચમા કોલમમાં કર્યો છે. પ્રકાશન જે છાપખાનામાં છાપાયું હોય તેનું નામ છણ્ણ કોલમમાં અને પ્રેસનું સ્થળ સાતમા કોલમમાં આપ્યું છે. પ્રકાશનની સાલ આઠમા કોલમમાં નોંધી છે. પ્રકાશનની પૃષ્ઠસંખ્યા અને કિંમત છેલ્લી બે કોલમમાં નોંધ્યાં છે. આ સૂચિમાંની વિગતો ઉપર અછાડતી નજર નાખતાં પણ એ હકીકતનો ખ્યાલ આવે છે કે ખરેખર પુસ્તક જોઈને તે પછી જ તેનો સમાવેશ સૂચિમાં કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો નથી. બીજે કશેથી મળેલી માહિતીને આધારે પણ પુસ્તકોને સૂચિમાં દાખલ કરવામાં આવ્યાં છે. પણિષામે સૂચિમાંની વિગતો ઘણી જગ્યાએ અધૂરી છે તો ઘણી જગ્યાએ ભૂલભરેલી. થોડાક નામફરે એકનું એક પુસ્તક બે વાર નોંધાયું હોય તેવું પણ બન્યું છે. છતાં ગ્રાન્ટ અને પીલની આ બે સૂચિઓ ૧૮૮૩ સદીનાં ગુજરાતી પુસ્તકો વિષેની માહિતીનું આજે તો એકમાત્ર સાધન છે. આ સૂચિની બીજી એક મર્યાદા એ છે કે તેમાં માત્ર બિટિશ ઇન્ડિયાના મુંબઈ ઇલાકામાંથી પ્રગટ થયેલાં પ્રકાશનો જ નોંધાયાં છે. ગુજરાતમાં આવેલાં સંખ્યાબંધ દેશી રાજ્યોમાંથી પ્રગટ થયેલાં પ્રકાશનો તેમાં નોંધાયાં નથી,

કારણ દેશી રાજ્યો અંગ્રેજ સરકારની હકૂમત બહારનો પ્રદેશ હતું.

પુસ્તકોની સૂચિ તૈયાર કરનાર ગ્રાન્ટ અને પીલ કોણ હતા ? ભલે ભારતીય ભાષાઓના નહીં, પણ આ બને પોતાના ક્ષેત્રના વિદ્ધાનો હતા. બને બિટિશ સરકાર પાસેથી ‘સર’નો ઇલ્કાબ મેળવી શકે તેવા આગળ પડતા અમલદારો હતા. સર ગ્રાન્ટનો જમ ન્યૂયોર્કમાં ૧૮૨૬ના સાપેભારની ૧૩મી તારીખે. ૧૮૪૮થી ૧૮૬૦ સુધી ઓંકસફર્ઝમાં ફેલો તરીકે કામ કર્યું. તે દરમિયાન એરિસ્ટોટલની ફ્લિલસૂઝી વિષે ઊડે અભ્યાસ કર્યો અને ‘એથિક્સ’ નામે પુસ્તક ૧૮૫૭માં પ્રગટ કર્યું. ૧૮૮૫ સુધીમાં તેની ચાર આવૃત્તિ પ્રગટ થઈ કારણ કે ઓંકસફર્ઝમાં તે પ્રમાણભૂત પાઠ્યપુસ્તક તરીકે વપરાતું. મદ્રાસ આવ્યા ત્યાં તેમની નિમાશૂક ઇન્સ્પેક્ટર ઓંફ સ્કૂલ્સ તરીકે કરવામાં આવી. બીજે વર્ષે તેઓ મુંબઈ આવ્યા અને એલિન્સ્ટન કોલેજમાં હિસ્ટ્રી અને પોતિટિકલ ઇકોનોમીના પ્રોફેસર બન્યા.

૧૮૬૨માં સર ગ્રાન્ટ આ કોલેજના પ્રિન્સિપાલ અને ૧૮૬૩ના ફેલ્બુઅસ્ટ્રીમાં મુંબઈ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બન્યા. ૧૮૬૪માં થોડો વખત તેમના સ્થાને સર એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્ઝ આવ્યા પણ ૧૮૬૫ના સાપેભારમાં સર ગ્રાન્ટ ફરી વાઈસ ચાન્સેલર થયા, સાથોસાથ ૧૮૬૫માં તેમણે મુંબઈ ઇલાકાના ડિરેક્ટર ઓંફ પલિક ઇન્સ્ક્રુક્શન તરીકેની જવાબદારી પણ સંભાળી. આ હોદ્દાની રૂએ જ તેમણે મરાઠી-ગુજરાતી પુસ્તકોની સૂચિ તૈયાર કરી હતી. ૧૮૬૮માં એડિનબરા યુનિવર્સિટીના પ્રિન્સિપાલ તરીકે તેમની નિમાશૂક થઈ હતી. આ જ યુનિવર્સિટીએ અગાઉ ૧૮૬૫માં તેમને એલાયન્સીની માનદ ઉપાય આપી હતી. ત્યારથી તેમણે પોતાનાં બધાં સમય અને શક્તિ એડિનબરા યુનિવર્સિટીના વિકાસ પાછળ ખર્ચી, ૧૮૮૪ના નવેમ્બરની ૩૦મી તારીખે એડિનબરામાં ગ્રાન્ટનું અવસાન થયું. મુંબઈના ‘ગ્રાન્ટ રોડ’ નામ જેમના પરથી પડ્યું તે જ આ ગ્રાન્ટ. આજે એ રસ્તાનું નામ તો બદલાઈ ગયું છે પણ પણ્યિમ રેલવેમાં હજી આજેય ગ્રાન્ટ રોડ સ્ટેશન એલેક્ઝાન્ડર ગ્રાન્ટની યાદ સાચવી રહ્યું છે.

ગ્રાન્ટની સૂચિમાં સુધારાવધારા કરીને બીજી આવૃત્તિ તૈયાર કરનાર સર જેમ્સ પીલનો જન્મ બિટનના લિવરપૂલમાં ૧૮૩૭ના એપ્રિલની ૨૭મી તારીખે, ૧૮૫૨માં સર જેમ્સ ઓક્સફર્ડની ઓર્ઝિયેલમાં દાખલ થયા. અભ્યાસમાં હંમેશાં પહેલો વર્ગ મેળવનાર સર જેમ્સ ૧૮૫૫માં આઈ.સી.એસ. માટેની પરીક્ષામાં પાસ થયા. ૧૮૫૬ના ઓક્ટોબરની ૭મી તારીખે તે મુંબઈ આવ્યા. ૧૮૮૫ના જાન્યુઆરીથી ૧૮૮૬ના ઓક્ટોબર સુધી તેઓ મુંબઈ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રહ્યા. ૧૮૮૫માં બોમ્બે કાઉન્સિલના સભ્ય અને એક્ઝિટિંગ ગવર્નર તરીકે કામ કર્યું. ૧૮૮૬માં તેમની નિમણૂક તે વખતની ભારત સરકારના હોમ એન્ડ રેવન્યુ (ગૃહ અને મહેસૂલ) ખાતામાં કરવામાં આવી. તે એક અસ્થા ચિત્રકાર પણ હતા અને તેમણે ૩૦૦ જેટલાં ચિત્રો કરેલાં તેમાંના ઘણાંખરાં આજ સુધી સચ્ચવાંના છે. છેલ્લાં ૧૫ વર્ષ દરમિયાન બિટનમાં અને યુરોપના દેશોમાં ઠેર ઠેર ફરીને તેમણે લેન્ડસ્કેપ ચિત્રો તૈયાર કર્યા. સર જેમ્સ પીલે તેમના ભારતમાંના લાંબા

વસવાટ દરમિયાન પણ ઘણાં ચિત્રો તૈયાર કરેલાં. તેમનાં આવાં ચિત્રોનું પ્રદર્શન ૧૮૭૬માં લોઓર ન્યુપેન્ડ ગેલેરી ખાતે યોજવામાં આવેલું જેણું નામ રાખ્યું હતું ‘ઇન્ડિયા રિમેન્બર્ડ.’ સરકારી નોકીર દરમિયાન સર પીલને તે વખતના ભાવનગરના દેશી રાજ્ય સાથે નિકટનો સંબંધ બંધાયો હતો. ભાવનગર નજીકના ઘોઢા બંદરની મુલાકાત વઈને તેમણે કેટલાંક ચિત્રો તૈયાર કર્યા હતો. સર પીલની યાદમાં ભાવનગરમાં ‘પીલ ગાર્ડન’ નામે ઉદ્ઘાન બનાવવામાં આવ્યું. ૧૮૭૦માં તેમનું અવસાન થયું.

આમ, ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલાં પુસ્તકોની પહેલવહેલી સૂચિઓ અંગ્રેજ અમલદારોને હાથે તૈયાર થઈ હતી, પણ એ અમલદારો વિદ્વાન હતા, અભ્યાસી હતા, સ્થાનિક લોકો અને તેમના ભાષા-સાહિત્ય માટે સમભાવ ધરાવનારા હતા. આ બન્ને સૂચિઓ આજે તો દુષ્ણાય્ય બની ગઈ છે. આપણી કોઈક સાહિત્યિક સંસ્થાએ તેનું પુનર્મુદ્રાણ કરવા જેવું છે.

(“મુંબઈ સમાચાર”માંથી સાભાર, લેખકની સંમતિથી, ટ્રૈકાવીને)

ગુજરાતી આહિમુદ્રિત ગ્રંથોની સૂચિ – સંપા. અચ્યુત યાણિક, કિરીટ ભાવસાર,
સેતુ પ્રકાશન, ૧, પુષ્યશ્લોક, યુનિવર્સિટી રોડ, અમદાવાદ-૮, ૨૦૦૪; રૂ. ૩૨૦, રૂ. ૨૦૦

એક મહિનનું ડગાલું

દીપક મહેતા

ચાલો, કોઈકે તો એક કરવા જેવું કામ છેવટે કર્યું. સો વરસની ગુજરાતી સાહિત્ય પરિષદે ન કર્યું, કરદાતાના પૈસે ચાલતી ગુજરાત સાહિત્ય અકાદમીએ ન કર્યું, તે સેન્ટર ફોર સોશયલ નોલેજ એન્ડ એક્ષન – સેતુએ કર્યું. આ સૂચિ આપણી ભાષાની એક મોટી ઊણાપ કેટલેક અંશે પૂરી કરે છે અને આપણી સાહિત્યિક સંસ્થાઓની નાનમ થોડીક

ઓછી કરે છે. મરાઠી, બંગાળી કે તમિન ભાષાઓએ આવી સૂચિઓ કયારની તૈયાર કરી લીધી છે. આપણને તેની ખોટ સાલતી નહોતી, પણ ‘સેતુ’ને સાલી. પહેલવહેલું મુદ્રિત ગુજરાતી પુસ્તક રોબર્ટ ર્યામેન્ડ કૃત ‘ઇલસ્ટ્રેશન્સ ઓફ ધ ગ્રામેટિકલ પાર્ટ્સ ઓફ ધ ગુજરાતી, મહરણ એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજિસ’ મુંબઈના કુરિયર પ્રેસમાં છપાઈને

૧૮૦૮માં બહાર પડ્યું ત્યારથી માંગીને ૧૮૬૭ સુધીમાં પ્રગટ થયેલાં કુલ ૧૧૭૮ પુસ્તકોની સૂચિ અહીં તેમણે રજૂ કરી છે. અલબત્ત, પોતાના આ કામની સૌથી મોટી મર્યાદા અંગે નિખાલસ એકગાર સંપાદકોએ પ્રસ્તાવનામાં કર્યો જ છે. આ સૂચિ ખરેખરાં પુસ્તકો જોઈ-ચકાસીને બનાવી શકાઈ નથી, પણ બીજી કેટલીક મુદ્રિત સૂચિઓનું સંકળન કરીને બનાવી છે. એટલે પુસ્તક કે લેખકનાં નામ, પ્રકાશક, પ્રકાશનસ્થળ ને સાલ, પૃષ્ઠસંખ્યા, ચિત્રો, કિંમત વગેરે અંગેની અહીં આપેલી વિગતો પૂરેપૂરી પ્રમાણભૂત છે એમ કહી શકાય નહીં. સંપાદકોને સૌથી મોટી ઓથ મળી છે તે ‘ગ્રાન્ટની સૂચિ’ તરીકે ઓળખાતા પુસ્તકની ૧૮૬૭માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિની. ૬૫૮ પુસ્તકોની વિગતો આ સૂચિમાંથી લેવાઈ છે. એ ઉપરાંત ગુજરાત વર્નાક્યુલર સોસાયટી લાઇબ્રેરીની સૂચિમાંથી ૨૧૭ પુસ્તકો, મુંબઈની કામા ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યુટ લાઇબ્રેરીની સૂચિમાંથી ૭૫ પુસ્તકો, ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયના કો-પોરાઈટ વિભાગમાંથી ૫૨ પુસ્તકો, યુનિવર્સિટી ઓફ મુંબઈ લાઇબ્રેરીના પ્રિયોમકર સંગ્રહમાંથી ૪૦ પુસ્તકો, અચ્યુત યાજ્ઞિકના અંગત સંગ્રહમાંથી ૨૮ પુસ્તકો, ગુજરાત ટ્રેસ્ટ બુક સોસાયટીના ઈતિહાસમાંથી ૨૩ પુસ્તકો, ‘ગ્રંથ અને ગ્રંથકાર’માંથી ૨૧ પુસ્તકો, ફરદુનજી મર્જબાનજીના જીવનચરિત્ર (જે તાજેતરમાં ‘મુંબઈ સમાચાર’માં પુનર્મુદ્રિત થયું હતું.)માંથી ૧૮ પુસ્તકો, બુદ્ધિવર્ધક પુસ્તક નામાવલિમાંથી આઈ પુસ્તકો અને અન્ય પ્રક્રિયા સોતોમાંથી છ પુસ્તકોની માહિતી અહીં સમાવી છે. આ ૧૧૪૮ પુસ્તકો ઉપરાંત પુસ્તકને અંતે ‘પરિશિષ્ટ-૨’માં બીજાં ૨૮ પુસ્તકો નોંધાયાં છે.

પુસ્તકનું આપોજન અત્યંત વ્યવસ્થિત રીતે થયું છે. સૌપ્રથમ વર્ષવાર સૂચિ આપી છે જે મુખ્ય સૂચિ છે. પ્રત્યેક પુસ્તક વિષે મળી શકી તેટલી માહિતી નોંધવા ઉપરાંત તે માહિતી કરી સૂચિમાંથી મળી છે, તે પણ દર્શાવ્યું છે અને ગ્રાન્ટની સૂચિમાંથી માહિતી લીધી હોય તો એ સૂચિમાંનો પુસ્તક કમાંક પણ નોંધ્યો છે. ત્યાર બાદ કર્ત્તાવાર સૂચિ, અનુવાદક સૂચિ, સંપાદક સૂચિ, વિષયવાર સૂચિ અને ગ્રંથનામ સૂચિ પણ આપી છે. અંતે બે પરિશિષ્ટો અને

સંદર્ભસૂચિ પણ મૂક્યાં છે. જોકે મુંબઈ-ગુજરાતનાં છાપખાનાની સૂચિ ઉમેરવા જેવી ગણાય.

આ સૂચિ જોતાં કેટલીક ખૂબ રસપ્રદ વિગતો પ્રગટ થાય છે. ૧૮૦૮થી ૧૮૨૮ સુધીમાં આજના ગુજરાત રાજ્યમાં એક પણ પુસ્તક છાપાયું નથી. ગુજરાતમાં છપાયેલું પહેલવહેલું પુસ્તક ૧૮૨૬માં જોવા મળે છે. – સુરતથી પ્રગટ થયેલું ‘કદીમ તારીખ પારસીઓની કસર’ ૧૮૩૮થી દમણમાં છપાયેલાં પુસ્તકો જોવા મળે છે જે ફરદુનજી મર્જબાન તેમના દમણના છાપખાનામાં છાપ્યાં હતાં. ૧૮૨૫ સુધીમાં છપાયેલાં કુલ ૧૭ પુસ્તકોમાંથી આઈ પુસ્તકો સાથે લેખક, સંપાદક, અનુવાદક કે મુદ્રક તરીકે ફરદુનજી મર્જબાનજીનું નામ સંકળાયેલું છે. આથી જ સંપાદકોએ યોગ્ય રીતે જ આ સૂચિ ફરદુનજીસાહેબને (અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને) અર્પણ કરી છે. અમદાવાદમાં છપાયેલું પહેલું પુસ્તક તો છેક ૧૮૪૭માં જોવા મળે છે અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદના પુસ્તકો ૧૮૪૮થી દેખા દે છે. અહીં આપેલી કર્તાસૂચિમાં કુલ ૪૦૩ લેખકો નોંધાયા છે (જેમાંના કેટલાક સંસ્કૃતીય પણ છે) તેમાંથી ૧૪૩ લેખકો પારસી છે. અનુવાદક સૂચિમાં નોંધેલા ૮૮ અનુવાદકોમાંથી ૪૫ અનુવાદકો પારસી છે અને ૫૦ સંપાદકોમાંથી ૨૩ પારસી છે. આમ, અહીં નોંધાયેલા પણ કર્તાઓમાંથી ૨૧૧ (૩૮ ટકા) પારસીઓ છે. આ સૂચિમાં સૌથી વધુ પુસ્તકો (૬૧) કવિ દલપત્રામનાં નોંધાયાં છે. શામળ ભણનાં ૫૫ અને નર્મણનાં ૩૦ પુસ્તકો અહીં નોંધાયાં છે. જુદા જુદા ૭૪ વિષયો પરનાં પુસ્તકોમાંથી સૌથી વધુ ૧૫૧ પુસ્તકો પારસી ધર્મ વિષેનાં છે. કવિતાનાં ૮૪, કવિતાસંગ્રહનાં આઈ અને પદ્યવાતાનાં ૫૮ પુસ્તકો અહીં મળે છે. અન્ય વિષયોમાં અર્થશાસ્ત્ર, અંકગણિત, આરોગ્ય, ઈજનેરી વિદ્યા, કાયદા, કુદરતી વિજ્ઞાન, ખગોળ, ચિત્રકામ, જાહુ, જ્યોતિષ, પંચાંગ, પ્રવાસ, પ્રાણી વિજ્ઞાન, બાળઆરોગ્ય, બીજગણિત, ભૂતપિશાચ, મનોવિજ્ઞાન, ખેતી, વૈદક, સંગીત વગેરેનો સમાવેશ થાય છે. ૫૮ વર્ષના ગાળામાં માત્ર એક જ સ્ત્રીકર્તાનો નામોલ્લેખ મળે છે – ૧૮૬૨માં પ્રગટ થયેલ ‘નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો સંગ્રહ’નાં

સંપાદક બાળાબદેન.

આપણી ભાષામાં આ હિશાનો આ પહેલવહેલો ગણનાપાત્ર પ્રયત્ન છે અને આવાં કામ કરવાં કેટલાં મુશ્કેલ હોય છે તે તો ચમબાણ વાગ્યાં હોય તે જાણો. છતાં આ સૂચિની કેટલીક ઊંખપો કોઈનેય ખટકે તેવી છે. પહેલું તો એ કે સંપાદકોએ ગ્રાન્ટની સૂચિનો મુખ્ય આધાર લીધો પણ તેના જ અનુસંધાનમાં અને તેની પૂર્તિઓ ૧૮૬૪માં પ્રગટ થયેલી સર જે. બી. પીલની સૂચિ તેમના ધ્યાન બહાર ૪ રહી ગઈ. તેવી જ રીતે ૧૮૮૮માં જે. એફ. બ્લુમહાર્ટે તૈયાર કરેલી બ્રિટિશ મ્યુઝિયમ લાઇબ્રેરીમાંના ગુજરાતી પુસ્તકોની સૂચિનો તથા તેની ૧૮૧૫ની પુરવણીનો ઉપયોગ કરવાનું પણ તેઓ ચૂકી ગયા છે. આ યાદીની એક વિશિષ્ટતા એ છે કે તેમાં પ્રત્યેક પુસ્તકની બીજી બધી વિગતો અંગેજમાં આપી છે, પણ પુસ્તકનું નામ ગુજરાતી લિપિમાં છાપ્યું છે. અલબત્ત, આ સૂચિમાં ૧૮૬૭ પછી પ્રગટ થયેલાં પુસ્તકોનો પણ સમાવેશ થયો છે, જેની વિગતો ગાળી નાખવાની રહેત. ખૂદ લેખકના અને પુસ્તકના નામમાં જોવા મળતી જોડણીની અરાજકતા ઉપર સંપાદકે પ્રસ્તાવનામાં ટીકા કરી છે. તો પુરોવચનમાં આર. ગાનેટ કહ્યું છે કે ગુજરાતી પુસ્તકનું આ પહેલવહેલું લાઇબ્રેરી કેટલોગ છે. વળી આર. વી. પરુળકર સંપાદિત સિલેક્શન્સ ફોમ એજ્યુકેશનલ રેકૉર્ડ્ઝ (બોમ્બે)માંથી બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટીએ પ્રગટ કરેલાં પુસ્તકોની માહિતી પણ મળી શકી હોત.

બીજી મોટી મુશ્કેલી એ છે કે પ્રત્યક્ષ પુસ્તકો ન જોઈ શકવાને લીધે સંપાદકો આધારભૂત સૂચિઓમાંની વિગતોને પૂરેપૂરા વળણી રહ્યા છે. જેમ કે ગ્રાન્ટની સૂચિમાં પુસ્તકોની સાથે વર્તમાનપત્રો અને સામયિકોનો પણ સમાવેશ થયો છે અને આ સૂચિના સંપાદકો પણ તેને અનુસર્યા છે. એ વિગતોને પુસ્તકોની વર્ષવાર યાદીમાં ન મૂકતાં સામયિકોની અલગ યાદી બનાવવી વધારે યોગ્ય ગણાય. બીજું, જુદીજુદી સૂચિઓમાં – અને ક્યારેક એક જ સૂચિમાં પણ – લેખકો કે પુસ્તકોનાં નામમાં થોડી મિનન્તા જોવા મળે તે કદાચ નિવાર્ય ગણાય. પણ શક્ય હોય ત્યાં સુધી આ સૂચિમાં સંપાદકોએ કર્તાનામ અને ગ્રંથનામમાં એકવાક્યતા સાધી લેવાની જરૂર હતી. જેમ

કે ‘નાનાભાઈ રૂસ્તમજી’ અને ‘રાણીના, નાનાભાઈ’ બંને નામફણે એક જ વ્યક્તિ છે. તેવી જ રીતે ‘મુલ્લા ફિરોજ’, ‘મુલ્લા ફિરોજ દસ્તૂર’, ‘મુલ્લા ફિરુજ’ અને ‘મુલ્લાં ફિરોજ’ એ પણ એક જ વ્યક્તિના નામનાં ચાર રૂપ છે. આવી સરતચૂક માત્ર પારસી નામોમાં જ નથી થઈ. ‘ભોગીલાલ નાનાલાલ’ અને ‘ભોગીલાલ નધાનાલાલ’ કે ‘રણછોડ ઉદેરામ’ અને ‘રણછોડભાઈ ઉદ્યરામ’ને પણ જુદા જુદા લેખક તરીકે એન્ટ્રી આપી છે.

આ પુસ્તકને સમજવા માટે અત્યંત ઉપયોગી એવી પ્રસ્તાવનામાંની એક સરતચૂક પણ ખૂંચે તેવી છે. સંપાદકો લખે છે : “સન ૧૮૬૭થી હિંદની બ્રિટિશ સરકારે કોંપોરાઇટનો કાયદો ઘણ્યો તેમજ મુદ્રિત પુસ્તકોની નોંધણી કરાવવાનું ઠરાવ્યું તેને કારણે ત્યાર પછીનાં પુસ્તકો પદ્ધતિસર નોંધાયાં અને સચવાયાં.” અહીં બે કાયદાની સેળભેજ થઈ ગઈ છે. કોંપોરાઇટના કાયદા ડેફન્ડ પુસ્તકોની નોંધણી કરાવવાનું ક્યારેય ઠરાવાયું નથી, ૧૮૬૭માંય નહીં, આજેય નહીં. એટલું જ નહીં કોંપોરાઇટનો કાયદો ૧૮૬૭માં નહીં, ૧૮૪૭માં બ્રિટિશ હિન્દુસ્તાનમાં પહેલી વાર અમલમાં આવ્યો હતો, જે ૧૮૧૧ સુધી અમલમાં રહ્યો હતો. મુદ્રિત પુસ્તકોની નોંધણી ફરજિયાત બનાવાઈ, તે ૧૮૬૭ના ૨૫મા કાયદા દ્વારા. આ કાયદાનું નામ છે : ધ પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ, ૧૮૬૭.

આમ, આ સૂચિ કે ભારતની બીજી ભાષાઓનાં મુદ્રિત પુસ્તકોની આવી સૂચિઓ માટે ૧૮૬૭ની સાલ ઉત્તરમર્યાદા તરીકે મહત્વની બની રહે છે તે કોંપોરાઇટના કાયદાને કારણે નહીં, પણ ધ પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટને કારણે. આવી બધી ખામીઓ તો પુસ્તકની બીજી આવૃત્તિમાં સુધારી લઈ શકાશે પણ હવે ખરેખર કરવા જેવું કામ આ યાદીમાંના પુસ્તકોની ભૌતિક ચકાસણી મુંબઈ અને ગુજરાતનાં પુસ્તકાલયોમાં કરવાનું છે. પછીને તબક્કે એ બધાં પુસ્તકોને ડિજિટલ સ્વરૂપે સાચવી લેવા જોઈએ. પહેલું ડગલું અત્યંત મહત્વનું છે, જે આ સંપાદકોએ ભર્યું છે. હવે ‘એક ડગલું બસ નવ થાય’ એમ કહેવાનું કામ આપણું છે.

ગુજરાતી સામયિક લેખ સૂચિ - સંપા. કનુભાઈ શાહ, કિરીટ ભાવસાર
 ૧૮૭૫ની સૂચિ, આર. આર. શેઠ અમદાવાદ, ૧૮૭૮, પૃ. ૧૪૧, રૂ. ૨૦. ૧૮૭૬ની સૂચિ,
 આર. આર. શેઠ, ૧૮૮૨, પૃ. ૨૭૫, રૂ. ૪૦

એક અભિનંદનીય આરંભ – પણ પછી ?

કિશોર વ્યાસ

આ સૂચિગ્રંથોની પ્રસ્તાવનામાં સી. પી. શુક્રલે નોંધેલી વાત વિચારણીય છે. તેઓ કહે છે કે ‘આવી સૂચિઓ ત્યારે જ ઉપયોગી થાય કે જ્યારે તેમાં બધાં જ સામયિકો અને તેમાંની માહિતી અને જ્ઞાન આપતી બધી નોંધો કે લેખોનો સમાવેશ કરવામાં આવ્યો હોય. વાચું એવી શ્રદ્ધા ઉત્પન્ન થવી જોઈએ કે અમુક મુદ્દત દરમયાન પ્રાસિદ્ધ થયેલ દરેક ઉપયોગી લેખ અથવા નોંધની માહિતી સૂચિમાં અવશ્ય મળશે. આમ થાય તો જ સંદર્ભગ્રંથની પાછળ લીધેલો શ્રમ લેખે લાગે.’ તમામ સામયિકોને આવરી લેવાનો પુરુષાર્થ સરાહનીય લાગે પણ સંઘળાં સામયિકો એ વાત એક ભાંતિ સમી છે. ખૂબે ખૂબેથી પ્રકાશિત થતાં કે ડેવળ સીમિત વર્તુળોમાં ફરતાં રહેતાં એવાં અનેક સામયિકો આપડી જાણ બહાર પ્રકાશિત થતાં રહે છે ને જાણ બહાર વિલાઈ જાય છે જેમ કે અહીં અરવરવ ઊંઘાપોહ, ગગન જેવાં સામયિકો આ સમયગાળામાં પ્રકાશિત થયેલાં હોવા છતાં સૂચિની બહાર રહેલાં છે.

સાજાગ સામયિકો વાર્ષિક સૂચિઓ આપે એ એક વાત છે અને સૂચિનો સ્વતંત્ર ગ્રંથ આપવો એ જુદી વાત છે. કોઈ એક વિષયને લઈને પ્રકાશિત થતી સૂચિઓ પણ જ્યારે ભારે પુરુષાર્થ માગી રહી હોય ત્યારે અહીં તો અનેક માનવવિદ્યાઓના વિષયોને સમાવી લેવાનું સાહસ થયું છે. એ અર્થમાં આ સૂચિ ગુજરાતી ભાષામાં લેખસૂચિની મહત્વાકંક્ષા જન્માવતી સૂચિ છે. આ બંને ગ્રંથોમાં લેખોનાં મથાળાં મૂળ પ્રમાણેનાં છે વળી લેખકોનાં નામો જે રીતે લેખોમાં અપાયા છે તે જ રીતે અહીં રાખ્યાં છે તેનું એક

મુખ્ય કારણ આપશે ત્યાં આ પ્રકારના કાર્યની કોઈ ચોક્કસ પરંપરા નથી એ છે. સંપાદકોએ લેખસૂચિમાં વિષયમથાળાં બાંધવામાં ઠીક ઠીક મુશ્કેલીઓ અનુભવી છે, એથી લેખસૂચિ માટેનાં વિષયમથાળાંની એક નિશ્ચિત અને સર્વમાન્ય એવી તરેહ હવે ઊભી થવી જોઈએ એવું સૂચન તેઓ મૂકે છે પણ એવી સર્વમાન્ય તરેહો કેમ ઊભી કરી શકાય એના રસ્તા પણ અહીં ચીંધવા જોઈતા હતા.

૧૮૭૫ની લેખસૂચિમાં ૨૮ સામયિકો, ૧૪૮૮ નોંધો અને ૧૪૧ પૂછો છે. એની સરખામજીમાં ૧૮૭૬ના વર્ષની સામયિકલેખસૂચિ માટે ૫૦ શિષ્ટ સામયિકો પસંદ કરેલાં છે તેમાં માનવવિદ્યા અને સમાજવિદ્યાના લેખોની સાથે વિજ્ઞાનવિષયક અને અન્ય લેખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સૂચિમાં ઉત્તેચ નોંધો અને ૨૭૫ પૂછો થયાં છે. સંપાદકે કથ્યું છે કે સૂચિનું કામ જ એવું છે કે તે સમયના વહેવા સાથે વિસ્તરાતું જાય.

આ લેખસૂચિમાં ત્રણ વિભાગો છે. વિષય વર્ગીકૃત વિભાગ, લેખકસૂચિ અને વિષયસૂચિ. મુખ્ય વિષયમાં ગુજરાતી સામયિકોના લેખોને અહીં લેખસૂચિ રૂપે સંકલિત કર્યા છે. સંપાદકો કહે છે કે, અહીં સમાચાર નોંધ, પ્રાસંગિક નોંધ કે ટૂંકી સમીક્ષા લીધાં નથી. પણ ટૂંકી સમીક્ષા કેને ગણવી એની ચર્ચા હજુ આપશે ત્યાં ઊભી જ છે. પ્રથમ ભાગમાં લેખસૂચિના વિષયોનો ક્રમ દ્વિભિન્ન વર્ગીકરણ પદ્ધતિના મુખ્ય વિષયકમ પ્રમાણે રાખ્યો છે અને દરેક મુખ્ય વિષયમાં આવતા તેના પેટા વિભાગો અને ઉપપેટાવિષયોના ક્રમ માટે એ પદ્ધતિના મુખ્ય કર્મની.

ગોઠવણીને તે અનુસર્યા છે. આ પદ્ધતિના સ્વીકાર સામે આપણો વંધો ન હોઈ શકે પણ આટલા બધા વિષયો, પેટા વિષયો છે તો એની વિષયશીર્ષકોની પણ એક અકારાદિકમે સૂચિ આપવાની જરૂર હતી, એમ થયું હોત તો અનેક જગાએ વિષય શોધવામાં સરળતા રહેત. છેલ્લે વ્યાપક સૂચિમાં વિષયો (ખરેખર તો વિભાજિત વિષયાંગો) દર્શાવાયા છે પણ એમાં વિષયો વેરવિભેર છે ઉદા. રૂપે સાહિત્ય અનેક વિષયાંગોમાં વહેચાઈને આ સૂચિમાં પથરાયું છે. વિજ્ઞાન એવું વ્યાપક શીર્ષક બાંધ્યા પછી પેટાશીર્ષકો વૈજ્ઞાનિક શોધ, સંશોધન, વિજ્ઞાન અને સમાજ જેવા વિભાગ એક એક લેખને અપાયા છે જેથી પૃષ્ઠોનો થયેલો બગાડ આપણને કરે એ હદે થયો છે. ભૌતિક શાસ્ત્રને, યંત્રઉદ્યોગ વિજ્ઞાન કે જૈવિકવિજ્ઞાન જેવાં મુખ્ય શીર્ષકોનાં અલગ ખાનાંઓ જરૂરી લાગતાં નથી. વળી, આ વિભાગોમાં બે-બે જ લેખો અલગ અલગ પાને મુકાયા છે. ટેકનિકલ વર્ગીકરણ સાથે વ્યવહારુ વર્ગીકરણનું સંતુલન થતું રહેવું જોઈએ.

સાહિત્ય જેવા વિષયમાં અખિલ ભારત કવિ સંમેલન જેવો જુદો વિષય હોઈ શકે ? ગુજરાતી સાહિત્ય-ઇતિહાસનાં ખાનાંઓમાં ખરેખર તો મધ્યકાલીન સાહિત્યનું વિવેચન છે. સંપાદકોએ સમાચાર નોંધોને લીધી નથી એ અંગે પ્રસ્તાવનામાં સ્પષ્ટતા મૂકી છે તે છતાં ‘પારિવારિક’ એવા વિષય તળે ‘પુસ્તકાલય સામયિકમાં પ્રગટ થયેલી ગુજરાતી ભાષાનાં ગુણવત્તાવાળાં પુસ્તકોને પારિતોષિક વાળી નોંધ મૂકી છે ! એને લેખ નહીં પણ સમાચાર રૂપે જ લેખવી જોઈએ. ‘કાવ્યપોષી’ શીર્ષક તળે પ્રકાશિત સાવરકુંડલાનું કાવ્યસત્ર પણ શું સમાચાર નથી ? મુખ્ય શીર્ષકમાં કવિ ન્હાનાવાલ મુકાયું છે જ્યારે બીજા એક શીર્ષકમાં નર્મદ કવિ મુકાયું છે. ત્યાં કવિ નર્મદ કેમ નહીં ? આમ, અસંખ્ય પેટાવિભાગોના જથ્થામાં વિવેચકો – સમીક્ષકોનો અકારાદિકમ અટવાઈ ગયો છે અને વિષય-વિભાજન ભૂલભરેલું બન્યું છે. જેમકે ‘સાહિત્ય વિવેચન’માં પાશ્ચાત્ય સાહિત્ય પદી વિવેચન : કાવ્યમીમાંસા જેવું પેટાશીર્ષક છે એ પદી વળી સાહિત્યમીમાંસા : આકૃતિવાદ, કાફકા ફાન્ઝ, બંધારણવાઈ અભિગમ, લોન્જાઈન્સ અને વાસ્તવવાદ જેવા વિષયો આવે છે. આ

પ્રકારના વિભાજનથી તો લેખ ખોળનારને વિગત શોધવાની કવાયત આદરવાની થાય. લેખસૂચિ બે કોલમમાં પ્રસિદ્ધ થઈ છે એથી દરેક પાના નીચેના ડાબા કોલમને ક અને જમણા કોલમને ખ મૂળાક્ષરથી અંકિત કરેલ છે. વિષયસૂચિમાં સંબંધિત વિષયોના લેખોની માહિતી વિષયપદ સામે દર્શાવેલી સૂચિસંશાખી મળે છે. લેખકસૂચિ અને વિષયસૂચિ આ સૂચિના ઉપયોગની મુશ્કેલીઓમાં કંઈક રાહત આપે છે.

સૂચિઓમાં કેટલીક વિગતો અધૂરી મુકાયેલી છે. જેમકે નિરંજન ભગતના એક કાવ્યનો આસ્વાદ. ખરેખર તો કયા કાવ્યનો અહીં આસ્વાદ છે એ વિગત સ્પષ્ટ થતી હોય તો જ કામ સરે. કવિતા આસ્વાદનાં અસ્પષ્ટ રહેલાં આવાં ઘણાં ઉદાહરણો અહીં નોંધી શકાય એમ છે. હરીન્દ દવેનો જ્યોતીન્દ દવે વિષયક લેખ હાસ્યસાહિત્યમાં નહીં પણ ચરિત્રમાં મુકાવો જોઈતો હતો. આવા જ વિભાગો, પેટાવિભાગો અંગ્રેજ સાહિત્ય, ભારતીયસાહિત્ય, જર્મનીસાહિત્ય વગેરેમાં સૂચિકારોએ કર્યા છે. આ સંઘળાંને સાહિત્ય એવી વ્યાપક સંશાનીય મૂકવાનું વધુ લાભદાયી નીવકયું હોત. શાસ્ત્રીય રીતિઓનો જરૂર લાભ લઈએ પણ સૂચિઓમાં પ્રવેશનારા કોઈપણ જિજ્ઞાસુને એ સૂચિ માહિતીનો ખડકલો ન લાગે એવી ચાવીઓ તો સૂચિકારોએ જાતે જ દર્શાવી આપવાની રહે છે. એવી વ્યવસ્થા અહીં ઊભી થઈ શકી નથી એમાં સૂચિ માટે સ્વીકારેલા અનેકવિધ વિષયોને એકસાથે મૂકી આપવાનું કારણ રહ્યું જણાય છે.

સાહિત્યનાં સામયિકો ઉપરાંત પંચાયતી રાજ, ટેક્ષ, વ્યાપાર, બેલાડી જેવાં ૫૦ સામયિકો, પત્રિકાઓમાંથી સામગ્રીને એકઠી કરવાનો આ પુરુષાર્થ આપણે જે ગંભીરતાથી ધ્યાનમાં લીધો હોત તો એ પછીના સમયથી આજ સુધી અનેક વિષયોને આવરી લેતી સૂચિઓથી આપણે સમૃદ્ધ અને ભર્યાભર્યા હોત. વળી, ૧૯૭૫ અને ૧૯૭૬ એવાં બે વળોની સૂચિ પછી અટકી કેમ જવાનું હશે ? ૧૯૭૬ની સૂચિ કરતાં જ સંપાદકોને ચારેક વર્ષ લાગ્યાં છે એવું એમના સંપાદકીય લખાણ પરથી જોઈ શકાય છે. ને પુસ્તક થાય છે વળી બે વર્ષ પછી, ૧૯૮૨માં. ઇ વર્ષ જતાં વાર્ષિક સૂચિ એનો મોટા ભાગનો ઉપયોગ

- અર્થ ગુમાવી બેસે. વળી આ કામ એ પછી પણ ચાલવું જોઈતું હતું. પરંતુ, એ થયું નથી એનો શોક કરવાને બદલે અધ્યાપકો, વિદ્યાર્થીઓ આવા વિદ્યાકાર્યમાં સંડોવાય તો આવા. અનેક માહિતીઓનું આપણે ઉભા કરી શકીએ. આ સૂચિઓ પરથી આપણને એવી પ્રેરણા મળવી જોઈતી હતી.

આ સૂચિઓ ગ્રંથપાલોએ તૈયાર કરી છે. એ સમયે કોલેજોની સંખ્યા હતી એનાથી બમણી કોલેજો આજે તો ગુજરાતમાં પથરાયેલી છે ત્યારે ગ્રંથપાલોની સક્રિયતાના નમૂનારૂપ આ સૂચિગ્રંથો એ સૌ ગ્રંથપાલોની સામે પણ ધરવા જેવા છે.

સામયિક લેખ સૂચિ - સંપા. રમણ સોની
પ્રત્યક્ષ પ્રકાશન, વડોદરા, ૨૦૦૬, ફેબ્રુઆરી, ૩૮

સૂચિસિદ્ધાંતોનું સરસ અનુકૂલન, છતાં કેટલાક પ્રશ્નો

મહિબાઈ પ્રજાપતિ

સામાન્યત: ગ્રંથસૂચિનું કાર્ય ધૂળધોયાના ધંધા સમાન ગણાયું છે. આમ છતાં તેનો ભારે મોટો મહિમા છે. ગ્રંથસૂચિ એ સંશોધનનો એક પ્રમુખ આધારસોત છે. સંશોધકના સંશોધ્ય વિષયની ડિશા સુનિશ્ચિત કરવા માટે એ એક ભૌમિકાની ગરજ સારે છે. આજના ઘણાખરા નામમાત્રના પીએચ.ડિ.ના માર્ગદર્શક અધ્યાપકોની તુલનામાં જે તે વિષયકેત્રની સર્વાંગસંપૂર્ણ શાસ્ત્રીય વાડુમયસૂચિ ખરા અર્થમાં વાસ્તવિક માર્ગદર્શક બની શકે. સંશોધકનો અમૂલ્ય સમય બચાવવા ઉપરાંત પોતાના વિષયકેત્રમાં કેટલું પ્રાથમિક અને ગૌણ (Primary and Secondary) સાહિત્ય પ્રગટ થયું છે, અને કોના દ્વારા પ્રકાશિત થયું છે તે એ સૂચિઓ બતાવી આપે છે અને સંઘસૂચિઓ તો તે સાહિત્ય ક્યાં ઉપલબ્ધ છે તેની પણ માહિતી દર્શાવે છે. આવું ઉપરોગી અને શ્રમસાધ્ય કાર્ય પ્રાય: ગ્રંથાલયવિદો અને કવચિત્ શબ્દના આરાધકો - અધ્યાપકો દ્વારા સંપાદિત કરવામાં આવે છે. છતાં, સૂચિઓની તુલનાએ સૂચિકારોની ભાયે જ નોંધ લેવાતી જોવા મળે છે. આમેય, આ સમાજમાં ગ્રંથપાલ અને ગ્રંથાલયનાં કાર્યોનો અપવાદ સ્વરૂપે જ જાહેરમાં ઉલ્લેખ

કરવામાં આવે છે.

પ્રસ્તુત લેખસૂચિમાં ગુજરાતી ભાષા-સાહિત્યનાં પરસંદર્ભનાં અગ્રણી ૨૨ સામયિકોમાં પ્રગટ થયેલ વૈવિધ્યપૂર્ણ સાહિત્ય સ્વરૂપો, ભાષાશાસ્ત્ર અને અન્ય આનુષંસિક બાબતો સંબંધી લેખ-સામગ્રી જેમકે, ગ્રંથસમીક્ષા, કૃતિ-આસ્વાદ, અભ્યાસ-લેખ, સંપાદકીય, પત્રચર્ચા, પ્રસંગવાક્ષી ચર્ચા, કેફિયત, વાર્તાલાપ, મુલાકાત વગેરેને આવરી લેવામાં આવેલાં છે. સૂચિનું શીર્ષક પોતાની સ્પષ્ટ મર્યાદા સૂચયે છે તેમ અહીં વલિત સાહિત્યની કૃતિઓ જેમકે, કવિતા, નિબંધ, ટૂકી વાર્તા, લઘુકથા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. અહીં સમાવિષ્ટ સામગ્રી ૧૪ મુખ્ય વિભાગોમાં : (૧) કવિતા, (૨) વાર્તા, (૩) નવલકથા, (૪) નાટક, (૫) નિબંધ, (૬) પ્રવાસ, (૭) ચરિત્ર, (૮) બાળ સાહિત્ય, (૯) લોકવિદ્યા, લોકસાહિત્ય, (૧૦) વિવેચન-સંશોધન-સંપાદન-સાહિત્યિક પત્રકારત્વ, (૧૧) સાહિત્ય ચર્ચા, સાહિત્ય વિમર્શ, (૧૨) ભાષાવિજ્ઞાન, કોશ, અનુવાદ, સંદર્ભ સાહિત્ય, (૧૩) કેફિયત, વાર્તાલાપ, મુલાકાત અને (૧૪) અન્ય (લલિતકણાઓ, રંગભૂમિ, શિક્ષણ, ધર્મ-દર્શન, વિજ્ઞાન વગેરે) અને ૨૭ પેટા

વિભાગમાં સૂચિબદ્ધ કરી છે, જેના સંલેખોની અંદાજિત સંખ્યા ૪૦૦૦ અને તેના ૬૦૦ જેટલા લેખકો છે. પ્રત્યેક વિભાગને આવશ્યકતા મુજબ સમીક્ષા, આસ્વાદ અને અભ્યાસમાં વિભાજિત કરીને જે તે વિભાગના સંલેખો વર્ણાનુક્રમમાં ગોઠવ્યા છે, જેમાં અધ્યાપકીય નિષ્ણાનાં દર્શન થાય છે. સંપાદક ગ્રંથાલયી નથી, છતાં કોઈગત સૂઝુબૂળના કારણે સૂચિ સિદ્ધાંતોનું સરસ અનુકૂળન સાધી શક્યા છે. ઉ.ડા. તરીકે ગ્રંથસમીક્ષાઓ અને કૃતિના આસ્વાદના વિભાગમાં સમીક્ષિત ગ્રંથ / કૃતિના શીર્ષકોને આધારે વર્ણાનુક્રમ જાળવ્યો છે, પારિણામે એક જ ગ્રંથના અલગ અલગ સમીક્ષકોની સમીક્ષાઓ એકસાથે ગોઠવી શકાઈ છે. સમીક્ષકે આપેલ શીર્ષકનો આધાર લીધો હોત તો એક જ કૃતિની સમીક્ષાઓ વેરવિભેર ગોઠવાઈ જાત. વિષય નિર્દેશના અભાવવાળાં લેખ શીર્ષકો સામે મોટા ક્રોસમાં વિષય સૂચવતાં પદ્ધતિ મૂકવાં, એક જ લેખ એકથી અધિક સામયિકોમાં પ્રગત થયો હોય તો તે લેખના શીર્ષકની સામે ફૂફૂ કરવી, સંલેખની રજૂઆતમાં સાચંત શાસ્ત્રીયતા અને ઊરીને આંખે વળ્ગે તેવી ચોકસાઈ જાળવવી વગેરે બાબતો પ્રથમ દસ્તિએ જ ધ્યાનાકર્ષક બની રહે છે. ગ્રંથારંભે સંપાદકીય લેખસૂચિની ભીતરમાંથી વર્ણવેલ સૂચિનું પ્રભાવક અને વિસ્તૃત માહાત્મ્ય તથા પ્રસ્તુત સૂચિનું સ્વરૂપ, સંલેખોની સંરચના અને ગોઠવણી વગેરે ધ્યાનપાત્ર છે. ગ્રંથની આકર્ષક સાજસજા, ભૂલરહિત સુંદર મુદ્રણ, બાઈન્ડિંગ વગેરે નયનરમ્ય છે.

પ્રસ્તુત સૂચિ ઉપર દર્શાવિલ સમૃદ્ધ ગુજરાતી વચ્ચે પણ નીચે મુજબની ડેટલીક નોંધપાત્ર મર્યાદાઓ ધરારે છે :

૧. સૂચિ માટે પસંદ કરેલ સામયિકોમાં ગુજરાતી ઉપરાંત અન્ય ભારતીય સાહિત્ય અને વિદેશી સાહિત્ય વિષયક લેખો, સમીક્ષાઓ, આસ્વાદ વગેરે પ્રગત થયેલ છે. આ બધા સંલેખોની સ્વતંત્ર રીતે જે તે ભાષા-સાહિત્ય હેઠળ ગોઠવણીના અભાવે કયા કયા ગુજરાતી સર્જકે કયા કયા ભારતીય કે વિદેશી સર્જકે કે સાહિત્યપ્રવાહ વિશે રસાસ્વાદ, વિવેચન કે મૂલ્યાંકન કર્યું છે તેની સીધી માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ શકતી નથી.

૨. વિવિધ સાહિત્યક પ્રવાહો, વાદો જેમકે, દલિત સાહિત્ય, નારીવાદ, આધુનિકતા, અનુઆધુનિકતા, સૌતવાદ, તુલનાત્મક સાહિત્ય, તુલનાવાદ વગેરે વિષયક

લેખો કયા કયા વિભાગમાં ઉપલબ્ધ છે તે જાણવા સમગ્ર સૂચિ ફંક્શની જીવી પડે છે. હકીકત છે કે આ બધા વિષયો હેઠળ ન્યૂનતમ સંખ્યામાં લેખો અહીં જોવા મળે છે. છતાં તેનું મહત્વ નજરઅંદાજ ન કરી શકાય. તેથી જ આ સંબંધી સંલેખોના નિર્દેશો સૂચવતી સૂચિ અનિવાર્ય બની રહે છે.

૩. સર્જક - બ્યક્ટિ - વિષય બને છે ત્યારે સર્જક વિષય તરીકેની સૂચિ આવશ્યક બની રહે છે. આ પ્રકારની સૂચિમાં ‘અનુક્રમ-માં ગોઠવેલ વિવિધ વિભાગોના લેખક સંબંધિત સંલેખોના સંદર્ભો આપવા જોઈએ. સર્જક-અભ્યાસ માટે સર્જકની કૃતિઓની સમીક્ષા, આસ્વાદ કે મૂલ્યાંકન કરતા લેખો યા તેની કેફિયત, વાર્તાલાપ, ચરિત્ર વગેરે સંબંધી લેખોની સૂચિ પ્રમુખ સોત બની રહે છે.

૪. સમીક્ષિત ગ્રંથના લેખકોની સૂચિ (પ્રસ્તાવનામાં આ સૂચિ આપવામાં આવી નથી તેવો ઉલ્લેખ કર્યો છે. પરંતુ, કયા કયા લેખકોનાં પુસ્તકોની સમીક્ષાઓ પ્રગટ થઈ છે, અને તે સંબંધી સંલેખો પ્રસ્તુત સૂચિના કયાં કયાં પૃષ્ઠો ઉપર છે, તે જાણવા આ સૂચિ ખૂબ જ જરૂરી છે.)

૫. અનુક્રમ નંબર : ૧૪ અન્ય વિભાગ હેઠળ બારથી અધિક વિષયોના બધા લેખોને સર્બંગ વર્ણાનુક્રમમાં ગોઠવવાને બદલે જે તે વિષય હેઠળ સંબંધિત સંલેખો ગોઠવ્યા હોત તો તેના ઉપયોગમાં વિશેષ અનુકૂળતા થત.

અને સ્પષ્ટતા કરવી ઘટે કે પ્રશ્ન અહીં સંલેખોની ગોઠવણીનો નથી. સંલેખોની પ્રમુખ અને તેના પૈયાવિભાગોમાં લેખોના સ્વરૂપ મુજબ સંપાદક દ્વારા કરવામાં આવેલ ગોઠવણી આવકાર્ય જ છે. પરંતુ, ઉપર દર્શાવેલ પ્રશ્નોના ઉકેલ અર્થે ગ્રંથોની પરિશિષ્ટમાં વિવિધ નિર્દેશીઓ (Indexes) આ પ્રકારની લેખ-સૂચિઓ માટે જરૂરી બની રહે છે. અહીં સંપાદક માત્ર એક જ લેખ-સૂચિ (સમીક્ષકો, આસ્વાદકો અને વિવેચનલેખોના લેખકો) આપી સંતોષ માન્યો છે. તેના સ્થાને વિવિધ સૂચિઓની જરૂરિયાત ઊભી રહે છે. અહીં સૂચિબદ્ધ શીર્ષકોના આધારે તેની ચાવીરૂપ શબ્દસૂચિ આપવામાં આવી હોત તોપણ બધા જ પ્રશ્નોનું સરળતાથી નિરસન થઈ જાત. આમ છતાં, આટલી મર્યાદાઓ વચ્ચે પણ આ સૂચિ ગુજરાતી ભાષા-સાહિત્યમાં રસ ધરાવતા સૌકોઈ સ્તરના જિબ્બાસુઓ કે સંશોધકો માટે એક મહત્વપૂર્ણ સોત બની જ રહે છે, તે વિશે બે મત નથી જ. નિઃશંકપણે આ એક મૂલ્યવાન સોત

બની જ રહે છે.

અનુભવે જગ્યાયું છે કે પુસ્તક-પસંદઠોકારો (વિષયનિષ્ણાતો) પોતાના વિભાગ માટે ખરીદવાનાં પુસ્તકોમાં વાડુમયસ્થુચિઓની ખરીદી માટે ભાજે જ ભવામણ કરતા હોય છે. એક સર્જનાત્મક સાહિત્યિક કૃતિ જેટલું જ મૂલ્ય ગ્રંથસ્થુચિ ધરાવતી હોવા છતાંય ઉપેક્ષાવૃત્તિ ! ભારતીય વિદ્યાના મૂર્ધન્ય વિદ્યાન રસિકલાલ પરીખ ગ્રંથસ્થુચિઓના ભારે મોટા ઉપાસક હતા. આપણા કવિ, મનીષી, સિંતક, ઉમાશંકરભાઈના શબ્દો ‘અમદાવાદ ભણવા માટે આવ્યો તે પહેલાં ઈડરમાં જેટલાં પુસ્તકોના સંબંધમાં આવેલો તેમાં સૌથી આકર્ષક મારે મન કોઈ પુસ્તક હોય તો તે હેડમાસ્તરના ટેબલ પર પડી રહેતું,

એન. એમ. ત્રિપાઠી કં.નું વિસ્તૃત સૂચિપત્ર. એ પુસ્તક મારે માટે જાહુરી ખજાના રૂપે હતું... જ્યારે પણ અમદાવાદ જવાની તક મળે ત્યારે ગજવામાં દસ રૂપિયા હોય તો દસનાં, પાંચ હોય તો પાંચનાં, કયાં કયાં પુસ્તકો લેવાં તેની યાદીઓ સાથે તૈયાર રહેતો.’ કવિ ઉમાશંકરની આ જીવનપ્રણાલી પોતાના વ્યવસાયમાં જીવંત રહેવા માટે પ્રત્યેક અધ્યાપક કે ગ્રંથપાલનો જીવનમંત્ર બની રહો તેવી અપેક્ષા. આજના વાચનદૌર્બલ્યયુગમાં ગ્રંથસ્થુચિના વાચનની અપેક્ષા કદાચ વધુ પડતી ગણાય ! આમ છતાં તેના વાચકની વ્યવસાયિક નિષ્ઠા મૂર્ખી ઊંચેરી પ્રસ્થાપિત કરવામાં અવશ્ય સહાયભૂત નીવડશે તેમજ સૂચિનિર્માણનો હેતુ સાર્થક થશે તેમ ચોક્કસપણે કહી શકાય.

પરબ સૂચિ – સંપા. ઈતુભાઈ કુરુકુટિયા, પારુલ ટેસાઈ, રમેશ દવે
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ૨૦૦૭, નં. ૪૬૪

‘કામ કામને શીખવે’ : શીખ્યું પરમાણા

જ્યંત મેધાણી

૧૯૬૦થી ૨૦૦૩ : ચુમ્માલીસ વરસ : અર્વાચીન ગુજરાતી સાહિત્યના સમયપટ પરનો આ ગાળો અનેકવિધ રંગો જીલે છે. સાહિત્યનું સર્જન અને સાહિત્યની પ્રવૃત્તિઓ ખીલતાં ચાલ્યાં. સાહિત્યસેવીઓના દાયરામાં નવનવા ચહેરા ઊપસ્યા, ને જૂના કેટલાય કાળના ખોળામાં સમાયા. આવા એક અસાધારણ નહીં, પણ પ્રવૃત્તિથી જરૂર ધમધમતા તવારીઝના ટુકડા સાથે જેણે મજલ જેડી એ ‘પરબ’, પરિષદનું ઘારું મુખપત્ર. ચુમ્માલીસ વરસમાં સોળ જેટલા તંત્રીઓ-સંપાદકો-સહસંપાદકો આવ્યા અને છેલ્યે વર્તમાન ધૂરાવાહકોની પાસે ‘પરબ’નું સુકાન ઠર્યું. આ એ સાહિત્ય-સામયિક છે જેને નગરનાદાસ પારેખ, નિર્ણન ભગત, ભુગુરાય અંજારિયા, જ્યંત કોઠારી, ભોળાભાઈ

પટેલ અને ચન્દ્રકાંત ટોપીવાળા જેવા સુમર્થ સાહિત્યસેવીઓનું સંપાદકીય સેવન પ્રાપ્ત થયું. ‘પરબ’નું સંપાદન એક પરંપરા તરીકે વિકસ્યું અને ઊપસ્યું.

‘પરબ’નાં ચુમ્માલીસ વરસની સામગ્રી સૂચિબદ્ધ બને એ એક રૂડો અવસર છે. આ અગાઉ ‘પરબ’માં પ્રકાશિત અમુક રચના, અમુક લખાણ, અમુક લેખકનાં લખાણો, અમુક વિષયની સામગ્રી શોધવા માટે ‘પરબ’ની ફાઈલો અને વાર્ષિક સૂચિઓ એક પઢી એક ફેંદવી-તપાસવી પડતી હતી. આ એક ‘ઓફસર્ડ’ પરિસ્થિતિ હતી. એનું નિવારણ પરિષદના કલાસવાધ્યાય મંદિરના ત્રણ અધ્યાપકોએ આ સંકલિત સૂચિ આપીને કર્યું છે. કેટલા બધા – આજના અને આવતીકાલના સંદર્ભ-શોધકો આ

બદલ આભારી બનશે !

મુદ્રિત સામગ્રીના ઢગલામાંથી જોઈતી ચીજ શોધવા માટે સૂચિની જરૂર રહે છે. આવાં સાધન કેટલાં સહાયકારી છે એ હવે આપણા અનુભવની વાત છે. એટલે ‘પરબસૂચિ’નું અવતરણ એક હિવસ પણ વહેલું નથી થયું.

કોઈપણ સૂચિ ઉપયોગી ત્યારે સિદ્ધ થાય જ્યારે તેમાં ધારેલી – ઈચ્છિત સામગ્રી સુધી પહોંચવાનાં સરળ દ્વાર આપ્યાં હોય. આવી સામગ્રી-શોધ સરળતાથી અને ઝડપથી થઈ શકે એ વાચક-સહાયક (‘યુઝર-ફેનલી’) તત્ત્વ એ સૂચિનો મુખ્ય ગુણ છે. આ લક્ષણને માપદંડ લેખીને આ સૂચિનું અવલોકન કરી શકીએ.

સૂચિનાં પ્રારંભિક પાનાંમાં આ પ્રકાશનના હેતુ, સૂચીકરણની પ્રક્રિયા, ‘પરબ’ સામયિક વિશેની ભૂમિકા, તેના તંત્રીઓ-સંપાદકોની વીગત, વિશેષાંકોના સિલસિલાની ટીપ, પ્રસ્તુત સૂચિની રૂપરેખા, તેના ઉપયોગ અંગે ઉદાહરણ સહિતનું માર્ગદર્શન વગેરે આપ્યાં છે. કોઈપણ ઉત્તમ સૂચિની હોઈ શકે તેટલી સુરેખ આ પ્રવેશિકા છે. સૂચિની વ્યવસ્થામાં ત્રણ વિભાજન છે : અંકસૂચિ, ફૃતિસૂચિ, કર્તાસૂચિ. આ ત્રણ પ્રવેશદ્વારો મારફત આપણે ઈચ્છિત સામગ્રી સુધી પહોંચવાનું છે.

પહેલો વિભાગ પ્રકાશન કાલાનુસારી અંકસૂચિ છે. તેમાં ૧૯૬૦માં પહેલી ટ્રેમાસિક પત્રિકા પ્રગત થઈ ત્યારથી ૨૦૦૩ના છેલ્લા અંક સુધીના ‘પરબ’ના બધા અંકોની અનુકમણિકાઓ આપી છે. પુસ્તકનાં કુલ ૪૫૦માંથી ૨૫૨ (અરથાતી વધુ) પાનાં તો આ અનુકમણિકાઓ રોકે છે. કોઈપણ પરંપરાગત સૂચિમાં કાલાનુક્રમે ગોઈવેલી અનુકમણિકાઓ આપાય અને એ માટે આટલાં બધાં પાનાં ફણવાય એ સામાન્ય નજરે આશ્રયકારક લાગે. સૂચિનું કામ ઈચ્છિત સામગ્રી સુધી પહોંચાડવાનું છે. આ અંકસૂચિ એ કામ નથી કરતી. તો તેનું પ્રયોજન શું છે ? એની મુલવણી કરવા માટે આ પુસ્તકને માત્ર બીબાંઢાણ સૂચિ ન ગણીને એક મહત્વના સામયિકની વિકાસેરખાનાં આકલન આપનાર ‘ડોક્યુમેન્ટેશન’ લેખે પણ જોવું પડશે. સમકાલીન ગુજરાતી સાહિત્યનાં સામર્થ્ય અને ક્ષીણતાનું એકદર પ્રતિબિંબ ‘પરબ’ના જે જલપાત્રમાં છિલાયું, એ આપણી પાસે ખૂલ્લી શકે એવી શક્યતા આ અનુકમણિકાવલી દ્વારા ઊભી થઈ.

સાહિત્યની તેમજ ‘પરબ’ સામયિકની વિકાસરેખા અવલોકવા ઈચ્છનાર માટે આ અઢીસો પાનાં સાર્થક છે. આ પૃષ્ઠોનું સહજ, સ્વાભાવિક, ઉચિત સ્થાન એટલે અંશો અહીં જરૂર છે.

સંપાદકોની વાચક-સહાયક વૃત્તિનો જ્યાલ આપનાર એક તત્ત્વ પણ ધ્યાન ખેંચનારું છે : જે લખાણના શીર્ષકમાંથી તેની સામગ્રીનો જ્યાલ સ્પષ્ટ ન થતો હોય ત્યારે અત્યંત મિતાક્ષરી નોંધ મૂકીને એ કામ કર્યું છે. દા.ત. દૈવની વિચિત્ર લીલા’ એ લેખનું શીર્ષક તેનો વિષય નથી કહેતું તેથી સંપાદકીય વિવેક એવો થયો છે કે કૌંસમાં નાના અસ્કેરે ‘વિ.સ. ખાંડેકરકૃત નવલકથા ‘યયાતિ’ વિશે’ એ નોંધ આપી છે.

‘પરબ’ની સામગ્રીનું બીજું પ્રવેશદ્વાર છે ‘સાહિત્યસ્વરૂપાનુસારી ફૃતિસૂચિ’. સૂચિઓની પ્રચલિત ગોઈવણી સીધીસંસ્કર, એક કમમાં કક્ષાવાર હોય એવી રસમ છે. સંપાદકોએ વાચકની જ્યાલાએ પોતાની જાતને મૂકીને ‘સાહિત્યસ્વરૂપાનુસાર’ વિભાજન કર્યું : કવિતા, નાટક, નિબંધ... વગેરે. આ એક તર્કપૂર્ણ, સહાયક અભિગમ થયો. સાહિત્યસ્વરૂપાનુસાર આ વિભાજન સમજાય છે – સિવાય કે ‘સંપાદકીય’ અને ‘અભ્યાસલેખ અને અહેવાલ’ એ બે મથળાં. આમાં મુશ્કેલી છે. એક તો, ‘સંપાદકીય’ એ સાહિત્યનું સ્વરૂપ નથી, ‘પરબ’નો એક વિભાગ છે. તેમાં જુદા જુદા વિષયો-મુદ્દાઓ સમાચાર છે. ‘અભ્યાસલેખ અને અહેવાલ’ એ વિભાગમાં જે લખાણો છે એ સાહિત્યના સીમાડા બાહારનાં છે. ઉદાહરણ જોઈએ : ‘સદ્ગત બોગીવાલ સાંડેસરા’ નામે લેખ સંપાદકીય હતો. (આવાં સંખ્યાબંધ લખાણો છે.) સૂચિનો ઉપયોગ કરનાર ઉચિત રીતે ફૃતિસૂચિમાં ભ્રમણ કરીને નિબંધ નામે મથળા હેઠળ ચરિત્રનિબંધ પેટાવિભાગમાં પહોંચશો – અને ખાલી હાથે વળો ! મજા તો એ છે કે આ જ પ્રકારનાં ચરિત્ર-લખાણો ત્યાં છે, કારણ કે એ સંપાદકીય નહોતાં. જ્યારે લખાણો વર્ગીકૃત થાય છે ત્યારે માત્ર તેનો વિષય જ અનુસરવાનો હોય છે, તેનાં માળખાં અવગાણવાનાં હોય છે. ‘અભ્યાસલેખ અને અહેવાલ’ એ વિભાજનમાં સંપાદકોને કદાચ અભિપ્રેત તો છે પ્રકીર્ણ – એટલે કે એમણે નિર્મલાં કોઈ વિષય-ખાનાંમાં ન જઈ શકે તેવાં લખાણો. અહીં વિષય-મથળાં સહાયક તત્ત્વ ચૂકે છે. તેથી ‘સદ્ગત

ભોગીલાલ સંડેસરા' એ લેખ ચરિત્ર-નિબંધના ખાનામાં જઈ શકે તેમ હોવા છતાં, સંપાદકીય લખાણ હોવાને કારણે એ તેની ઉચ્ચિત ગોઈવણી ચૂક્યો.

કટલાક વિષયોનાં સ્વતંત્ર ઝૂમખાં કરવા જેવાં હતાં : દા.ત. પત્રકારત્વ વિષયક લખાણો કોઈ ઘર કે ઘાટ વિનાનાં રહી ગયાં છે. આ સૂચિમાં તો 'પરબ' અને ગુજરાતી સાહિત્ય પરિષદ વિશેનાં લખાણોનો પણ જુદો વિભાગ રાખ્યો ઉચ્ચિત ગણાય. વળી, પુસ્તકોનાં અવલોકનોને વિવેચનનાં લખાણોથી જુદાં તારબ્યાં હોત તો એ વર્ગકરણ વધુ ઉપયોગક્ષમ ('ઇક્શનલ') બનત. અનુવાદો અને સંપાદનો એવા જુદા વર્ગો વિષયલક્ષી ગોઈવણીના અપવાદ બને છે. 'નાટક : એક ચર્ચા' એ નામના લેખનું ખરું સ્થાન વિવેચનનાં લખાણોના મુખ્ય વર્ગમાં છે, પણ અનુવાદ હોવાના કારણે એની ગોઈવણી જુદી થઈ. વર્ગકરણમાં આ લખાણનો વિષય નિઃર્ધારિક બને, એ અનુવાદ છે કે નહીં એ મહત્વનું નથી. એ જ રીતે, સંપાદન : '૧૯૮૬ની શ્રેષ્ઠ વાતાવો' તેનો મુખ્ય રસ તેનો સાહિત્યપ્રકાર છે, સંપાદન હોવું એ નિઃર્ધારિક બાબત નથી. સામયિક-લેખસૂચિઓમાં લખાણનાં કુલ પાનાંનો નિર્દેશ આપવાની સર્વસ્વીકૃત રસમને અનુસરવામાં તર્ક હોત : કોઈ લખાણનું કદ કેવડું છે એ માહિતી વાચક માટે મહત્વની છે. દા.ત. 'અર્વાચીન કથાસાહિત્યમાં શોષિત સમાજ' એ અક્ષયકુમાર ર. દેસાઈનો લેખ છે (પા. ૩૨૫) તેની સામે પાના-કમાંક ૨ દશાંબ્યો છે તેને બદલે એ લખાણ કયા પાને પૂરું થાય છે એ પણ દર્શાવવું એવી રસમ છે. 'ગુજરાતી સાહિત્યમાં ગજલસંદર્ભસૂચિ' એ પ્રકાશ વેગડની સૂચિ કેવડી હશે તેનો અંદાજ, લેખના નામ સામે ૨૦૨ એટલા જ પાના-નિર્દેશ પરથી મળે નહીં. આ બંને ઉદાહરણમાં સાહિત્ય-શોધક માટે લખાણનું કદ જાણવું મહત્વનું છે.

આ સૂચિનું ત્રીજું પ્રવેશદ્વાર છે કર્તાસૂચિ. ઘણાખરા વાચકો ઈચ્છિત લખાણનું ચોક્કસ શીર્ષક યાદ ન રાખી શકે, પણ લેખકનું નામ એમને બહુધા હોઈ હોય. દા.ત. કાકા કાલેલકરનાં બાવીસ લખાણો સૂચિમાં ક્યાં ક્યાં ગોઈવાયેલાં છે તેનો નિર્દેશ આ સૂચિ આપે છે પણ કોઈ ચોક્કસ લખાણ સુધી સૂચિમાં કાલેલકર એ એન્ટ્રી થકી તત્કાળ પહોંચાતું નથી. પહોંચવા માટે અહીંથી અંક-

સૂચિમાં જવાનું રહે છે. કાલેલકરનાં બાવીસેય લખાણોનાં શીર્ષક સૂચિના આ સ્થળે જ આચ્યાં હોય તો સહાયક અભિગમ ઘણો સચવાય. પાનાં વધે, પણ એ લેખે લાગે તેટલો એનો ઉપયોગ છે.

આવી ટીકટીક વિસ્તૃત સૂચિના સહિતારા નિર્માણમાં ત્રણ સંપાદકોના હાથ રણીયમણા નીવડ્યા છે. સંપાદકીય નિવેદન કહે છે એમ 'કામ કામને શીખવે' એવો ભાવ નિર્માણના આરંભકાળે હતો, એવો જ રહેશે તો એમાં શંકા નથી આ સૂચિ પછીના આવા પ્રકલ્પો બહેતર બનશે. સૂચિ-રચનાનાં માનક ધોરણો અને સ્થિર થયેલી રસમોનું નિરીક્ષણ જેમાં થઈ શકે એવી અનેક સૂચિઓ છે. શિકાગો મેન્યુઅલ ઓફ સ્ટાઇલ જેવા સંદર્ભગ્રંથો છે. આ સદા-ઉધારી માર્ગદર્શિકાઓનો ઉપયોગ કરીએ તો શ્રમ સાર્થક બને, ફળશ્રુતિ શુદ્ધ બને. ઉપરાંત, બીબાં-વૈવિધ્યનો મહત્તમ ઉપયોગ કરીને સૂચિની રચનાને વધુ ઉપયોગ-સહાયક બનાવી શકાય. આપણે વિકાસશીલ તબક્કામાં છીએ ત્યારે કામને વધુ ઊજાણાં બનાવવાનો ઉદ્યમ પ્રોત્સાહન માગી લે છે. એવું બર્યું બર્યું પ્રોત્સાહન પામો એટલું સંપાદકોને ગાંઠ બંધાવી શકીએ. અલભતા, અહીં કામ પૂરું થયું નથી; ૨૦૦૩ પછીનાં પાંચ વરસની સૂચિની ૨૦૦૯ની સાલમાં જરૂર રાહ જોવશે.

૫

આપણી વિદ્યાસંસ્થાઓ પાસેથી એવી અપેક્ષા રહે કે વિષય-વિષયની અને મહત્વનાં સામયિકોની સંક્વિત સૂચિ નિયમિત રીતે તૈયાર થતી રહે જેથી આપણા વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ સૂચિના સહાય વિના લાચાર ન બની જાય, પરિણામે એમના પરિપ્રેક્ષ સંકીર્ણ થતા ન જાય, આપણે વિદ્યાવ્યાસંગ વધુ વજૂદવાળો બને. પત્રિમના સંપર્કે યુનિવર્સિટી-સંસ્કારે, વિદ્યાસંસ્થાઓ અને વિદ્યાર્થીઓની પરંપરાઓએ આપણને એટલા પરિપક્વ બનાવ્યા હશે કે વિદ્યાસંવર્ધક આવા અભિગમોની ઉપકારકતા આપણને ગળે ઊતરી હોય. વિદ્યાર્થીઓમાં, શાન-પિપાસુઓમાં, અધ્યાપક-સમુદ્દરાયમાં, ગ્રંથપાલોમાં સૂચિ-સંસ્કાર દઢ બને તો આપણે જ્ઞાનાભિમુખ, જિજ્ઞાસુ સમાજનું બિરુદ્ધ સાર્થક કરશું.

૬

સંદર્ભવિશોષ

અધ્યયનનો આધારસ્તંભ : સામયિક-સૂચિ

જ્યંત મેઘાણી

બીજા વિશ્વયુદ્ધના શોર શર્મી ગયા હતા. તોપના મુખમાં પારેવાં માળા બાંધવા માંડચાં હતાં. જીવનના ઉન્મેષો ફરી વાર કોળતા જતા હતા. વિદ્યાઉપાસનાની પ્રવૃત્તિઓ પણ નવ-સંચાર પામી રહી હતી : પ્રયોગશાળાઓ અને ગ્રંથાલયો, પુસ્તકો અને સામયિકો, ચર્ચા-સભાઓ અને પરિષદ્દો – વિદ્યા-ઉપાર્જનની આ પ્રવૃત્તિઓની વસંત ફરી ખીલી ઉઠી હતી. અમેરિકાના વિદ્યાજગતમાં તો એવો યુગ ઉદ્ય પામ્યો હતો જેનું પ્રાણસૂત્ર હતું ‘પબ્લિશ ઓર પેરીશ’ : અભ્યાસ-સંશોધનનો પરિપાક લખીને પ્રગત કરો, નહીં તો તમારા ક્ષેત્રમાં નામરોષ બનો. ૧૯૪૫ પછીના દાયકાની આ વાત છે.

જે અભ્યાસ થાય, જે નવું સંશોધન થાય એની જાગ સહુ પહેલાં જગતને સામયિકોનાં લખાણો મારફત પહોંચે. વિદ્યાનું પાકેલું ફળ તો પુસ્તક, પણ સામયિકો તેનાં પ્રથમ, હાથવગાં વાહન. જે કાંઈ નવતર વિચાર-રજૂઆત-સંશોધન આકાર લે એ સહુ પ્રથમ સામયિકી લખાણ રૂપે આવે. અનેક પેટા વિષયો – સુક્ષ્મ વિષયો તો એવા હોય કે જે લેખ રૂપે જ રજૂ થાય, સ્વતંત્ર પુસ્તકની તેમાં ગુંજાશ ન હોય. આઈન્સ્ટાઇને જીવનભર લેખો જ લખ્યા, એમનાં સંશોધનો લેખો રૂપે જ જગતને મળ્યાં, એટલે સુધી કે નોબેલ પારિતોષિકનું બહુમાન એ પણ સંશોધન-લેખોને આધારે. પુસ્તક તો એમણે એક જ લખ્યું : ‘હોટ ઈઝ રિલેટીવીટી ?’ એ પણ અવૈજ્ઞાનિક સામાન્ય વાચક માટે ! એક વિજ્ઞાની મિત્રને મારે પૂછવાનું થયું, ‘હવે તમારું પુસ્તક ક્યારે ?’ એમણે બીજા જાણીતા વિજ્ઞાનીનું કથન ટાંક્યું : ‘અમે સંશોધન-લેખો લખીએ, એ લેખો ઉપર બીજાઓ પુસ્તકો લખે !’ નવા વિચારો, નૂતન વિભાવનાઓ,

અવનવાં સંશોધનો, નવાં સર્જનો – આ બધું સામયિકોનાં પાનાંઓ પર પ્રથમ આવે; એમાંનું કેટલુંક જ પછીથી ગ્રંથરસ્થ થાય.

આમ, સામયિકો અને સામયિકી લખાણોનું આગવું મહત્ત્વ પ્રસ્તાપિત છે. સામયિકોમાં પ્રકાશિત થતાં લખાણો, સંવાદો-ચર્ચાઓ-વિવાદોના સંપર્ક અભ્યાસી માટે અનિવાર્ય ગણવાય. જગતમાં અપરંપાર સામયિકી બહાર પડે છે, અને વીસમી સરીના ઉત્તરાર્ધમાં સામયિકોની સંખ્યા વિપુલ બની છે. આથી જે પરિસ્થિતિ સરજાણી છે તેને સાહિત્ય-વિસ્ફોટ કરે છે. હાથવળી ના રહે, મનુષ્યના બસમાં ન રહે એટલી મુદ્રિત સામગ્રીના ગંજ ખડકાવા લાગ્યા.

આ ગંજમાં ખોવાયેલી સોય શોધવી પડે તેવો ઘાટ થાય અને અભ્યવસ્થાને કારણે જ્ઞાન સુલભ ન બને તો તેનો અર્થ નહીં. આ સમસ્યાના ઉકેલ માટે ગ્રંથાલયવિજ્ઞાને સૂચીકરણનો કીમિયો આપ્યો. સૂચિના દોરમાં પરોવાઈને જળવાય તો પાર વિનાની પ્રકાશિત સામગ્રી ઉપયોગક્ષમ બને, માહિતીવળી રહે. પરિણામે, પદ્ધતિમના વિદ્યાજગતમાં સામયિકી લખાણોની સૂચિઓનું નિર્માણ અને પછી તેનો ઉપયોગ એ એક મહત્વની પ્રવૃત્તિ બની. પણ તેની વાત કરતાં પહેલાં ઘરઅંગણાનાં બે ઉદાહરણ લઈને આ લખાણને પીઠિકા આપીએ : ગયે વરસે સામયિક લેખ સૂચિ પ્રત્યક્ષ પ્રકાશન, ૨૦૦૬) બહાર પડી. ૧૯૯૬થી ૨૦૦૦ના પાંચ વરસના ગાળામાં ગુજરાતી સામયિકોમાં મુખ્યત્વે સાહિત્ય વિશેનાં જે લખાણો દટાઈને પડ્યાં રહ્યાં હોત તેવા સંદર્ભો નોંધીને-ગોઠવીને-સંકલિત કરીને આ સૂચિએ આપણાને ધર્યા. શું બન્યું ? હવે પછી આ ગાળાનાં સામયિકોમાંથી અમુક લખાણ શોધવા કોઈને ખાંખાખોળા

નહીં કરવા પડે, અનેક અભ્યાસીઓએ વાચન-સામગ્રીની નવેસર શોધખોળ નહીં કરવી પડે. એ જ રીતે પરબસૂચિ (ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૦૦૭) આવી એમાં પૂરાં ૪૪ વરસ દરમિયાન ‘પરબ’માં પ્રગટ થયેલી સામગ્રીની નોંધ સૂચિમાં સંકલિત સ્વરૂપે રજૂ થઈ. આથી પાર વિનાના અભ્યાસરસિકોને દરેકને નવેસર સાહિત્ય-ખોજના વૈતરામાંથી ઉગાર મળશે. આ ઘટનાઓ અસામાન્ય છે. ‘પ્રત્યક્ષ’ના આ અંકને જે સૂચિ ઐતિહાસિક બનાવશે એ પણ એક એવી જ નક્કર ઉપોયગિતાવાળી ઉપલબ્ધ થશે.

આ સૂચિઓ આપણા અધ્યયનક્ષેત્રના આધારતંત્ર (‘ઇન્ઝારસ્ક્ર્યુર’)નો એક સંભ છે. આ આધારતંત્ર એટલે શું? પ્રયોગશાળાઓ, ગ્રંથાલયો, મુદ્રણાલયો, પુસ્તક-સામયિક-પ્રકાશન, વિદ્ધત્મંડળો, પરિષદો-પરિસંવાદો – આ બધાં થકી જે સંકલિત વ્યવસ્થા ઊભી થાય તેને અધ્યયન-સંચારનું આધારતંત્ર કહી શકીએ. આ બધું હાજર હોય એ સમાજમાં અધ્યયનની પરંપરા પાંગરે, સંગીન બને. જેની વાત આ લખાણમાં પ્રસ્તુત છે એ સામયિકી સાહિત્યની સૂચિ પણ સ્વતંત્ર રીતે એક વિકસિત વિષય છે, તેથી આપણને રસ પડે તેવી, બહુધા અજાહી રહી છે તેવી બે-પાંચ વાતો જ અહીં કરવા ધારી છે.

p

વીસમી સદીના મધ્યાહ્નકાળે ન્યુયોર્કની કોલબિયા યુનિવર્સિટીના ગ્રંથાલયવિજ્ઞાન ભવનમાં એક મુખાળા જુવાનનો અસાધારણ તરવરાટ ધ્યાન ખેંચતો હતો. એની ચમકદાર આંખોમાં કોઈ અંજ્યો દેખાતો હતો. રસાયણવિજ્ઞાનનો સ્નાતક બનીને એ અમેરિકન સેનાતંત્રની એક તબીબી સૂચિ-યોજનામાં કામ કરવા ગયેલો. સૂચિના ક્રિમિયાએ તેના કલ્યાન-જગતમાં ઉત્તેજના-ચિનગારી મૂકી. અવનવી સૂચિ-યોજનાઓ તેના ચિત્તમાં આકાર લેવા માંદી. જેમાં એ જોડાયો હતો એ સૂચિ-પ્રકલ્પ તો પૂરો થયો. એ પોતાની દિશાની ખોજમાં હતો. પોતાની કેડી એઝો તત્કાલ નક્કી કરી લીધી. સામયિકોના ગંજાવર લેખ-સાહિત્યને સૂચિબદ્ધ કરવા વિશેના અનેક વિચારો તેના ચિત્તમાં ઉમ્ભવા લાગ્યા. પણ એવું કામ કરવાની રીતસરની તાલીમ તેની પાસે નહોતી. ઓજારો ખૂટતાં હતાં. પોતે જ્યાં ભણ્યો હતો એ જ કોલબિયા યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત ગ્રંથાલય-વિજ્ઞાન

ભવનમાં અનુસ્નાતક વિદ્યાર્થી બન્યો. પોતાનાં ઓજાર એકઠાં કરવા લાગ્યો. વરસ તો જોતજોતામાં પૂરું થઈ ગયું. સજ્જ સૂચિકાર તરીકે એ બહાર આવ્યો.

એનું નામ યુણન ગારફીલ્ડ.

બ્યાશી વરસે તો મનુષ્યદેહ વૃદ્ધત્વમાં જંપ માગે. પણ ગારફીલ્ડનો ‘સ્પિરિટ’ નિત્ય-યૌવનને વરેલો છે. છેલ્લા પાંચ-છ દાયકાથી ગ્રંથાલય ક્ષેત્રમાં, સૂરીકરણની સૂચિમાં, વિદ્યાસંવર્ધનનાં જગતવ્યાપી મોવડીમંડળોમાં અભિનવ વિચારો, નવતર યોજનાઓ અને અવનવાં દાયિત્વાદુઓ થકી યુણન ગારફીલ્ડ છવાયેલા રહ્યા છે. આ ક્રિમિયાગરે જે વિષય યોજનાઓ કાર્યાન્વિત કરીને વિદ્યાસંવર્ધનની મશાલ જલતી રાખી રેમાંની બે યોજનાઓ સમજવામાં આપણને વિશેષ રસ પડશે.

ધારો કે તમે સમાજશાસ્ત્રના અભ્યાસી છો, અધ્યાપક છો, સંશોધક છો, અથવા ભૂગોળ તમારા વિદ્યાકીય રસનો વિષય છે, કે તુલનાત્મક સાહિત્ય એ તમારું રસક્ષેત્ર છે. આ ક્ષેત્રોમાં જે નવાં ખેડાણો થતાં રહે છે તેનાથી વાકેફ રહેવા તો ઈતેજાર હશો જ, કેટલાંકમાં ઊંડા પણ ઉત્તરવા ઈચ્છશો. તમે વડોદરા-અમદાવાદ-મુંબઈ સરખાં વિદ્યા-મથકોમાં હો તો કહેવા લલચાશો કે તમારા ખપનાં સામયિકો જોઈ લઈ શકો છો. પણ તમે ભાવનગર, સુરત કે પાટણ જેવા મથકમાં હો તો? કોઈ નાના ગામની કોલેજમાં ભણાવતા હો તો? તો, સમસ્યા થાય કે એ એ વિષયનાં સામયિકોમાં શું છપાયું છે એ કેવી રીતે જાણવું? તમારા ખપના લેખો મેળવવા કર્યાંથી? તમારા વિષયના અદ્યતન પ્રવાહોથી વાકેફ કેમ રહેવું?

યુણન ગારફીલ્ડને અભ્યાસીઓની આ સમસ્યાની સમજ હતી. એમને જાણ હતી કે ગંજાવર ગ્રંથાલયોમાં પણ બધા વિષયોનાં જગતભરનાં ઉત્તમ સામયિકો જોવા મળવાં અશક્ય. ભૂગોળનાં પચ્ચીસેક ચુંટેલાં કે સાહિત્યનાં સોએક ચુંદાં સામયિકો કોઈ એક જગતાએ જોવા ન જ મળે. કોઈ અભ્યાસી પોતાની યુનિવર્સિટીના ગ્રંથાલયમાં જઈને આવાં પચ્ચીસ કે સો સામયિકો જોઈ ન શકે, તેમાંથી પોતે શું વાંચવું એ નક્કી ન કરી શકે, એ બધું વાંચવા માટે ગ્રંથાલયમાં બેસવા અવકાશ ન હોય.... જ્ઞાનના વિસ્કોટનો આ વિલક્ષણ કટ્ટિત કિસ્સો.

ગારફીલ્ડ શો ઉકેલ વિચાર્યો? સાવ સાદો. દરેક

વિષયનાં દુનિયાનાં પ્રતિજ્ઞા પામેલાં સામયિકો પસંદ કર્યા – અત્યંત ચુસ્ત માપદંડોને આધારે પસંદ કર્યા – ને એ સામયિકોના દરેક અંકની માત્ર અનુકમણિકાઓ આપતું સામયિક શરૂ કર્યું : ‘કરન્ટ કન્ટેન્ટ્સ’ . સાત વિષય-વિભાગો કર્યા, દરેકનું ‘કરન્ટ કન્ટેન્ટ્સ’ અલગ. ઉદાહરણ લઈએ : ‘કરન્ટ કન્ટેન્ટ્સ’ની આદર્શ એન્ડ હ્યુમેનિયાની આવૃત્તિમાં એ વિષયકોનાં ૧૧૨૦ કેટલાં ઉત્તમ સામયિકોના તાજા અંકોનાં સાંકળિયાંઓ આપ્યાં હોય : દર પંદર હિવસે ‘કરન્ટ કન્ટેન્ટ્સ’નો નવો અંક તમારા ટેબલ પર હાજર થાય અને એક ઉદાહરણ નજરે (‘એટ એ ગ્લાન્સ’) જાણી શકો કે તમારી પસંદગીનાં, દા.ત. સાહિત્ય વિષયનાં, સામયિકોનો તાજા અંકોમાં શું પ્રગત થયું છે. સાહિત્યનો કોઈ અભ્યાસી આવાં પાંચ સામયિકો પણ મગાવી શકત ? અથવા કોઈ લાઈબ્રેરી પાસે એમાંનાં દરેકનાં પણ આકરાં લવાજમ ભરવાની ત્રેવડ હોત ? અને તો તમે તમારા વિષયનાં અધ્યતત્ત્વ લખાણોથી, નવા ઉન્મેષોથી વાકેફ રવ્યા ગણાત ? શાનનું વિશ્વ કેટલું વિસ્તૃત છે, અને તેના અભ્ય આચમનથી પણ આપણે કેટલા. વંચિત છીએ તેનો સર્વ પહેલો ઘ્યાલ ગારફીલ્ડના આ નવલ અભિયાને આપો.

બેર, ‘કરન્ટ કન્ટેન્ટ્સ’નો અંક તો તમારા ટેબલ પર આવ્યો, તમારા વિષય સાહિત્યને લગતાં પસંદગીનાં થોડાં સામયિકોનાં કેટલાંક લખાણો તમારા રસનાં છે એ તમે જાણ્યું. □ પણ હવે ક્યાં જવું આ લેખો મેળવવા ? ગારફીલ્ડની યોજનામાં એના પણ બે વૈકલ્પિક માર્ગો હતા : એક, લેખકને લેખની નકલ માટે વિનંતી કરવી. (સરનામાં પણ આપ્યાં હોય.) પણિમના દેશોમાં અભ્યાસ-સંશોધનના લેખોની નકલો આપવા-મોકલવાનો અભ્યાસીઓ વચ્ચે સૌજન્ય-શિરસ્તો છે. બીજો રસ્તો : ‘કરન્ટ કન્ટેન્ટ્સ’ની પ્રકાશક-સંસ્થા પણ લેખની નકલ કિંમત લઈને પૂરી પાડે છે. અરે, કેટલાક સચિત્ર લેખો તો સામયિકનાં પાનાં ફાડીને પૂરાં પાડવાની વ્યવસ્થા પણ છે !

‘કરન્ટ કન્ટેન્ટ્સ’ના અંકને છેડે એ અંકમાં સમાવેલી અનુકમણિકાઓનાં લખાણોની અત્યંત સહાયક સૂચિઓ આપી હોય છે. ઉદાહરણ : અમુક લેખકનું લખાણ છે કે નહીં એ જોવા લેખક-સૂચિ; અમુક વિષયનો લેખ છે કે

* અભ્યાસ / સંશોધનનાં લખાણોનાં શીર્ષકો એમના વિષયને આપેણે રહુટ કરે તેવાં બહુધા હોય છે.

નહીં એ જોવા માટે વિષય-સૂચિ : દાખલા તરીકે, ભારતીય અંગેજ સાહિત્ય. ઉપરાંત, લેખોનાં શીર્ષકમાં વપરાયેલ ચાવીરૂપ શબ્દો(કી-વર્ડ)ની પણ સૂચિ. આ ત્રણ પ્રવેશદ્વારોમાંથી એક આપણા લક્ષ્ય સુધી પહોંચાડે જ.

‘કરન્ટ કન્ટેન્ટ્સ’નું પ્રકાશન શાન-પિપાસુ અભ્યાસીઓ માટે એક વરદાન હર્યુ. સામયિક-લેખોના સાહિત્ય-વિસ્ફોટે નિર્મલી એક વિલક્ષણ પરિસ્થિતિનો ઉકેલ જાણે ચપ્ટી વગાડતાં લાધી ગયો. અમેરિકામાં ચોતરફથી પ્રતિભાવ ઊઠા : અરે, આવી સાદીસીધી યોજના આપણને કેમ સૂજી નહોતી ? અગાઉનાં અભ્યાસો-શોધો-સંશોધનો વર્તમાન સંશોધકની જાણ બહાર રહી જાય, અન્ય વિદ્વાનોનાં તત્કાલીન કાર્યોથી એ વાકેફ ન હોય – એવી સંભાવનાને ‘કરન્ટ કન્ટેન્ટ્સ’ જેવા હાથવગા સાધને નિવારી દીધી, એ સંશોધન-જગતનો નાનોસૂનો લાભ નહોતો. જો દહાડે ‘કરન્ટ કન્ટેન્ટ્સ’ અભ્યાસીનું અનિવાર્ય સાથી બન્યું, શાનની દુનિયાની બારી બન્યું. ત્રીજા વિશ્વનાં અને સામ્યવાદી લોખંડી પડદાની પણીતનાં રંક રાષ્ટ્રોના સાધન-સામગ્રી-વિભોષણ વિદ્વાનોને શાન-સંપર્કનું એકમાત્ર સાધન સાંપડયું. આ એક પ્રકાશને વૈશ્વિક શાન-સીમાડાસોને વિસ્તૃત કરી દીધા, શાનના વ્યાપક વિતરણ અને વિસ્તરણનાં નવાં પરિમાણો ખોલી આપ્યાં. ‘કરન્ટ કન્ટેન્ટ્સ’ મુદ્રિત સ્વરૂપે તો મળે જ છે, પણ ફ્લોપી ડિસ્ક પર અને ઇન્ટરનેટ પર પણ લક્ષ્ય છે.

યુઝન ગારફીલ્ડે ‘કરન્ટ કન્ટેન્ટ્સ’ નામનું સાવ સાદું વાગતું સાધન પ્રયોજને એક ‘ઇન્નોવેશન’ વિદ્યાજગતને આપ્યું. પણી સામયિકી લખાણોના સૂચીકરણની વિચારણા એમને એક બીજા કટ્યનાશીલ અભિગમ ભાગી લઈ ગઈ. એ બીજું નવલ અર્પણ હતું ‘સાયાટેશન ઇન્ડેક્સ.’

લેખોની કોઈપણ સૂચિ શું કરે છે ? એ આપણને અમુક લેખકના અમુક લખાણની અને અમુક વિષયના લખાણની ભાળ આપે છે. આ સૂચિ લેખક-નામ અનુસાર વર્ણનુકે ગોઠવાયેલી હોય. સૂચિમાં સમાવિષ્ટ સો, બસો, હજાર... લખાણોમાંનાં કેટલાંક પરસ્પર કોઈ સંબંધ ધરાવતાં હોય તો એ દર્શાવવાનું શક્ય નથી હોયનું. એક લેખકે છેડેલા એક મુદ્રાની કે વિષયની ચર્ચા કરતાં બીજાં લખાણો તેના લેખકના નામ મુજબ યથાસ્થાને, જુદી જુદી જ્યાયાએ ગોઠવાયેલાં હોય તેમાંથી એ મુદ્રાને લગતાં

લખાણો શોધવાનો ઉદ્યમ કરવાનો રહે છે. જેમ સૂચિ મોટી તેમ તેનો કુંગર ખોદવાની મહેનત વધુ. ઉદાહરણથી સમજાએ :

કોઠારી, જયંત, નરસેંહનાં પદો : કર્તૃત્વનો કોયડો, ઉદ્દેશ, મે, જુલાઈ ૧૯૮૮.

આ લેખ પ્રકાશિત થયા પછી એ જ વિષય પર અન્ય લેખકોએ લેખો લખ્યા : સમર્થનમાં, પ્રતિવાદ રૂપો, વિસ્તરણ લેખો, અનુસંધાનમાં, અલગ દસ્તિકોણથી. કલ્પિત ઉદાહરણ તરીકે, આવાં દસ લખાણો પ્રકાશિત થયાં. (કલ્પિત કે) જેના લેખકો હશે કનેરિયા, ગોહિલ, જોશી, ઠાકોર, દુમસિયા, તલાટી, પટેલ, નાયક, શ્રીમાળી, અને શાહ. આ બધા નિર્દેશો લેખકનાં નામ અનુસાર ગોઠવાયેલી સૂચિમાં આ દસ નામોના યથાસ્થાને ગોઠવાયા હશે. હવે, એક અભ્યાસી કોઠારીના મૂળ લેખના અભ્યાસને અનુસરીને લખાયેલા આ લેખોની ભાગ મેળવવા મયે છે, પણ એ દસ લેખો શોધવાની મથુરામણથી હારી બેસે, પોતાનો અભ્યાસ પડતો મૂકે, પૂરી ચર્ચાના સંદર્ભો વિનાનો રાખે, પેલા દસ લેખકોનાં પ્રતિપાદનો, પ્રતિવાદો, વિસ્તરણો, નવીન દસ્તિકોણો વગેરેથી વાકેફ થયા વિના ચાલે – આવી સંભાવનાઓ રહે. આવા અંધકારમાં અટવાતા અભ્યાસીને દીવો ધર્યો ગારઝીલના એક અભિનવ નુસાખાએ. ગારઝીલે આના ઉકેલ રૂપે ‘સાયટેશન ઇન્ડેક્સ’ નામ નવીન પ્રકારની સૂચિ પ્રયોગું. શું કર્યું તેણે ? તો, કોઠારીના લેખની ‘એન્ટ્રી’ આપી તેની નીચે જ પેલાં દસ લખાણોના સંદર્ભો ગોઠવી આયા. કયો તર્ક તેમાં ? તો કહે, ‘સાયટેશન’નો. એ દસ લેખોએ કોઠારીને વીગતથી ‘સાઈટ’ (cite) કર્યા, એટલે કે ટાંક્યા, એમના મુદ્દાને આધાર બનાવીને ચર્ચા કરી. આ ‘સાયટેશન’ને નિઝાર્યક તત્ત્વ ગણીને દસ લેખોના નિર્દેશો કોઠારીના મૂળ લેખની ‘એન્ટ્રી’માં ગોઠવી આયા, આમ –

કોઠારી, જયંત, નરસેંહનાં પદો : કર્તૃત્વનો કોયડો, ઉદ્દેશ, મે, જુલાઈ ૧૯૮૮.

કનેરિયા [ના લેખની ‘એન્ટ્રી’]

ગોહિલ [ના લેખની ‘એન્ટ્રી’]

જોશી....

ઠાકોર... વગેરે...

શું બન્યું એ સ્પષ્ટ છે : જે લેખોના નિર્દેશો સામાન્ય

સૂચિની કક્ષાવાર ગોઠવણીમાં જુદીજુદી જગ્યાએ મુકાયા હોત એ ‘સાયટેશન ઇન્ડેક્સ’ (‘નિર્દેશસૂચિ’કહીશું ?)માં એક જૂમણા(cluster) રૂપે આવ્યા. કોઠારીના લેખના અનુસંધાનમાં થનાર નવો અભ્યાસ બધા જ સંદર્ભોને આવરીને ચાલશે. ખ્યાલ આવશે કે આ ‘સાયટેશન ઇન્ડેક્સ’ કેટલું મોટું સહાયક (‘યુઝર-ફેનલી’) તત્ત્વ ધરાવે છે.

સૂચિ-નિર્માણનું કામ બહુધા યંત્રવત્ત હોય છે. લેખના વિષયને પારખીને તેની ઉચિત સૂચિમાં મૂકવાની નોંધ (‘એન્ટ્રી’) તૈયાર કરવા અન્ય કોઈ કૈશાલની સૂચિકાર પાસેથી અપેક્ષા નથી હોતી. પણ આ નિર્દેશ-સૂચિ (‘સાયટેશન ઇન્ડેક્સ’) તૈયાર કરનારે લેખની સામગ્રી વિવેકપૂર્વક તપાસવાનો ઉદ્યમ કરવાનો રહે છે.

‘સાયટેશન ઇન્ડેક્સ’ની સૂક્ષ્મ સંભાવનાઓ, તેના વિવિધ ઉપયોગો અને ફળશુદ્ધિમાં ઊંડા ઊત્તરવાનું અહીં પ્રયોજન નથી; પણ ગારઝીલે આ વિશિષ્ટ અભિગમથી અધ્યયન સંશોધનની દિશામાં કેવાં નવલ દ્વાર ખોલ્યાં છે તેનો ખ્યાલ મેળવવો રસપ્રદ રહેશે.

ગારઝીલે ‘સાયટેશન ઇન્ડેક્સ’ને એવી વૈજ્ઞાનિક પરિસ્થિતી પર મૂક્યો છે કે તેના અતિ-વિકસિત (‘સોલિસ્ટિકેટ્ટ’) ઉપયોગો એ પ્રયોગ શક્યા છે. ‘સાયટેશન ઇન્ડેક્સ’ વધી કોઈપણ સંશોધક / વિજ્ઞાનીના કામનું શ્રેદ્ધ મૂલ્યાંકન કરવાની પદ્ધતિઓ એમણે વિકસાવી છે. ઢા.ત. જે સંશોધકનું કાર્ય અન્ય વિદ્વાનોનાં લખાણોમાં જેટલા વધુ ઉલ્લેખ પામે (‘સાઈટ’ થાય) એટલું તેનું મહત્વ વધુ. બીજાઓને તેનું કામ ચર્ચા જેવું લાગે છે એ હક્કિકત જ તેનું મહત્વ નિર્દેશો છે. ગારઝીલનું આ તારણ કસોટીમાં સાચું દર્દ્યું છે અને વિદ્વત્જગતમાં એમણે આપેલો આ માપદંડ સ્વીકાર પામ્યો છે. લેખ-સૂચીકરણ (‘ઇન્ડેક્સિંગ’)ની વિદ્યા સાથે આંકડાશાસ્ત્રને સાંકળીને ‘બિલ્બિલોમેટ્રીક્સ’ નામે નવી જ્ઞાન-શાખા ખીલી છે જેને આધારે સંશોધનોનાં અને સામાન્યોની ગુણવત્તાનાં માપન શક્ય બન્યાં છે. ‘કરન્ટ કન્ટેન્ડ્સ’નો દરેક અંક ગારઝીલના તંત્રીલેખ સાથે ઉઘડે છે. એમાં એ વિદ્યાજગતની અવનવી વાતો કરે છે. દર વરસે નોબેલ-નવાજેશોની મોસમ બેસે એ પહેલાં એ સાલભરનાં ‘સાયટેશન’ને આધારે અનુમાનો પણ રજૂ કરે છે કે કયા

વિજ્ઞાનીનું કામ નોબેલ પારિતોષિકના બરનું છે. આવી આગાહીઓ ઘણી વાર વજૂદવાળી ઠરી છે. ‘સાયટેશન ઇન્ડેક્સ’ને આધારે વિદ્વદ્ભોગ સામયિકોના તંત્રીઓ પણ પોતાનાં સામયિકોની ગુણવત્તા અંગેનાં તારણો મેળવે છે.

ગારફીલ્ડની સંસ્થા ઇન્સ્ટીટ્યુટ ફોર સાયન્ટીઝીક ઇન્ફરમેશનમાં સૂચિકારોની એક જબરી ફોજ કમ્પ્યુટરો પર સૂચીકરણનું કામ કરતી રહેતી હોય છે. છેલ્લા ત્રણેક દાયકામાં સામયિકોમાં ઠલવાયેલા અભ્યાસ-સંશોધનના લેખોની સંખ્યા ખાસ થંભાવી દે એવી વિપુલ થતી ગઈ છે. ગારફીલ્ડના સૂચિકારો આ સાહિત્યધોધને પોતાના માહિતી-બંડાર (‘ટેટા-બેર્ટા’)માં સમાવે છે, સંક્રિતે છે, વર્ગીકૃત કરે છે, તેનું પુષ્ટકરણ કરે છે, અને - સહૃદ્ધિ મહત્વનું - તેનો સતત પ્રસાર કરે છે. કારણ કે જગતભરના અભ્યાસીઓ - સંશોધકો તેની રાહ જોઈને બેઠા હોય છે. અને, હા, ગારફીલ્ડની ‘સંસ્થા’ કોઈ સખાવત પર ન નભતી નથી, પણ પોતાની સૂચિ-સેવામાંથી જ મબલક કમાણી કરે છે. એમની સૂચિ-સેવા જગતમાં અનિવાર્ય બની ગઈ છે અને એના આકરા દામ સંશોધકો અને એમની સંસ્થાઓ ચૂકવે છે.

યુજ્ઞન ગારફીલ્ડ ગ્રંથપાલોના ગુરુ છે, માર્ગદર્શક છે. ઉત્તમ સૂચિ-સેવા કેવાં ઉત્કૃષ્ટ પરિણામો આપી શકે, સૂચિ-સેવાને કેવો માનવંતો દરજાનો મળી શકે એ એમજો ચરિતાર્થ કરી બતાવ્યું, અને સાથે એ પણ બતાવ્યું કે સંશોધકો અને ગ્રંથપાલો પાસેથી દુનિયા કેવી ઊંચી અપેક્ષા રાખે છે. એમનાં બે જ પ્રદાનોનો ઉપરછલો પરિચય અહીં શક્ય બન્નો, પણ સૂચિના કસબની અન્ય શક્યતાઓ પણ એમજો અજમાવી છે. આજે બ્યાશી વરસની વયે વશથાક્યે અવનવાં કામ તે કરતા રહે છે. ‘ધ સાયન્ટીસ્ટ’ નામનું એક વિજ્ઞાન-સમાચારપત્ર દર અઠવાડિયે બે અંકમાં વિજ્ઞાનજગતની પ્રવૃત્તિઓ, શોધખોળો, પ્રકલ્પો વગેરેની રસપદ વાતો પીરસે છે, એ ગારફીલ્ડના તંત્રીપદ હેઠળ. વિજ્ઞાની, ગ્રંથાલય ક્ષેત્રની અનેક સંસ્થાઓમાં એમનું માનાર્થ સ્થાન છે. પરિષદો-પરિસંવાદો-વિદ્વત્કુંડળોના મંચ એમની ઉપાયિતિ થકી શોભિતા બને છે, એમની વાણી જે અવનવાં તાજગીમય દંદિંદિંહુંદો રજૂ કરતી રહે છે એ સાંભળવા વિદ્વાનો આતુર હોય છે. દેશ-વિદેશનાં અનેક ચન્દ્રકો ને સન્માનો એમના સીનાને શોભાવે છે.

‘સૂચિપુરુષ’ પ્રકાશ વેગડનું સૂચિક્ષેપ્ર પ્રદાન

મહિબાઈ પ્રજાપતિ

ગ્રંથસૂચિ ક્ષેત્રે અંગેજુ, મરાઠી, હિન્દી, બંગાળી વગેરે ભાષાઓની તુલનાએ ગુજરાતી ભાષા-સાહિત્યને સૂચિબદ્ધ કરવા માટે રાજ્યસ્તરે કે સંસ્થાગત ધોરણે અપેક્ષિત ધ્યેયનિષ્ઠ પ્રયાસો નહિવત્ત માત્રામાં થયા છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, રાજ્યની યુનિવર્સિટીઓ કે રાજ્ય ગ્રંથાલય નિયમકની કચેરીની અણમોલ સાંસ્કૃતિક ધરોહરની વાક્યમયસૂચિગત નિયંત્રણ પ્રત્યેની ઉપેક્ષાવૃત્તિ કે ઉદાસીનતા ભાવિ પેઢી માટે અભિશાપ સમાન ગણાશે. ગુજરાતી ભાષાના શાત અને પ્રથમ મુદ્રિત પુસ્તક ઇમંડ કૃત ‘ઈલસ્ટ્રેશન્સ ઓફ ધી ગ્રામેટિકલપાર્ટ્સ ઓફ ધ ગુજરાતી, મહરંગ ઓન્ડ ઇંગ્લિશ

લેંગેજિસ - ગુજરાતી વ્યાકરણ’ (૧૮૦૮)થી આજદિન સુધી ગુજરાતી ભાષામાં કયાં કયાં પુસ્તકો પ્રગટ થયાં તેની શાસ્ત્રીય અને અવિકૃત માહિતી પૂરી પાડતો કોઈ એક સંખ્યા સોત આપણે તૈયાર કરી શક્યા નથી. ગુજરાતી ભાષા-સાહિત્યના જિજ્ઞાસુઓ માટે આથી મોટી બીજી કઈ વિડમબના હોઈ શકે ? આ ક્ષેત્રે પ્રાય: વક્તિગત ધોરણે થોડાક પ્રયાસો થયા છે, જેમાં એલેક્ઝાન્ડર ગ્રાંટ, કીફુભાઈ દેસાઈ, પ્રકાશ વેગડ, કિરીટ ભાવસાર, કનુભાઈ શાહ, નવલસિંહ વાધેલા, ચી. ના. પટેલ, ધીરુભાઈ ઠાકર, રમણ સોની, મહિબાઈ પ્રજાપતિ વગેરે અને સંસ્થાગત પ્રયાસો પૈકી ગુજરાત પુસ્તકાલય મંડળ; સાહિત્ય અકાદમી, નવી

દિલ્હી; સેન્ટ્રલ રેફરન્સ લાઇબ્રેરી, કોલકાતા વગેરે ઉલ્લેખનીય છે. પરંતુ સમગ્ર ગુજરાતી સાહિત્યને ધ્યાને લેતાં આ બધા પ્રયાસો અપર્યાપ્ત ગણાય. ગુજરાતી ભાષા-સાહિત્યને આજે જરૂર છે કેમ્બ્રિજ બિલ્બિઓગ્રાફી ઓફ ઇન્ડિયન લિટરેચર (પાંચ ખંડ, ત્રીજ આવત્તિ), બિટિશ નેશનલ બિલ્બિઓગ્રાફી, શંકર દાતે કૃત મરાઠી વાર્ડમયસ્કૂચિ જેવા ગ્રંથો તૈયાર કરવા માટે પદ્ધતિસરના સાતત્યપૂર્ણ પ્રયાસો અને સંસ્થાગત માળખાની. ગુજરાતમાં આજે એનો સંદર્ભ અભાવ છે.

ગુજરાતમાં ગ્રંથસૂચિકાર્ય કેતે વ્યક્તિગત ધોરણે જે કોઈ પ્રયાસો થયા છે, તેમાં કર્મઠ સૂચિવિદ્ય પ્રકાશ વેગડનું પ્રદાન ગુજરાત્મક અને પરિમાળાત્મક દાખિએ શિરમોર રહ્યું છે. તેમણે અનેકવિધ ઝંજાવતો વચ્ચે રહીને પણ વૈવિધ્યપૂર્ણ અને શાસ્ત્રીય વાર્ડમયસૂચિઓ તૈયાર કરીને ગુજરાતી સાહિત્યને જ્ઞાનસાધન-સમૃદ્ધ કર્યું છે. તેમના દ્વારા પ સ્વતંત્ર સૂચિગ્રંથો, અંદાજિત રૂપ ગુજરાતી સારસ્વતો અને વિવિધ વિષય સંબંધી ૧૫ વાર્ડમયસૂચિઓનું સંપાદન-પ્રકાશન કરવામાં આવ્યું છે, જેની કુલ અંદાજિત પૂર્ખસંખ્યા ૧૬૦૦થી અધિક છે. આ ઉપરાંત ‘જાહેર ગ્રંથાલય’ વિશે સુચિંતનીય ગ્રંથ, ગ્રંથાલય વિજ્ઞાન વિષયક ૨૫ જેટલા વિશાદ વેખોની રચના પણ એમનું પ્રદાન છે. તેમની સૂચિઓને વિવિધ વિદ્વાનો દ્વારા આવકાર કે સમીક્ષા સ્વરૂપે ૧૭ જેટલા પ્રતિભાવો સાંપર્ક્યા છે. તેમના સમગ્ર કૃતિત્વની વિસ્તૃત માહિતી તેમના દ્વારા સંપાદિત સૂચિ પ્રકાશ વેગડની સાહિત્યસૂચિઓની સાહિત્યસૂચિ અને અન્ય લેખન-વિવેચન સંદર્ભો. (૨૦૦૭) દ્વારા મળી રહે છે. શ્રી વેગડ ગુજરાતના પ્રથમ કર્મશીલ સારસ્વત ગ્રંથાલયી છે જેમની વાર્ડમયસૂચિ સંબંધી આવી સ્વતંત્રપુસ્તિકા પ્રકાશિત થઈ હોય ! ગ્રંથસૂચિ કેતે પ્રકાશભાઈ ગુજરાતના એકલલીર ગ્રંથાલયી છે. પ્રકાશભાઈ એટલે મરાઠીના શંકર દાતે.

પ્રકાશભાઈની પ્રથમ સાહિત્યસૂચિ નહાનાલાલ કવિ સાહિત્યસૂચિ ‘ગ્રંથ’ સામયિકના વર્ષ ૧૪.૬ (૧૬૨), જૂન-૧૮૭૭માં પ્રગટ થઈ. ગુજરાતી સાહિત્યની એ પ્રથમ શાસ્ત્રીય ‘સર્જક સંદર્ભસૂચિ’ છે. પરંતુ ગ્રંથસ્વરૂપે તેમની પ્રથમ પ્રકાશિત વાર્ડમયસૂચિ ગુજરાતી મહાનિબંધ

સંદર્ભસૂચિ : ૧૮૫૭-૧૮૭૭ (પ્રથમ આવૃત્તિ ૧૮૭૮, દ્વિતીય આવૃત્તિ ૧૮૮૪) છે, જેમાં ગુજરાતી ભાષા-સાહિત્યના ૪૬૪ શોધપ્રબંધોની માહિતી વર્ણવવામાં આવી છે. આ બધા મહાનિબંધો ગુજરાત, ભારતનાં અન્ય રાજ્યો અને વિદેશોની યુનિવર્સિટીઓમાં પીએચ.ડી.ની ઉપાયિ હેતુસર રજૂ કરવામાં આવ્યા હતા. પ્રત્યેક સંલેખની માહિતીનો વ્યાપ, વિષયવસ્તુની ગોઠવણી અને ગ્રંથના અંતમાં આપવામાં આવેલી વિવિધ સૂચિઓ ધ્યાનાર્થ બની રહે છે. આ સૂચિ ગુજરાતી ભાષાસાહિત્ય ક્ષેત્રે થયેલ સંશોધનોની વિકાસરેખાનો આવેલ પ્રસ્તુત કરે છે. તેમજ સૂચિ-જિજ્ઞાસુઓ કે સંશોધકોને સંશોધનનો વિષય પરસંદ કરવા માટે તેમજ કયા વિષયક્ષેત્રમાં વતા કે ઓછા પ્રમાણમાં સંશોધન થયું છે તેની પણ સહેજમાં માહિતી પૂરી પાડે છે. પરિણામે બેવડાતાં સંશોધનો અટકાવી શકાશે. પરંતુ આવી મૂલ્યવાન સૂચિ તૈયાર કરવા પાછળના મૂળભૂત હેતુઓના પરિપાલન પ્રત્યે આપણા સંશોધકો કે માર્ગદર્શકો ખૂબ ઓછું ધ્યાન આપતા જોવા મળે છે. આ સંબંધી ટકોર કરતાં પ્રસ્તુત ગ્રંથને આવકારતાં હરિવલ્લભ ભાયાણીએ નોંધું છે કે ‘જે કામ પ્રાથમિક છતાં મૂળભૂત ઉપયોગિતાવાળું, વિશ્વવિદ્યાલયોનાં કાર્યાલયો દ્વારા નહીં તો તેમના ગુજરાતી વગેરે વિભાગો દ્વારા ક્યારનુંય થવું જોઈનું હતું તે પ્રકાશ વેગડે અંગત રુચિથી કર્યું... આનાથી આપણા પીએચ.ડી.લક્ષી સંશોધનકાર્યના પક્ષાધાતનો ઉપચાર કરવાનું એક નાનું પણ મૂલ્યવાન પાયાનું સાધન પ્રાપ્ત થાય છે.’ પ્રકાશભાઈ સૂચિ-સંપાદનકાર્યની સાથેસાથે તે તે વિષયનો ઊંડો અભ્યાસ પણ કરે છે અને તે વિષયક્ષેત્રની વિશેષતાઓ, અને મર્યાદાઓ તરફ પણ આંગળી ચીંઘવાનું ભૂલતા નથી.

એમનો બીજો મહત્વપૂર્ણ સૂચિગ્રંથ છે ગુજરાતી સાહિત્યસૂચિ : મધ્યકાળ (૧૮૮૪) જેને જ્યંત કોઈનીએ ‘મધ્યકાલીન સાહિત્યના મહાલયનો ભોમિયો’ તરીકે નવાજેલી છે. અને પ્રકાશભાઈના કાર્યથી પ્રભાવિત થઈ તેમને ‘ગુજરાતી સાહિત્યના સૂચિપુરુષ’ કહ્યા છે. પ્રસ્તુત સૂચિ ગુજરાતી સાહિત્ય પરિષદ્ધના કોશ કાર્યાલયને ગુજરાતી સાહિત્ય કોશ (પ્રથમ ખંડ : મધ્યકાળ)ના સંપાદનકાર્યમાં ઘણી મદદરૂપ નીવડેલી. અહીં તેમણે ૭૦૦

જેટલા મધ્યકાળીન કવિઓની કૃતિઓ અને તે ઉપર થયેલ સંશોધનો, સમીક્ષાઓ, આસ્વાદો વગેરે સંબંધી અંદાજિત ૪૦૦૦ જેટલા સંદર્ભોની વિગતો અનેકવિધ સ્લોતોમાંથી ચીવટપૂર્વક શોધીને અહીં દાખ્યપૂતું રીતે ૨૪૪ કરી છે. મધ્યકાળીન ભાષાસાહિત્યના સંશોધકોને આ સૂચિ દીવાદાંડીની ગરજ સારશે. આ એક ધ્યેયનિષ્ઠ ભગીરથ કાર્ય છે. અને નોંધનું રહ્યું કે સમગ્ર મધ્યકાળીન ભારતીય સાહિત્ય કર્તૃત્વ સંબંધી અનેકવિધ સમસ્યાઓથી ગ્રસ્ત છે જેનો ઉકેલ એ સાહિત્યસંશોધકોનો પ્રશ્ન છે. સૂચિકાર પ્રકાશિત કૃતિના માહિતીસોતના આધારે જ તેને સૂચિબદ્ધ કરતો હોવાથી કવચિત્ એક જ નામવાળા વિવિધ કર્તાઓની કૃતિઓ પર્યાપ્ત માહિતીના અભાવે ઊલટ-સૂલટ નોંધાઈ જવાની શક્યતા રહે છે. જેથી આ પ્રકારની આ સૂચિની કેટલીક મર્યાદાઓના મૂળાં મધ્યકાળીન સાહિત્યની સમસ્યાઓ કારણભૂત છે, નહીં કે સૂચિકારની અજ્ઞાનતા કે મર્યાદા. જ્યાંત કોડારીનું આ સંબંધી નિરીક્ષણ ધ્યાનાર્હ છે : ‘પ્રકાશભાઈના સામગ્રી સંચયનો વ્યાપ ઘણો મોટો છે એ તરત દેખાઈ આવે એવું છે. અનેક વિરલ ગ્રંથો અને સામયિકોની સામગ્રી અહીં નોંધાયેલી મળે છે તે બતાવે છે કે એમણે સહજપ્રાપ્ત સામગ્રીનો જ આધાર લઈને ચલાયું નથી. જૂનાં પ્રકાશનોને સંઘરણાં ગ્રંથાલયો સુધી પણ એ પહોંચ્યા છે. પ્રકાશભાઈએ એક સર્વગ્રાહી અશેષ સૂચિનું જાહેર લક્ષ્ય રાખ્યું છે.’

પ્રકાશભાઈએ રૂપથી અધિક ગુજરાતી સારસ્વતોની વાર્ષમયસૂચિઓ તૈયાર કરી છે : ગો. મા. ન્રિપાઠી, ઉમાશંકર જોશી, સુંદરમુ., પન્નાલાલ, દર્શક, સુરેશ જોશી, સુરેશ દલાલ, નરસિંહ મહેતા, નહાનાલાલ, દ્યારામ, કાન્ત, કલાપી વગેરે. આ પૈકી ગોવર્ધનરામની સૂચિ સ્વતંત્ર ગ્રંથ સ્વરૂપે અને બાકીની સૂચિઓ તે તે સાહિત્યકાર-વિષયક ગ્રંથના અંતમાં પ્રકાશિત થયેલ છે. ગોવર્ધનરામ વિવેચન સંદર્ભ (૧૯૮૫)માં મણિલાલ નભુભાઈ દ્વિવેદીના લેખ ‘સરસ્વતીચંદ્રનું અવલોકન’ (૧૯૮૦)થી ૧૯૮૪ સુધી ગોવર્ધનરામ વિષયક પ્રગટ થયેલ સામગ્રીને સૂચિબદ્ધ કરવામાં આવી છે. અહીં કુલ ૨૨૫ વિવેચકોના ગોવર્ધનરામ વિષયક અંદાજિત ૧૦૦૦ જેટલા વિવેચન-સંદર્ભોની વિગતો આપવામાં આવી છે. ગોવર્ધન-

સાહિત્યના અભ્યાસીઓ માટે સંશોધનની નવી દિશાઓ ખોલી આપવા માટે એ ઉપકારક નીવડશે.

નવલકથા સંદર્ભકોશ (૧૯૮૮) એ પ્રકાશભાઈની વિષયલક્ષી વાર્ષમયસૂચિઓ. પૈકીનો એક અજોડ બૃહદ્દ સૂચિગ્રંથ છે. આ સૂચિમાં વિશ્વની ૪૧ ભાષાઓના ૪૮૪ નવલકથાકારોની ૮૮ નવલકથાઓ અને તેના સર્જકો વિશે ૧૮૪૪થી ૧૯૮૮ સુધીના સમયગાળામાં ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલા ઉ૧૦૦થી અધિક વિવેચનસંદર્ભો તથા નવલકથા સાહિત્યસ્વરૂપનો વિકાસ અને તેની સૈદ્ધાંતિક ચર્ચા કરતા ૬૦૦ જેટલા સંદર્ભોનો સમાવેશ કર્યો છે. આ બધા સંદર્ભોની ગોઠવણી પણ શાસ્ત્રીય, છતાં સુગમ અને ચિત્તાકર્ષક છે. આ સૂચિની એક આગવી વિશેષતા એ છે કે પ્રત્યેક નવલકથાકારના નામની સામે તેનું ઉપનામ (જો હોય તો) અને જન્મ-મૃત્યુ વર્ષની માહિતી આપવામાં આવી છે. આ માટે સંપાદક અનેકવિધ સ્લોતોના ઉપયોગ કરીને ઉઠાવેલો શ્રમ ધ્યાનપાત્ર બની રહે છે. પરિણામે આ સૂચિ સામાન્ય સૂચિઓથી ભિન્ન રીતે એક સંદર્ભકોશ તરીકે મહોરી ઉઠી છે. પ્રસ્તુત સૂચિને આવકારતાં રઘુવીર ચૌધરીએ નોંધ્યું છે કે ‘શુષ્ણ કાર્ય : રસપ્રદ સિદ્ધિ... આવું પુસ્તક તૈયાર કરવાનો વિચાર આવે એ જ આદર જગવતી ઘટના છે.’ આ ઉપરાંત રમેશ દવે, દીપક મહેતા, કિરીટ ભાવસાર અને મણિભાઈ પ્રજાપતિએ પણ તેમની સમીક્ષાઓમાં આ સૂચિને આવકારી છે. આ વિષય-વાર્ષમયસૂચિ ઉપરાંત વેગતે સ્વામિનારાયણ સાહિત્ય, બાળસાહિત્ય, લોકગીત અને લોકસંગીત, નૃત્ય અને નાટક, પ્રવાસ-સાહિત્ય, બંગાળી-ગુજરાતી અનુવાદો, નાટક વગેરે ૧૫ જેટલા વિષયોની વાર્ષમયસૂચિઓનું સંપાદન કર્યું છે. એ સૂચિઓ, સંબંધિત વિષયના ગ્રંથ અથવા વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયેલી છે. તેમની સૂચિપ્રવૃત્તિને ઉમાશંકર જોશી અને અન્ય સાહિત્યકારો તરફથી સતત પ્રોત્સાહન સાંપડતું રહ્યું છે. પ્રકાશક ભગતભાઈ શેઠે પણ એમની પ્રવૃત્તિને ઘણો સથિયારો આયો છે.

ગુજરાતી ભાષા સાહિત્યનું સદ્ગ્રાઘ્ય કે પ્રકાશભાઈ જેવા એક સૂચિવિદ અને કૃતનિશ્વાસી ગ્રંથપાલ મળ્યા ! ગ્રંથસૂચિ-વિહોણા ગુજરાતનું મહેષું ભાંગવા માટેનો તેમનો

પ્રયાસ અભિનંદનીય અને અનુકરણીય છે. તેમણે આ બધા સંદર્ભોની શોધ માટે વર્ષોની સાધના દરમિયાન વૈવિધ્યપૂર્ણ સામગ્રીને ફંઝોસવામાં કશું જ બાકી રાખ્યું નથી. જેમકે સાહિત્યના ઠિઠિબાસ ગ્રંથો, વિવેચનગ્રંથો, સામયિકો, ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહીઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ્ધના અહેવાલો, સંદર્ભગ્રંથો, ચારિત્રગ્રંથો વગેરે. શું એમ સ્વીકારી શકાય કે આ બધું સાહિત્ય ગ્રંથાલયના કોઈ એક ભૂષણમાં ગોડવીને રાખેલું હશે ને એ તેના ઉપભોક્તાની પ્રતીક્ષા કરતું હશે ? અથવા કોઈ બે-ત્રણ ગ્રંથાલયમાંથી ઉપલબ્ધ થયું હશે ? શું આ સાહિત્ય ગ્રંથાલયમાં પદ્ધતિસર સૂચિબદ્ધ થયું હશે ? ના. આ બધું ઢાળવા તેમણે કેટકેટલા ગ્રંથાલોને જગાડ્યા હશે, કેટકેટલા તજ્જ્ઞો સાથે વિચારવિમર્શ કર્યો હશે અને વાર્ષિક સૂચિ-વિષયક શાસ્ત્રીય જ્ઞાન ઉપાર્જન કરવા કેટકેટલા ગ્રંથો તેમજ તે તે સાહિત્ય સ્વરૂપ, વિષય કે કર્તા વિશે પણ કેટકેટલું અધ્યયન કર્યું હશે ! આ બધી બાબતોનો ગંભીરતાથી વિચાર કરવામાં આવે તો જ પ્રકાશભાઈના કાર્યનું મૂલ્ય સમજાય. સમગ્રતયા, આ બધાં કાર્યોમાં તેમની સંપાદકીય સૂઝ, દીર્ઘદિષ્ટ, વિષયનું તલસ્પર્શી જ્ઞાન, સ્વધર્મપાલનમાં અનન્ય નિષ્ઠા અને ધ્યેયનિષ્ઠ મહેનતની પ્રતીતિ સહજતયા થાય છે.

અહીં એક આડપ્રશ એ ઉદ્ભબે છે કે પ્રકાશભાઈ જેવા બીજા કેટલાક સૂચિવિદ્ય ગ્રંથાલયોઓ અને સાહિત્યસંશોધકો વિવિધ ભાષા-સાહિત્યમાં સૂચિનિર્માણ ક્ષેત્રે કેટલાક ચોક્કસ હેતુઓસર પ્રદાન કરતા આવ્યા છે; તેમના હેતુઓનું કેટલા અંશો પરિપાલન થતું હશે ? એ એક શોધનો વિષય છે. અનુભવે જણાયું છે કે આપણા અધ્યાપકો અને સંશોધકો પૈકી આ પ્રકારની સૂચિઓથી બહુ ઓછા પરિચિત હોય છે કે તેનું મૂલ્ય સમજે છે. ગ્રંથાલ તરીકેની મારી સાડતીસ જેટલાં વર્ષોની કારકિર્દીમાં, એક પણ અધ્યાપકે તેના વિષયનાં પુસ્તકો ખરીદવા માટેની યાદીમાં ગ્રંથસૂચિનો સમાવેશ કર્યો હોય તેનું મારી જાણમાં નથી ! જોકે તેમની યાદીઓમાં વર્ગિનોમાં ખપ લાગે તેવાં ચીલાચાલુ પ્રકાશનો તો અચૂક હોય જ ! જ્યાં અધ્યાપકોમાં વાચનદૌર્યત્ય પ્રવર્તતું હોય તેમજ વિષય-વાર્ષિક સૂચિઓ તરફ દુર્લક્ષ સેવવામાં આવતું

હોય ત્યાં વિવિધ પ્રકાશકો કે વિકેતાઓનાં સૂચિપત્રોના વાચનમાં તેઓ રુચિ દાખવે તેવી અપેક્ષા અસ્થાને જ ગણાશે ! રસિકલાલ પરીખ, ઉમાશંકર જોશી, જ્યંત કોડારી વગેરે વિદ્યાપુરુષોનો સૂચિપત્રોના વાચનનો શોખ નવી પેઢીને સ્પર્શી જાય તે માટે ઉચિત ઉપાયો યોજવા રહ્યા ! અનુસનાતક કક્ષાના અભ્યાસકમોમાં વાર્ષિક સૂચિ અને સંદર્ભટીપનો સમાવેશ કરવામાં આવે તો આ ક્ષેત્રે ગુણાત્મક પરિણામ આવી શકે !

ગ્રંથસૂચિ ક્ષેત્રે માત્રબર પ્રદાન કરવા ઉપરાંત પ્રકાશ વેગડે ગ્રંથાલય વિજ્ઞાન અને ગ્રંથાલય સાહિત્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એક જાગૃક ગ્રંથાલયી તરીકે ગુજરાતના ભાવિ ગ્રંથાલય ધારા વિશે પ્રજામત જાગૃત કરવા અંગે, અને એક આદર્શ ગ્રંથાલય ધારો કેવો હીવો જોઈએ તે વિશે તેમના અધ્યયનશીલ લેખો ‘પરબ’, ‘નિરીક્ષક’, ‘ઉદ્ગાર’, ‘ગુજરાત’, ‘જન્મભૂમિ-ગવાસી’, વગેરે પત્ર-પત્રિકાઓમાં પ્રગટ થયા છે. આ હેતુસર તેમણે ગ્રેટ બ્રિટન અને કણ્ણાટકના ગ્રંથાલયધારાઓનો ઊંડો અભ્યાસ કરીને, એ વિશે વિવેચનાત્મક લેખો લખીને ગુજરાતના ગ્રંથાલયધારાના ઘડવૈયાઓ માટે વિચારશીલ ભાથું પૂરું પાડ્યું છે. આ પૈકીના પસંદગીના લેખો અને સાર્વજનિક ગ્રંથાલયની વિભાવનાને સ્પષ્ટ કરતા તેમના અન્ય લેખો તેમના ગ્રંથ જાહેર ગ્રંથાલય : સંકલ્ય, સ્વરૂપ અને વ્યવસ્થાવિચાર (૧૯૮૮)માં ગ્રંથસ્થ થયા છે. તેમનો આ ગ્રંથ ગુજરાતી ભાષામાં ગ્રંથાલય વિજ્ઞાન વિષયક લખાયેલ ગ્રંથોમાં તેની મૌલિકતા, વિચારોતેજકતા, અભિવ્યક્તિ-લાઘવ અને વસ્તુ સંકલનાની દિષ્ટિએ નોંધપાત્ર છે. સાર્વજનિક ગ્રંથાલય વિશે અહીં ગ્રંથસ્થ લેખો પૈકી ‘અંતરરાષ્ટ્રીય ગ્રંથ ખતપત્ર’, ‘યુનેસ્કો જાહેર ગ્રંથાલય ફંડેરો’, ‘જાહેર ગ્રંથાલયના હેતુઓ’ અને ‘ગ્રંથ-પ્રકાશન, વેચાણ અને વાચનના પ્રશ્નો’માં લેખકની સાર્વજનિક ગ્રંથાલયો વિશેની નિસબ્બત, સહદ્યી ગ્રંથાલયી તરીકેનો આકોશ અને દાઝ, તેમજ અનુભવનું ભાથું સુપેરે ઊપસી આવે છે. આયુષ્યની શતાબ્દીના આરે ઊભેલા અગ્રણી ગ્રંથાલયવિદ્ય મોહનદાસ પટેલે પ્રસ્તુત ગ્રંથને આવકારતાં અને વિચારપ્રેરક, માર્ગદર્શક અને માહિતીપૂર્ણ ગણાયો છે. કવિ અને ગ્રંથાલયી હસમુખ પાઠકે પ્રસ્તુત

ગ્રંથની સમીક્ષા કરતાં નોંધ્યું છે કે ‘જાહેર ગ્રંથાલય વિશેનું આ પુસ્તક અપૂર્વ છે. લેખકની આ વિશેની પૂરી સજજતા છે. તેમજ તેમણે આ વિષયનું આવેખન અત્યંત ન્યાયપુરઃસર કર્યું છે.’ આ વિષયો ઉપરાંત તેમણે સૂચિવિજ્ઞાન અને ગ્રંથાલયસેવાઓ વિશે પણ સુચિત્તનીય લેખો લખ્યા છે.

સરોવરસ્તે રહેનાર વ્યક્તિ તરસ્યો રહે તેમાં તે વ્યક્તિનો દોષ ગણાય, નહીં કે સરોવરનો! જેકે દુઃખની વાત છે કે આજે આપણા મોટા ભાગના ગ્રંથાલયોએ તળાવકંઈ તરસ્યા રહે છે! જળકમળવત્ત! ગ્રંથાલયીઓએ બરા અર્થમાં શિક્ષક બનવા માટે આત્મમંથન કરી જાગૃત થતું પડશે. પ્રકાશભાઈ કારકિર્દિના પ્રારંભકાળથી નિવૃત્તિપર્બત ગ્રંથસરોવર વચ્ચે રહ્યા છે. પોતાની ફરજો પ્રત્યે સતત સભાન રહ્યા છે. ઉપભોક્તાઓને સેવાઓ આપતાં આપતાં તેમણે પોતે પણ સાહિત્યરસનું પાન કર્યું. વાચન અને ચિંતન કર્યું. તેમની આ અભ્યાસનિષ્ઠાને લીધે સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ‘Encyclopaedia of Indian Literature’ના પ્રથમ સંપાદક સિતાંશુ યશશેંદ્ર આ વિશ્વકોશ માટે ગુજરાતી સાહિત્યકારો વિશે કેટલાંક અધિકરણો લખવા નિમંત્રણ પાઠવ્યું, જેના પરિણામે તેમણે ૧૮ અધિકરણો તૈયાર કર્યાં. આ પૈકીનાં કેટલાંક અધિકરણો વિશે માહિતી પ્રાય: દુષ્કર અને અપ્રાય હોવા છતાં કઠોર પરિશ્રમ વેઠીને તે તેમણે તૈયાર કર્યાં છે.

પ્રકાશ વેગડનું મૂળ વતન માધાપર, ભુજ (કચ્છ). તેમનો જન્મ અલહાબાદમાં તારીખ ૧૪-૭-૧૯૮૮ના રોજ. તેમનું પૂરું નામ પુરુષોત્તમ પ્રકાશ માવજીભાઈ વેગડ છે. પરંતુ ગ્રંથાલય જગતમાં પ્રકાશ વેગડના નામથી સુખ્યાત છે. એ પોતે લખે છે ‘પી. પ્રકાશ વેગડ’. અલહાબાદ યુનિવર્સિટીમાંથી બી.એ. (૧૯૮૮)ની ડિગ્રી મેળવ્યા બાદ વધુ અભ્યાસ કરવાની તીવ્ર ઈચ્છા, પરંતુ કુટુંબની આર્થિક સ્થિતિને ધ્યાને લઈ પિતાશ્રીએ નોકરી કરવાની સલાહ આપતાં ગૃહતાંગ કરી નૈનિતાલની કૃષિ યુનિવર્સિટીના ગ્રંથાલયમાં પ્રારંભમાં વર્ગ-૪ના કર્મચારી અને ત્યાર પછી

કારકુન તરીકે થોડોક સમય સેવાઓ આપ્યા બાદ ગ્રંથાલય વિજ્ઞાનનો ડિપ્લોમા મેળવ્યો. એકાદ વર્ષ વલ્લભ-વિદ્યાનગરની નવિની એન્ડ અરવિંદ આટર્સ કોલેજમાં ગ્રંથાલય તરીકે સેવાઓ આપી જુલાઈ-૧૯૮૮ પમાં સેટ એવિયર્સ કોલેજ, અમદાવાદમાં ગ્રંથપાલ તરીકે જોડાયા, જ્યાં તેમણે ૧૯૮૮ સુધી સેવાઓ આપી. આ કાર્યકાળ દરમિયાન ગ્રંથાલયવિજ્ઞાનની તાતીમયાં શીખવવામાં આવેલ સંદર્ભસેવા અને વાર્ષિકસૂચિને સાકાર કરવા કટિબદ્ધ બન્યા. અને તેમને પ્રેરણાદતા ગુરુ મળ્યા કવિશ્રી નિરંજન ભગત! ભગત સાહેબની પ્રેરણાદી – ‘ગુજરાતી સાહિત્યની બિલ્બિઓગ્રાફીઝ તૈયાર કરો. એમાં ઘણો અવકાશ છે’ – વાર્ષિકસૂચિઓના કાર્યમાં પરોવાઈ ગયા! વિવિધ ગ્રંથાલયોની રૂબરૂ મુલાકાતો લઈ ત્યાં સંગૃહીત સામગ્રીને શોધી શોધીને સૂચિ કર્દાનો ઢગલો ખડકતા ગયા અને સાહિત્યસૂચિઓનું પ્રકાશન આરંભી દીધું. સાથે સાથે આ કોલેજ ગ્રંથાલયના વિકાસમાં પણ તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. અહીંના સેવાકાળ દરમિયાન તેમણે સવિશેષતઃ ગુજરાતી સાહિત્ય જગતમાં સંદર્ભ ગ્રંથાલયી અને સાહિત્યસૂચિકાર તરીકે અસાધારણ પ્રસિદ્ધ હાંસલ કરી લીધી હતી. જુલાઈ, ૧૯૮૮માં ગુજરાતી સાહિત્ય પરિષદમાં ગ્રંથપાલ તરીકે જોડાયા અને જૂન, ૧૯૯૮માં સેવાનિવૃત્ત થયા. અહીં તો ગુજરાતી ભાષા-સાહિત્યની અઠળક સામગ્રીનો ખજાનો ઉપલબ્ધ હતો. આ ગ્રંથસમૃદ્ધિનો પણ તેમણે ભરપૂર લાભ લીધો. તેમના પ્રયાસોથી આ ગ્રંથાલય ઘણું સમૃદ્ધ થયું છે. અહીં તેમણે ઘણાં અપ્રાય અને દુર્લભ પુસ્તકો તથા સામયિકીના પાઇળના અંકો એકટા કર્યા અને ગ્રંથાલયનું સુદૃઢ વિવસ્થાતંત્ર ગોઠવી આપ્યું છે.

પ્રકાશભાઈ વેગડ ગુજરાતી ભાષા-સાહિત્યના સૂચિકેતના અને ગુજરાતના ગ્રંથાલય જગતના ધ્યુવતારક છે. ગુજરાતના ગ્રંથપાલ સમાજનું આભૂષણ છે. તેમનાં બહુવિધ કાર્યો ગ્રંથપાલો અને સવિશેષતઃ નવેદિતો માટે ઉદ્વિપક્નું કાર્ય કરે તેટલાં બળવાન છે. ઈચ્છીએ કે આવા કર્મચારી સૂચિકારો આપણને મળતા રહે.

સૂચિઓની સૂચિ

ગુજરાતી મુદ્રિત પુસ્તકો-હસ્તપતો-સામયિકો અંગે ગ્રંથસ્થ થયેલું સૂચિકાર્ય

મુખ્ય સંકલન : ભાર્ગવ જાની

આયોજન : રમણ સોની

આ સૂચિ મુખ્યત્વે ભાર્ગવ જાનીએ તૈયાર કરી મોકલેલી. પછી એમાં જ્યાંત મેઘાણી, મણિભાઈ પ્રજાપતિ અને રમણ સોનીએ સંમાર્જન અને પૂર્તિ કરી આખ્યાં. અંતિમ આયોજન સંપાદકનું છે.

ગ્રંથનામના અકારાદિકમે કરેલી આ સૂચિને વિગત-વર્ણનની સુવિધા માટે બે વિભાગોમાં વહેંચી છે :

૧. માત્ર ગુજરાતી ગ્રંથો આદિ સામગ્રી વિશે, મુખ્યત્વે ગુજરાતીમાં થયેલી સૂચિઓ, અને ૨. અન્યત્ર થયેલી વ્યાપક સૂચિઓ – જેમાં ગુજરાતી ગ્રંથો આદિ પણ સમાવિષ્ટ છે. આ બંને વિભાગોને (ક) મુદ્રિત ગ્રંથાદિની સૂચિ અને (ભ) હસ્તપતોની સૂચિ એવા બે પેટાવિભાગોમાં મૂકી છે.

ધ્યાંના ચોકસાઈ ને શ્રમપૂર્વક કરી હોવા છતાં આ સૂચિ સંપૂર્ણ ન પણ હોય – બને કે કોઈ કોઈ સૂચિગ્રંથ ધ્યાનબહાર પણ રહ્યો હોય. અભ્યાસીઓ એ અંગે ધ્યાન દોરશે તો, એની પૂર્તિ કરવામાં આવશે.

ગ્રંથનામના અકારાદિકમે કરેલી આ સૂચિને સ્થળનામના તેમજ પ્રકાશનવર્ષના ક્રમે વિસ્તારવા ધારેલું પણ એ થઈ શક્યું નથી. એટલે થોડીક સુવિધા મળે એ આશયથી પ્રકાશનસ્થળ અને પ્રકાશનવર્ષ પણ ઘેરા.

(બોલ્ટ) ગાઈપમાં કર્યા છે. એક જ પ્રકારની સૂચિઓ બહુધા સાથે-સાથે મૂકી શકાય એ માટે, ગ્રંથશીર્ષકમાં ઉમેરેલી વિગતો માટે [] ચોરસ કૌંસ અને અકારાદિકમ જાળવવા બહાર રાખેલી વિગતો માટે () ગોળ કૌંસ કર્યા છે. પ્રત્યક્ષ જોવા ન મળેલા દ્વૈતીયિક સોત * ફૂદીથી દર્શાવ્યા છે.

- સંપાદક

૧ (ક) ગુજરાતી ગ્રંથો આદિ વિશે થયેલી સૂચિઓ : મુદ્રિત ગ્રંથાદિ

અભિનેય નાટકો (૧૯૦ ગુજરાતી નાટકોની રંગસૂચિ), સંપા. ધીરુભાઈ ઠાકર; વડોદરા : મ. સ. વિશ્વવિદ્યાલય, ૧૯૫૮, પૃ. ૩૧૮

કથાસંદર્ભ (૧૯૬૧થી ૧૯૮૦ સુધીની ગુજરાતી નવલકથાઓની સૂચિ), સંપા. વંદના મહેતા, દીપક મહેતા; અમદાવાદ : નવભારત, ૧૯૮૫, પૃ. ૧૯૬

□કમલ પુસ્તકોદ્વાર સૂચિ. સુરત : જૈન આનંદ પુસ્તકાલય, ૧૯૪૮, પૃ. ૧૧૧ [□વિષયસામગ્રી, સંપાદક આદિની વિગતો મળી નથી, વિગત દ્વૈતીયિક સોતમાંથી લિધી છે.)

કાર્યવહી : ૧૯૪૪-૧૯૫૩ (ગુજરાત સાહિત્ય સભાની ૨૦ વર્ષોની કાર્યવહીઓમાં પ્રગટ તે તે વર્ષના ગ્રંથોની યાદી) ; અમદાવાદ : ગુસા સભા, ૧૯૭૪-૫૩.

કોપીરાઇટ ગ્રંથસૂચિ (ઈ. ૧૯૦૦ પૂર્વે પ્રકાશિત થયેલાં, કોપીરાઇટ ગ્રંથાલયને મળેલાં પુસ્તકોની સૂચિ); અમદાવાદ : ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય, ૧૯૮૮, પૃ. ૩૨૭

ગુજરાત ઈતિહાસ સંદર્ભ સૂચિ ગ્રંથ : ૧, સંપા. પુરુષોત્તમ ભટ્ટ, રસેશ જમીનદાર; ૧૯૬૨, પૃ. ૩૧. ગ્રંથ : ૨ (અભિલેખો),

સંપા. પ્રવીણચંદ્ર ચિ. પરીખ; ૧૯૬૨, પૃ. ૫૭. ગ્રંથ : ૩ (પ્રતિભાલેખો : ઈ. ૧૩૦૦ સુધી), સંપા. નવીનચંદ્ર આ. આર્યા, ૧૯૬૬, પૃ. ૩૦. ગ્રંથ : ૪ (અભિલેખો, શિલાલેખો : ઈ. ૧૩૦૧-૧૭૬૦), સંપા. ઈન્ડ્રવદન વિષ્ણુપ્રસાદ નિવેદી; ૧૯૬૮, પૃ. ૨૨. ગ્રંથ : ૫ (પ્રતિભાલેખો; ઈ. ૧૩૦૧-૧૭૦૦), સંપા. ઈન્ડ્રવદન વિ. નિવેદી; ૧૯૬૯, પૃ. ૨૦૨ (?) ગ્રંથ : ૬ (અરબી-ઝારસી શિલાલેખો ઈ. ૮૨૦-૧૯૫૫), સંપા. લિયાઉદ્દીન અ. દેસાઈ; ૧૯૭૨, પૃ. ૫૪. ગ્રંથ : ૭ (ગુજરાતના ઈતિહાસને લગતી વંશવળીઓ), સંપા. ગુજરાત ઈતિહાસ પરિષદ, ૧૯૮૦, પૃ. ૮૮, ગ્રંથ : ૮ (ગુજરાતી સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા [ઈતિહાસ વિષયક ગુલેજોની સૂચિ]), સંપા. રસેશ જમીનદાર; ૧૯૮૪. ગ્રંથ ૧થી ૮ના પ્રકાશક : અમદાવાદ ગુજરાત ઈતિહાસ પરિષદ. ગુજરાત ઈતિહાસ-પુરાતત્વસંદર્ભગ્રંથસૂચિ (સંશોધન તૈમાસિક, વર્ષ-૩, અંક-૪), સંપા. હસમુખ વ્યાસ; ધોરાજ ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૦૪. ગુજરાત વર્નકિયુલર સોસાયટીની લાઇબ્રેરીનાં પુસ્તકોની યાદી

ભાગ : ૧, અમદાવાદ : ગુવ સોસાયટી, ૧૮૮૫, પૃ. ૨૭૬
 ગુજરાતી આદિમુદ્રિત ગ્રંથોની સૂચિ, સંપા. અર્યુત યાણિક,
 કિરીટ ભાવસાર, અમદાવાદ : સેતુ, ૨૦૦૪, પૃ. ૨૮૪
 ગુજરાતી ગ્રંથસૂચિ (ઈ. ૧૮૩૦ સુધીનાં દુર્લભ પુસ્તકો :
 સંભવત: ૧૮૮૧-૮૨ સુધીમાં નોંધેલાં), રાજ્ય કેન્દ્રીય અનામત
 ગ્રંથબંડાર, ગુજરાત રાજ્ય, મહેસાણા. ગાંધીનગર : ગ્રંથાલય
 નિયામકની કચેરી, ૧૮૮૪, પૃ. ૧૮૧; ૧૮૮૭, પૃ. ૧૧૩
 (આડ હજાર) ગુજરાતી પુસ્તકોની વર્ગિકૃત નામાવલિ, વડોદરા
 : પુસ્તકાલય સહાયક સહકારી મંડળી, ૧૮૮૮.
 (ચાર હજાર) ગુજરાતી પુસ્તકોની નામાવલિ (ભાગ : ૨)
 વડોદરા, પુસ્તક મંડળી, ૧૮૮૩
 ગુજરાતી પુસ્તકોની યાદી (માધ્યમિક શાળાઓનાં પુસ્તકાલયો
 માટે), મુખ્ય : મુખ્ય સરકાર શિક્ષણ સલાહકાર [સમિતિ];
 ૧૮૮૮, પૃ. ૪૦
 ગુજરાતી બાલસાહિત્ય : ગ્રંથ ૧થી ૪, મુખ્ય : મધ્યરથ
 બાલસાહિત્ય સમિતિ, ૧૮૮૮.
 ગુજરાતી બાલસાહિત્ય (ઈ. ૧૮૬૬ થી ૧૮૮૫ સુધીમાં પ્રગટ
 થયેલાં પુસ્તકો), સંપા. ક્રીકુભાઈ રતનજી ટેસાઈ; અમદાવાદ :
 ગુજરાત પુસ્તકાલય મંડળ, ૧૮૬૭, પૃ. ૩૧.
 [ગુજરાતી] મહાનિબંધ વર્ગિકૃત સૂચિ (૧૮૫૭-૧૮૭૭), સંપા.
 પ્રકાશ વેગડ; અમદાવાદ : પ્રકાશ વેગડ, ૧૮૭૮ પૃ. ૭૮
 ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ (૧૮૫૭-૧૮૮૧), સંપા.
 પ્રકાશ વેગડ; અમદાવાદ : આર. આર. શેઠ, ૧૮૮૪, પૃ. ૧૦૬
 ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ (૧૮૫૭-૨૦૦૨), સંપા.
 પ્રસાદ બ્રહ્મભઙ, અમદાવાદ : નવભારત, ૨૦૦૪, પૃ. ૨૭૦
 ગુજરાતી સંદર્ભગ્રંથો (કોશ, ચારિતકોશ, એટલાસ, વગેરે) સંપા.
 કનુભાઈ શાહ, અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠ, ૧૮૮૫, પૃ.
 ૨૪
 ગુજરાતી સામયિક લેખસૂચિ-૧૮૭૫, સંપા. કનુભાઈ શાહ,
 કિરીટ ભાવસાર; અમદાવાદ : આર. આર. શેઠ, ૧૮૭૮, પૃ.
 ૧૫૩.
 ગુજરાતી સામયિક લેખ સૂચિ-૧૮૭૬, સંપા. કનુભાઈ શાહ,
 કિરીટ ભાવસાર; અમદાવાદ : આર. આર. શેઠ, ૧૮૮૨, પૃ.
 ૨૮૭
 □ગુજરાતી સામયિકોનું પ્રદર્શન-સંભારણું, સંપા. બી. એસ.
 શાહ; કલકત્તા : એમેટર કિટિક્સ, ૧૮૬૬ (* સંભવત :
 પ્રદર્શનમાંનાં પુસ્તકોની યાદી અથવા વર્ગિકૃત સૂચિ દેતીથીક સૌત)
 [ગુજરાતી સાહિત્ય] સામયિક લેખસૂચિ : ૧૮૬૬-૨૦૦૦,
 સંપા. રમણ સોની; વડોદરા : પ્રત્યક્ષ પ્રકાશન, ૨૦૦૬, પૃ.
 ૧૫૨.

ગુજરાતી સાહિત્ય સૂચિ : મધ્યકાળ, સંપા. પ્રકાશ વેગડ;
 ગાંધીનગર : ગુજરાત સાહિત્ય અકાદમી, ૧૯૮૪, પૃ. ૩૦૮
 ગાંધી સાહિત્ય સૂચિ (ગાંધીજીના ગ્રંથો, ગાંધીજી વિશેના ગ્રંથો,
 વગેરે), સંપા. પાંડુરંગ ગણેશ દેશપાંડે; અમદાવાદ : નવજીવન,
 ૧૯૪૮, પૃ. ૨૮૮

ગોવર્ધનરામ તિવેચન સંદર્ભ, સંપા. પ્રકાશ વેગડ; મુખ્ય : એન.
 એમ. ત્રિપાઠી, ૧૮૮૫, પૃ. ૬૮

ગ્રંથ અને ગ્રંથકાર ગ્રંથ ૧થી ૧૦ સંપા...? અમદાવાદ : ગુજરાત
 વર્નક્યુલર સોસાયટી, ૧૯૭૦થી-
 ગ્રંથસૂચિ-૧૮૮૪ (એ વર્ષનાં પ્રકાશિત ગુજરાતી પુસ્તકોની
 વર્ગિકૃત સૂચિ; પ્રકાશન સંસ્થાઓની સરનામા-સૂચિ સાથે),
 સંયોજન કિશોર વ્યાસ; આયોજન રમણ સોની; વડોદરા :
 પ્રત્યક્ષ પ્રકાશન, ૧૮૮૫, પૃ. ૧૨

ગ્રંથ અને શિલાલેખો, સંયોજક પ્રધ્યામ લ. ખાચર; જીનાગઢ :
 સૌરાષ્ટ્ર કચ્છ ઠતિહાસપરિષદ, ૨૦૦૩, પૃ. ૬૮
 ઘૂમલી સંદર્ભ (ઘૂમલી વિશેનાં લખાણો, અભિવેખો, તામ્રપત્ર,
 પાળિયા વગેરે) સંપા. નરોતમ પલાણ; પોરબંદર : દર્શન
 પ્રકાશન, (સંવર્ધિત બીજી આવૃત્તિ) ૨૦૦૭, પૃ. ૧૦૪
 જૈન ધર્મ પ્રસારક સભાની જૈન લાઇબ્રેરીનું લીસ્ટ; ભાવનગર
 : જૈનધર્મ પ્રસારક સભા, ૧૮૮૧, પૃ. ૨૩૬

‘જ્ઞાનસૂધા’ : સ્વાધ્યાય અને સૂચિ, સંપા. ધીરુભાઈ ઠાકર;
 ગાંધીનગર : ગુજરાત સાહિત્ય અકાદમી, ૧૯૮૭, પૃ. ૨૫૮
 તપાસ નિબંધ સૂચિ (સનાતક, પારંગત અને વિદ્યાવાચસ્પતિની
 પદવી માટે વિદ્યાપીઠમાં ૨જી થયેલા નિબંધો – ૧૮૭૪ સુધી),
 સંપા. કનુભાઈ શાહ, કિરીટ ભાવસાર; અમદાવાદ : ગુજરાત
 વિદ્યાપીઠ, ૧૮૮૫, પૃ. ૨૫૮

(લેવ) તોલ્સ્ટોય વાઙ્યમય સૂચિ, સંપા. કિરીટ ભાવસાર;
 અમદાવાદ : ગૂર્જર, ૧૮૭૮, પૃ. ૫૪.

દેશીઓની સૂચિ (જૈન ગૂર્જર કવિઓ), મધ્યકાળીન ગુજરાતી
 જૈન રાસાઓ, વગેરેમાં નિર્દિષ્ટ દેશીઓ), સંપા. હરિવલભ
 ભાયાણી, નિર્જના વોરા; ગાંધીનગર : ગુજરાત સાહિત્ય
 અકાદમી, ૧૯૮૦, પૃ. ૪૧૬

નવલકથા સંદર્ભકોશ (ગુજરાતી તથા મહત્વની ભારતીય,
 વિદેશી નવલકથાઓ વિશેનાં વિવેચનની સૂચિ), સંપા. પ્રકાશ
 વેગડ; ગૂર્જર, ૧૯૮૮, પૃ. ૩૧૨

પદસૂચિ (મધ્યકાળીન ગુજરાતી કાવ્યસંગ્રહોના (સંપાદન)માંથી
 પદોની સૂચિ), સંપા. નિર્જના વોરા; ગાંધીનગર : ગુજરાત
 સાહિત્ય અકાદમી, ૧૯૮૦, પૃ. ૬૩૨

પદભજન સૂચિ (મધ્યકાળીન પદ-ભજન-કૃતિઓ), સંપા.
 બળવંત જાની; ગાંધીનગર : ગુજરાત સાહિત્ય અકાદમી,

૧૯૮૫, પૃ. ૫૫૩

પરબસૂચિ (૧૯૬૦-૨૦૦૩ સુધીના અંકોની કાલાનુકમી, સ્વરૂપાનુસાર, લેખકવાર વર્ગિકૃત સૂચિ), સંપા. ઈતુભાઈ કુરકુટિયા, પારુલ દેસાઈ, રમેશ દેવ; અમદાવાદ : ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૦૦૭, પૃ. ૪૬૪

પુસ્તકોની વર્ગિકૃત નામાવિ (પહેલા દસ્તુર મેહેરજી રાણા લાઠેબેરીનાં ગુજરાતી પુસ્તકોનું વર્ગિકરણ), સંપાદક બી. એમ. દસ્તુર; નવસારી : પહેલા દસ્તુર મેહેરજી રાણા લાયબેરી, ૧૯૮૭, પૃ. ૧૧૮

પ્રકાશ વેગડની સાહિત્યસૂચિઓની સૂચિ (Bibliography of Bibliographies) અને અન્ય લેખનવિદેયન સંદર્ભો; સંપા. પ્રકાશ વેગડ; અમદાવાદ પાર્શ્વ, ૨૦૦૭, પૃ. ૬૨

પ્રત્યક્ષ સૂચિ (૧૯૮૧-૨૦૦૬), (પ્રત્યક્ષ તૈમાસિકનાં પહેલાં ૧૬ વર્ષની વર્ગિકૃત સૂચિ) સંકળન કૃતિ પટેલ, સાપના મોરી; સંયોજન રમણ સોની; વડોદરા : પ્રત્યક્ષ પ્રકાશન, ૨૦૦૭, પૃ. ૪૦

બાળકાલ્યો-જીતોનાં પુસ્તકોની સૂચિ ૧૯૮૩-૧૯૮૨, સંશોધક-સંપાદક ભાનુભાઈ મુ. પંચા; ગાંધીનગર : લેખક, ૧૯૮૩, પૃ. ૮૬

બાળસાહિત્ય સર્વસંગ્રહ ભાગ-૧ સંપા. જિજુભાઈ બધીકા; ૧૯૮૨, પૃ. ૧૩૧. ભાગ-૨ (૧૯૮૨થી ૧૯૮૬ સુધીના ઉમેરણ સાથે), સંપા. જીવરામ જોશી, ૧૯૮૪, પૃ. ૧૪૮. બંને ભાગના પ્રકાશક વડોદરા : વડોદરા રાજ્ય પુસ્તકાલય મંડળ. બાળોપયોગી પુસ્તકો (વર્ગ, વિભાગ અને અન્ય માહિતી સાથે), સંપા. ભગીની સમાજ; મુંબઈ : ભગીની સમાજ, ૧૯૮૦, પૃ. ૧૮.

‘બુદ્ધિવિકાશ’ : સ્વાધ્યાય અને સૂચિ (૧૮૫૪-૧૯૦૦), સંપા. ચી. ના. પટેલ; ગાંધીનગર : ગુજરાત સાહિત્ય અકાદમી, ૧૯૮૦, પૃ. ૨૦૨

બુદ્ધિવર્દ્ધક પુસ્તકાલય ગ્રંથ નામાવિ ભાગ : ૧ ગુજરાતી ગ્રંથો, મુંબઈ : ફાર્બર્સ ગુજરાતી સભા, ૧૯૮૫, પૃ. ૩૭૫

(સૌજન્યશીલ સારસ્વત ડૉ.) બોગીલાલ જ. સાંડેસચા (પુસ્તકો અને લેખોની સૂચિ), ભાવનગર : શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા, વિ.સ. ૨૦૩૧, [ટી. ૧૯૭૫], પૃ. ૫૮

મધ્યકાલીન કૃતિસૂચિ (‘ગુજરાતી સાહિત્યકોશ : ૧માં નિર્દેશાયેલી કૃતિઓની નામ-કર્તા-મુદ્રિત-અમુદ્રિત આદિની વિગતો આપતી ને કોશના પૃષ્ઠાંકો દર્શાવતી સૂચિ), સંપા. ક્રાર્તિદા શાહ; અમદાવાદ : ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૦૦૪, પૃ. ૨૧૦.

મહિલા પુસ્તકાલય ગ્રંથસૂચિ (ઈ. ૧૯૫૧થી ૧૯૬૫ સુધીમાં પ્રગટ થયેલાં વસાવવા જેવાં ગુજરાતી પુસ્તકો), સંપા. કીકુભાઈ રતનજી દેસાઈ; અમદાવાદ : ગુજરાત પુસ્તકાલય મંડળ, ૧૯૬૭, પૃ. ૫૮

મેઘાશી સંદર્ભ (મેઘાશી ગ્રંથો, એ વિષયક વિવેચનો) સંપા. કનુભાઈ જાની, નવલસિંહ વાધેલા, આશંકા : મૌલિક પ્રકાશન, ૧૯૮૧, પૃ. ૪૧.

(શી) મોરારજી દેસાઈ વાઙ્મય સૂચિ, સંપા. કનુભાઈ શાહ; અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠ, ૧૯૮૬

યુનિયન કેટલોગ...] Union Catalogue of Gujarati Periodicals in the Libraries of Bombay, Compiled by N. A. Pandya; Bombay : Bharatiya viday Bhavan, ૧૯૭૫.

ગાંધીય ગ્રંથસૂચિ (ગુજરાતમાં ૧૯૮૮ અને ૧૯૮૯ દરમિયાન પ્રકાશિત ગ્રંથો) સંપા. બી. એસ. કેશવન્દુ; વડોદરા : ગુજરાત સરકાર, ૧૯૬૧, પૃ. ૪૪૫

ગાંધીય ગ્રંથસૂચિ (૧૯૬૪-૭૦), સંપા. ઉપર મુજબ ?, વડોદરા : ગુજરાત સરકાર ૧૯૬૪-૭૦.

લોકગીત સૂચિ સંપા. હરિવલ્લભ ભાયાશી, કિરીટ શુક્લ; ગાંધીનગર : ગુજરાત સાહિત્ય અકાદમી, ૧૯૮૮, પૃ. ૧૪૮

વડોદરા રાજ્યના સાહિત્યપ્રવૃત્તિઓ સંયોજક ભરતરામ ભાનુસુખરામ મહેતા, રમણીકરાય શ્રીમનરાય મહેતા; વડોદરા : મ. સ. યુનિવર્સિટી, ૧૯૫૭, પૃ. ૧૬૦.

વાર્તાઓનાં પુસ્તકોનો પરિચય ભાગ-૨ (બાળવાર્તાઓની સૂચિ), વડોદરા રાજ્ય પુસ્તકાલય પરિષદ મંડળ; વડોદરા : પુસ્તકાલય સહાયક સહકારી મંડળ, ૧૯૭૧, પૃ. ૧૫૫

શેતાંબરીય જૈન ગ્રંથ માર્ગદર્શક પ્રાચીન-અર્વાચીન પ્રકાશિત ગ્રંથો અને તેમના વિષયો અંગે), સંપા. વિનયવિજયજી; ભાવનગર : જૈન આસ્તાનંદ સભા, ૧૯૧૪, પૃ. ૫૩૨.

‘શમાલોચક’ : સ્વાધ્યાય અને સૂચિ, સંપા. ધીરુભાઈ ટાકર; ગાંધીનગર, ગુજરાત સાહિત્ય અકાદમી, ૧૯૮૭, પૃ. ૬૧૪

દાર્થ્યપુર અનેક જૈન પુસ્તક ભાંડાગાર દંશિકા સૂચિ સંપા. કેશવીંદ્ર હીરાંદ જીવેરી; સુરત : જૈન સાહિત્ય ફેફ, ૧૯૮૮, પૃ. ૧૦૭ (દ્વારીયીક સોતા)

સ્વાધ્યાય અવભોગિકા (૧૯૯૩-૧૯૬૪ : આકાશવાણી વાર્તાલાપો, લેખો, વગેરે), સંપા. કેશવલાલ હિમતરામ કામદાર; વડોદરા : કેઠિકામદાર, ૧૯૬૪, પૃ. ૫૦

‘સ્વાધ્યાય’ લેખ સૂચિ (વર્ષ/પુસ્તક ૧થી ૨૫ - ઈ. ૧૯૬૩ ઉથી ૧૯૮૮ : લેખકસૂચિ, લેખસૂચિ, ગ્રંથાવલોકન સૂચિ, અન્ય સૂચિ, ચિત્રસૂચિ), સંપા. જયંત ઉમરેઠિયા; વડોદરા : પ્રાચ્ય વિદ્યા મંદિર, ૨૦૦૭, પૃ. ૨૮૬.

૧ ખ ગુજરાતીમાં થયેલી ગુજરાતી હસ્તપ્રત સૂચિઓ

કવીશ્વર દલપત્રામ હસ્તલિખિત પુસ્તક સંગ્રહની સૂચિ, સંપા. હીરાલાલ નિભોવનદાસ પારેખ; અમદાવાદ : હીતિપારેખ, ૧૯૩૦, પૃ. ૩૨૭

ગુજરાતી હસ્તપ્રતોની સંકલિત વાર્તા (ઈ. ૧૯૩૭ સુધીની), સંપા. કેશવરામ કા. શાસત્રી; અમદાવાદ : ગુજરાત વર્ક્સિયુલર સોસાયટી, ૧૯૩૮, પૃ. ૩૫૧.

જૈન-ગૂર્જર કવિઓ (હસ્તપ્રતોની, આરંભ-અંતની પંક્તિઓ સમેતની, વર્ણનાત્મક સૂચિ), સંશોધક-સંપાદક મોહનલાલ દલીયંદ દેશાઈ; મુંબઈ : જૈન શૈતામભર કોન્ફરન્સ ઓફિસ, ખંડ-૧, ૧૯૨૬, પૃ. ૬૫૬, ખંડ-૨, ૧૯૩૧, પૃ. ૬૭૪. ખંડ-૩, (ભાગ ૧, ૨) ૧૯૪૪, પૃ. ૨૨૪૦ (બંને ભાગનાં)

જૈન-ગૂર્જર કવિઓ, સં. મોહનલાલ દ. દેશાઈ, સંશોધિત-સંવધિત બીજી આવૃત્તિના સંપા. જ્યંત કોઠારી, મુંબઈ : મહાવિર જૈન વિદ્યાલય, ગ્રંથ ૧થી ૧૦, ૧૯૮૬-૧૯૮૭.

ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલિ, સંપા. અંબાલાલ બુ. જાની, શક્તિપ્રસાદ છગનલાલ રાવળ; મુંબઈ : શ્રી ફોર્બ્ઝ ગુજરાતી સભા, ૧૯૫૬ (?) , પૃ. ૧૨૪

ફાર્બસ ગુજરાતી સભા, ખંડ : ૧, ૧૯૨૩, પૃ. ૪૦૦. ખંડ : ૨, ૧૯૨૮, પૃ. ૪૨૩.

ફોર્બ્ઝ ગુજરાતી સભાનાં હસ્તલિખિત ગ્રંથોની નામાવલિ, સંપા. અંબાલાલ બુ. જાની, શક્તિપ્રસાદ છગનલાલ રાવળ; મુંબઈ : શ્રી ફોર્બ્ઝ ગુજરાતી સભા, ૧૯૫૬ (?) , પૃ. ૧૨૪

ફાર્બસ ગુજરાતી સભા હસ્તપ્રત સંગ્રહની સૂચિ, સંપા. કનુભાઈ ર. શેઠ; મુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા, ૧૯૮૮, પૃ. ૫૦૦ (મુનિચાજ) પુષ્યવિજયજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રત સૂચિ, સંકલન મુનિ પુષ્યવિજયજી, સંપા. વિધાત્રી વોરા; અમદાવાદ : લા. દ. ભારતીય સંસ્કૃત વિધામંદિર, ૧૯૭૮, પૃ. ૮૫૫. લીબીના જૈન શાનનંદારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચિપત્ર, સંપા. મુનિ ચતુરવિજય; મુંબઈ : જીવાયાંદ સાંકળદાસ જરેરી આગમોદ્ય સમિતિ, ૧૯૮૮, પૃ. ૧૮૪.

(શ્રી) હેમચંદ્રાચાર્ય જૈન શાનમંદિર સ્થિત જૈન ભંડરોનું સૂચિપત્ર (ભથ્મ ભાગ), સંપા. મુનિ પુષ્યવિજયજી; પાટણ : ડે જૈ શાનમંદિર, ૧૯૭૨.

૨ ક વ્યાપક સૂચિઓ : મુદ્રિત ગ્રંથો અંગો

Bibliography of stageable Plays in Indian Languages, સંપાદક ચંદ્રવદન સી. મહેતા, C. Mehta;

Vadodara : The M.S. university of Baroda, ૧૯૬૫ (૨ ગ્રંથો પૈકી પહેલામાં ગુજરાતી નાટકોની સૂચિ છે)

□ Catalogue of Gujarati Printed Books (૫ ગ્રંથો), લંડન ઇન્ડિયા ઓફિસ લાયબ્રેરી એન્ડ રેફરેન્સ, ૧૯૮૧ (૩ ડેટીયિક સોત)

Catalogue of Marathi and Gujarati Books in the Library of the British Museum, સંપા. જે. એઝ. બ્લૂમહાર્ટ; લંડન : બ્રિટિશ મ્યુઝિયમ, ૧૯૮૨, પૃ. ૨૩૨, ૧૯૬.

(A Supplimentary) Catalogue of Marathi and Gujarati Books in the Library of British Museum. (૨ ભાગ) સંપા. જે. એઝ. બ્લૂમહાર્ટ, લંડન બ્રિટિશ મ્યુઝિયમ, ૧૯૭૫

Catalogue of Native Publications of the Bombay Residency (૧૮૬૪ સુધીનાં મરાಠી અને ગુજરાતી પુસ્તકોની સૂચિ), સંપા. એલેક્ઝાન્ડર ગ્રાન્ટ; મુંબઈ :

એજયુકેશન સોસાયટી પ્રેસ, ૧૮૬૫, બીજી આવૃત્તિ ૧૮૬૭, પૃ. ૨૭૭

Catalogue of Native Publications of the Bombay Residency (૧૮૬૭ સુધીનાં મરાಠી અને ગુજરાતી પુસ્તકોની સૂચિ), સંપા. જેમ્સ પીલ; મુંબઈ : ૧૮૬૮. પૃ. ?

Indian National Bibliography પત્યેક અંકમાં પુસ્તકસૂચિ ને વાર્ષિક અંકમાં સંકલિત પુસ્તકસૂચિ પ્રગત કરતા આ સામયિકે ૧૯૫૮-૨૦૦૦ દરમિયાનના અંકોની સૂચિમાં ગુજરાતી પુસ્તકો પણ સામેલ કરેલાં છે); કલકત્તા : સેન્ટ્રલ રેફરન્સ લાયબ્રેરી, ૧૯૫૮-૨૦૦૦.

(The) Library of Congress Accession List : South Asia (આ માસિક સામયિકમાં ગુજરાતી પુસ્તકોની સૂચિ પણ સામેલ), નવી. હિલલી : લાયબ્રેરી ઓફ કોંગ્રેસ ઓફિસ, ૧૯૮૧-૧૯૮૬.

(The) National Bibliography of Indian Literature : ૧૯૦૧-૧૯૫૭, સંપા. બી. એસ. કેશવન, વાય. એમ. મૂરે; નવી. હિલલી : સાહિત્ય અકાદમી, ગ્રંથ ; ૧ થી ૫, ૧૯૬૨ થી ૧૯૮૦ ગ્રંથ-૧માં ગુજરાતી પુસ્તકોની સૂચિ)

૨ ખ વ્યાપક સૂચિઓ હસ્તપ્રત સૂચિઓ

અવેસ્તા, પહેલવી, ફારસી, ગુજરાતી હસ્તપ્રતોની યાદી, સંપા. દસ્તૂર હોરમજાદયાર કોઈઓજ મિરઝા; ઉદ્વાગા : ૧૯૭૧, પૃ. ૨૪

An Alphabetical List of Manuscripts in the Oriental Institute, Baroda (સંસ્કૃત-પ્રાકૃત-અપભંશ-જૂની ગુજરાતીની હસ્તપ્રતો), સંપા. રાધવન. નામ્બીયાર, વડોદરા ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યુટ, મ. સ. યુનિવર્સિટી, ૧૯૪૨
(૩ ગ્રંથો)

Oriental Treasures (ગુજરાતમાં પારસીઓના અંગત ગ્રંથાલયોમાં પડેલી, ઈચ્છાની અને અન્ય ભારતીય ભાષાઓમાં લખાયેલી, ૧૦૦૦ ઉપરાંત હસ્તપ્રતોની વર્ણનાત્મક નોંધો), સંપા. જમશેદ કાવસજી કર્ત્રક; મુંબઈ : ફેશો ગાર્ડ પ્રિન્ટિંગ પ્રેસ, ૧૯૪૧, પૃ. ૩૧૭

Catalogue of the Gujarati and Rajasthani Manuscripts in the India Office Library સંપા. જે. એફ. બ્લૂમહાર્ટ, સંવર્ધન આલ્ફેડ માસ્ટર; લંડન : ઓક્સફર્ડ યુનિ. પ્રેસ, ૧૯૫૪, પૃ. ૧૭૮

Catalogue of the Marathi, Gujarati, Bengali, Assamese, Oriya, Pushtu and Sindhi manuscripts in the Library of British Museum; લંડન : ક્રિટિશ મ્યૂઝિયમ, ૧૯૦૫ પૃ. ૭૪૭+૪૫૫+૩૪૪+૫૦
ચારણી આહિય પ્રદીપ (ચારણી હસ્તપ્રતોની સૂચિ), સંપા.

ઇશ્વરલાલ દવે અને રતુદાન રોહડિયા; રાજકોટ : સૌરાજુ યુનિવર્સિટી, ૧૯૮૧, પૃ. ૧૪+૧૬૩. (□ ચારણી હોવાથી વ્યાપકમાં મૂકી છે.)

(A) Descriptive Catalogue of Gujarati, Hindi and Marathi MSS of B. J. Institute Museum; (ખંડ-૧) સંપા. વિધાત્રી વોરા; અમદાવાદ : બી. જે. ઇન્સ્ટિટ્યુટ ઓફ લર્નિંગ એન્ડ રિસર્ચ, ૧૯૮૭, પૃ. ૫.

Descriptive Catalogue of Manuscripts in Bharatiya Vidyabhavan's Library; સંપા. એમ. બી. વર્ણકર, મુંબઈ : ભારતીય વિદ્યાભવન, ૧૯૮૫.

□ Descriptive Catalogue of the Govt. Collection of Manuscripts; ભાગ ૧થી ૮; પૂશે ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ, ? (* સંપાદક, પ્રકાશનવર્ષની વિગત મળી નથી. દૈતીયીક સોત)

□ રાજ્યસ્થાન પુરાતાત્વાન્દેશશ મંદિર કે હસ્તલિખિત ગ્રંથો કી સ્ન્યુ સંપા. મુનિ જિનવિજય; જેધપુર, રાજ્યસ્થાન પુરાતાત્વાન્દેશશ મંદિર, ખંડ-૧, ૧૯૫૮. ખંડ-૨, ૧૯૬૦. (દૈતીયીક સોત)

□ રાજ્યસ્થાન હસ્તલિખિત ગ્રંથસ્ન્યુ, સંપા. મુનિ જિનવિજય; ?, ખંડ-૧, સં. ૨૦૧૭ (ઈ. ૧૯૬૧) ખંડ-૨, સં. ૨૦૧૮ (ઈ. ૧૯૬૨) (દૈતીયીક સોત)

પત્રચર્ચા

પ્રિયાદર્શીય રમણભાઈ,

'પ્રત્યક્ષ', જુલાઈ-સાએ. '૦૭નો અંક મળ્યો. પ્રત્યેક અંકને કોઈ ને કોઈ રીતે વિશિષ્ટ બનાવવાની તમારી શૈલી મુજબ આ અંક વિશિષ્ટ બન્યો છે તમારા તંત્રીલેખને લીધો. વિચારોતેજક અને મનનીય ઢબે લખાયેલા લેખમાં તમે આવરી લીધીલા મુદ્દા વિશે ખરેખર તો એક વિચારશિબિર - સેમિનારની જરૂર છે. ઉમેરું કે હિન્દી અને ઠિતર ભાષાના સાહિત્યમાં 'લોકપ્રિય' ગણાત્મા સાહિત્યનાં સૌંદર્યશાસ્ત્ર અને રચનાકલા વિશે વ્યાપક સ્તર પર ચિંતન-પરિસંવાદ થાય છે.

હવે અંકનાં અન્ય લખાણો વિશે.

હિના મલ્હોત્રાની સ્મરણગાથા પ્રકાશન, નહીં કાયરનું કામ' વિશે કિશોર વ્યાસે ગંભીરતાપૂર્વક લખ્યું છે છતાં કેટલીક વિગતો રહી ગઈ છે જેની અહીં પૂર્તિ કરું.

પૃ. ૨૪ ઉપર કિશોર વ્યાસ આ પુસ્તકને મરાઠી વ્યાવસાયિક પ્રકાશકની સ્મરણકથા તરીકે ઓળખાવે છે. વાસ્તવમાં હિના મલ્હોત્રા (જેનું આપું નામ હિનાનાથ છે એ પણ કયાંય કિશોર વ્યાસે સ્પષ્ટ કર્યું નથી) મરાઠી પ્રકાશક નથી. એમના પ્રકાશનગૃહ દ્વારા મરાઠી પુસ્તકો પ્રગત થયાં હશે, પણ એમની મૂળ પ્રકાશનસંસ્થા હિંદ પોકેટ બૂક્સ આરંભે તો (ને ઘણા દાયકા સુધી) કેવળ હિંદી અને ઠિતર ભાષામાંથી થયેલાં હિંદી અનુવાદો જ પ્રકાશિત કરતી હતી. ઉપરાંત પછીનાં વર્ષોમાં તેમજે 'સરસ્વતી વિહાર' નામથી હિંદીનાં પાકા પૂંડાનાં પુસ્તકો પ્રગત કરતી સંસ્થા શરૂ કરી અને અંગ્રેજીમાં ઓરિઝેન્ટ પેપરબેલ્સ તથા પાકા પૂંડાનાં પુસ્તકો 'ફૂલ સર્કલ' નામથી પ્રકાશિત કરે છે. (આ સંસ્મરણોની હિન્દી આવૃત્તિ પણ સરસ્વતીવિહાર દ્વારા પ્રકાશિત થઈ છે.)

ગુલશન નંદા ઉપરાંત સંખ્યાબંધ નવલકથાઓ-વાર્તાઓ લખનાર હિન્દીનાં લેખિકા શિવાનીનાં પુસ્તકો ત્રણેક દાયકા સુધી હિંદ પોકેટ બૂક્સ દ્વારા જ પ્રકાશિત થયેલાં. વળી, એની સૌથી લોકપ્રિય શ્રેણી રાજહંસ, કર્નલ રંજિત વગેરે ઉપ/

ઇમનામો દ્વારા લખાયેલાં પુસ્તકોની હતી.

ભારત-પાક વિભાજન વખતે કોઈ મુસ્લિમ લેખક હિંદુ દેવીદેવતાઓ વિશે અભદ્ર લખાણો ધરાવતાં પુસ્તકો લખેલાં. એના પ્રત્યુત્તર રૂપે કોઈ આર્થિક સાહિત્યમાણ લેખક 'રંગીલા રસૂલ' નામથી હજરત મહિમાદ પયગંબર વિશે પુસ્તક લખેલું, જે પ્રગત થતાં જ કોમી હુલ્લાને ફાટી નીકળેલાં. હિનાનાથ મલ્હોત્રાના પિતાએ આ પુસ્તકના પ્રકાશનની જવાબદારી સ્વીકારેલી એના કારણે તેમની હત્યા થઈ. આ ઘટનાક્રમ ઉક્ત સ્મરણગાથાનો રોમાંચક હિસ્સો છે.

આ સ્મરણગાથામાં હિનાનાથે રા. સ્વ. સંઘ અને ભારતીય જનતા પાર્ટી સાથેના પોતાના સંબંધો વિશે પણ વાત કરી છે જે એમની, બલકે એમના પરિવાર અને પ્રકાશનગૃહની વિચારધારા પ્રગત કરે છે. આનો ઉત્ખેખ પણ થાં જોઈતો હતો કેમકે એના મૂળમાં મલ્હોત્રા પરિવારે લાખોરથી કર્યું પડેલું સ્થળાંતર અને મુસ્લિમો દ્વારા નિરાશ્રિતો પર થયેલા અત્યાચાર છે.

વિદ્ધાન રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન, હિન્દીના લોકપ્રિય લેખક ચતુરસેન શાસ્ત્રી અને સંખ્યાબંધ જાહેર હિતની અરજીઓ દ્વારા જનહિતનાં અનેક કામો કરનાર સ્વ. એચ. ડી. શૌરી જેવા લેખકો સાથેનાં મલ્હોત્રાનાં સંસ્મરણો એમાં આવેખાયાં છે. - આ સર્વનો ઉત્ખેખ થાં જોઈતો હતો.

પરિષદ વિશે ઉકેશ ઓઝાએ લખેલા લેખમાં એ લેખના કદ જેટલો જ સુધારો-ઉમેરો સૂચાવી શકાય છે (જેમકે ધીરુબહેન પટેલ એકમાત્ર મહિલા પ્રમુખ નથી, લેરી વિદ્યાળોરી નીલકંદ પણ પ્રમુખ રહી ચૂક્યાં છે) પણ પ્રત્યક્ષનાં પૃષ્ઠોનું મૂલ્ય હું સમજું છું...

કુશળ હશો.

આપનો રાજેન્દ્ર મહેતા

* ડૉ. કેશુભાઈ દેસાઈએ પણ આ બે બાબતો વિશે ધ્યાન દોર્યું છે એ માટે લેખક અને સંપાદક એમના પણ આભારી છે. - સંપાદક

પ્રિય રમશ,

અભિમુખને પ્રત્યક્ષ ઓળખવાની વાત જુલાઈ-ઓગસ્ટ ૨૦૦૭ના અંકમાં વાંચ્યા પછી આપણી વચ્ચે ફીન પર લાંબી ગપસપ થઈ. તમે કહ્યું કે, તો પછી આ બધું લખી મોકલો ને ! તો આ કાગળ. બાકી વિદ્વજજનો સાથે વિવાદ-ચર્ચા કરવાં નથી. માત્ર કવિ તરીકે અરધું-પરધું બોબડું-ગૂંગણું બોલી જાણીએ અને રોજ શિખવાડેલી ફલાઈંગ ડિસની સાથોસાથ બાઈબાઈ ટાયનો હાથ હલાવી રમતરમતમાં ભાગી છૂટીએ, રમણ દોસ્ત !

પ્રજા સાહિત્યવિમુખ થઈ છે – કશાક પણ કારણે. પ્રજા સાહિત્યવિમુખ ક્યારે હતી ? અને એ આવશ્યક છે કે ? કશુંક પણ, જે સાહિત્ય નયે હોય તોય વાંચનારા આખરે કેટલા ? તો પછી જીવનને પ્રજાભિમુખ સાહિત્ય કે સાહિત્યેર છ્યાયલો શાઢ કેટલા. અંશે બદલી શકે ? અભણ પણ ન હોય છતાં છાપું સુધ્ધાં વાંચનારની સંખ્યા/ટકેવારી કેટલી ?

પ્રજાભિમુખ થવાની પાત્રતા કેવી રીતે કેળવાય, પમાય, પ્રમાણાય ? અને પછી એ પાત્રતાનો લેખકની સાહિત્યિક પાત્રતા સાથે કેવી રીતે મેળ જોડવાશે ?

સાહિત્યની ઉપયોગિતા એક વદતોબ્યાઘાત અસંબંધિતતા છે. કલા કદીય કશાય ઉપયોગ માટે નથી હોતી.. છેક ઓગણીસમી સદીમાં એડગર એલન પો જે કહી ગયેલો તેનાથી ત્યારના ફેન્ચ સાહિત્યકારો અંજાઈ ગયેલા અને એમણે યુરોપમાં આધુનિકતાનો આરંભ કર્યો.

તમે લખ્યું છે ‘તો પછી સાહિત્યકારે, આજે પણ, સર્વલોક-અભિમુખતાનું અશક્ય અને બિનજરૂરી (અહીં ‘અનાવશ્યક’ શાઢ ઉચિત રહેત, સાથેના સંસ્કૃત તત્ત્વમ શાદ્યો સાથે પ્રાસાં પણ જોડાઈને) લક્ષ્ય રાખવા જેવું નથી.’ તો તમને વાહ વાહ કહું છું. વળી સાહિત્યકાર એવું કરવા જાય તો પણ ‘થઈ થઈને કેટલો લોકપ્રિય થવાનો ?’ (કમળ છ કરોડની પાંખીનું છે !) આનો જવાબ બાળપણથી વારેદ્ધીએ સંભળતા આવ્યા છીએ – જે અમારા બાલવયના શિક્ષકો એમના બાલવયસ્ક શિક્ષકો પાસેથી શીખી આવેલા. નરસી મેતાનાં પ્રભાતિયાં ગુજરાતી પ્રજા સદીઓથી ગાતી આવી છે એ માન્યતા પ્રમાણ રહી લોકાભિમુખતાનું. કોઈએ ખરેખર તપાસ કરી જ હતી કે પ્રજાનો કેટલો હિસ્સો પ્રભાતિયાં ગાતો હતો; અને ગાનારાંમાંથી કેટલાં જાણતાં હતાં કુ આ નરસિંહ મહેતાની રચના; વળી જે ગાતાં હતાં તે એમાંથી પ્રતીત સાહિત્યિકતાને ઓળખીને કે કોઈ અન્ય

કારણે ? અને સાચોસાચ જુઓ તો સંસ્કૃત પરંપરામાંથી અનુવાદ કરેલાં પદોમાં સુભાષિતભર્યા કેટલાં અને એમાં શુદ્ધ કલા કેટલી ? નરસિંહ મહેતાના આદિકાલથી સાંપ્રત લગીના ભક્તો અવશ્ય હથમાં હથિયાર જાલી ધરી આવશે યાલિયા દિ.જ.ને હણી નાખવા. નરસિંહની ખીરીએ મનજ્ઞવતા અર્થ રીંગડેલા છે એ સાચવી રાખવા માટે. પણ પ્રેમાંદ જ પહેલો ગુજરાતી ખરેખરો કવિ એ નાડું હું છેક લગી નહીં છોડું. અને એ જ પહેલો કવિ હતો જે સમૂહમાધ્યમોના પ્રવાહથી બીવાને બદલે એમની ઉપર સવાર થઈ, બાથમાં કવિતાને સંગ્ઘોપાંગ જાળવીને આવ્યો. તોપણ, પ્રેમાંદની કવિતાને જાણનાર કેટલા ? લોકોને કવિતા સાથે શી લેવાદેવા છે ?

સામે પદ્ધે કવિતાને તો સાચોસાચ લોકોની સાથે, એમના જીવન સાથે લેવાદેવા છે. કવિ માટે લોકજીવન એક ભૂમિકા છે જેને પર્યાયે કલાની ભૂમિકાની અપેક્ષા કરી શકાય. કોઈ પણ માનશે કે લોકોની જેમ જ જીવનારો કલાકાર લોકોથી કંઈક વેગળો તો છે જ. આ વેગળાપણું ભૂમિકાભેદને કારણે છે. અને એથી જ લોકો અને કલાકાર વચ્ચે, જીવન અને કલા વચ્ચે એક અવ્યાખ્ય પણ નિશ્ચિત ભેદ રહેવાનો જ – મારી અને ઝડ વચ્ચે હોય એવો, ફૂલ અને સુગંધ વચ્ચે હોય એવો. મારી વિના ફૂલ ન હોય. પણ ફૂલ સુગંધને સમજે જ છે એમ માની ન લેવું. તેથી ‘અમારી ફૂલ અને પણ સમજજીએ છીએ એમ માની ન લેવું’ને પ્રલાપ માની લેવા કરતાં શોખમાં અને શોખીમાં બોલાઈ ગયેલું અણજાણ સાચ સમજજું જોઈએ.

આ સમજવાની અથવા તો પામવાની જેને ઈચ્છા છે તેને માટે જ સાહિત્યનો કોઈ અર્થ છે. કલાનો અનુભવ લેવો એ એક નિર્ણય છે. અને જેણે આ નિર્ણય નથી લીધો તેને કેન્દ્રમાં કે પરિધિમાં પણ લક્ષ્યવાની કલાકારને કોઈ આવશ્યકતા નથી. વળી નિર્ણય માત્ર જ પર્યાય નથી પાત્રતાનો. જેમ કવિતા લખવાનો નિર્ણય કર્યો એટલે કવિતા સંભવશે જ એવું થોડું નિશ્ચિત છે ? અવિકારી સહદયનો જાપ તો ગુજરાતીમાં શતાધિક વર્ષોથી થતો જ આવ્યો છે ને ! ભાવકનું જ આ લક્ષ્યાની નથી, કલાકારનું પણ એ જ. એટલે જો સાહિત્યનો વિષય લેનાર વિદ્યાર્થીને આપણે ભોગે ભાવે ભાવક-દીક્ષાર્થી માની લઈએ તો અન્યાય છે. અને કલાનો આ વિદ્યા-વ્યવસાય સાથે વ્યાવહારિક આવશ્યકતાનો સંબંધ જોડવો તે પણ અન્યાય છે. સાથોસાથ અન્ય કલાકારની તેમજ અન્ય સમય-ક્ષેત્રની કલા-રચનાઓનો અભ્યાસ કર્યા વિના કલાદીક્ષાર્થી કલાકાર ન થઈ શકે એ પણ ભૂલવાનું નથી.

‘પુસ્તકપ્રકાશન વધ્યું છે એને ગ્રાહકો મળે છે એટલા વાચકો નથી મળતા’ (ચાહકો નથી મળતા !) પ્રજાની વધતી જતી સંખ્યાને સાપેક્ષે આ વિધાનનું અને એમાં અપિહિત યાચિકાનું તથ કેટલું ?)

અરે, કશુંય દવ્ય ખોયા વિના - શિષ્ટ, સન્માન્ય સંસ્થાનાં આમંત્રણ, વર્તમાનપત્રમાં પ્રકાશન આદિ આવશ્યક ઔપચારિકતાઓથી પૂર્વ મળ્યા પદ્ધીય મહત્વના સાહિત્યિક કાર્યક્રમમાં આવનાર ડેવણ ત્રીસ-ચાયાસ રસ્સિકોમાંથી પણ દિલીપભાઈ, તમારી ગજલોનો તો હું પહેલેથી જ ચાહક હું કહેવાવા મને વારંવાર મળ્યા છે તો પદ્ધી ગ્રાહકોની કરી અપેક્ષા ?

અધ્યાપકો-સન્મુખ એકઠાં થતાં અસહય તરુણ જોનમાં ઔત્સુક્યનું આરોપણ પણ એવું જ ભાંતિજનક કે જનિત છે. મેં ય ત્રણસો સામે દ્વિશિયારી મારી છે ! આ લોકાભિમુખ થવાની આવશ્યકતા અને હુર્ભોધતાની અનાવશ્યકતા (ખરેખર તો જ્યાં અવકાશવિસ્તારની કે ચેતોવિસ્તારની શક્યતાઓ વિશેષ હોય તે હુર્ભોધ મનાયું છે.) માટેની ઝુંબેશમાં અધ્યાપકોનો અવાજ ઊંચો રહ્યો છે. અને કેટલાક કલાકાર એથી બીતા પણ થયા છે. આધુનિક સમયના કવિઓમાંથી નામ લઈને કહીએ તો રમેશ પારેખ સૌને કેવા રાજ રાખ્યા હતા ! અને શૈશવકાળે અંધારિયાં ભૌંઘરાં કે આડેધ ભરચુક ભરેલાં અજવાણીયાં માળિયાંમાં એકલા પડીને ડરી જતા બાળકની જેમ આજે પણ કેટલાક કવિઓ બાળવયમાં આશરો લેવા જતાં વળી ફરી તડકાની ટાલવાળા ગાંધીજીની નવેસરથી રમૂજ કરતી કે સિનેમા-ટેલિવિઝનના નાચના તાલ ભેણો તાલ જોડતી (બીતેશ સાનંદસચા મુંબઈના - ભૂરં જીન્સ પહેરેલા અસલી) સુરેશ દલાલને રાજ રાજ કરી દે તેવી, કે પછી માણેકલાલ ઘ. કણબીને પોરસ ચડાવે તેવી તળપદી રચનાઓ લખીને કે સ્વર્ગસ્થ જ્યંત કોઈારી પાછા પધારે એવી મધ્યકાલીન ભાષાની અને સંત-સુરતા-સાહેબ-સાંઈ બોલીની કવિતા કરીને અંધારું કે ઘમસાણ છૂમંતર થઈ જાય એવી ભોળી ઉમેદ કરે છે ને ! બચ્યાડો કવિ આખરે તો માટીનો જ ઘડેલો માણસ છે ને ?

એટલે દોસ્ત, કરી લો કબૂલ કે (અમે આધુનિક કહેવાયા ત્યારે હતું તેમ) આપણે આપણા થોડાધારા દોસ્તો માટે જ લખીએ છીએ. પોતાની કીર્તિના મહેલના એકસો દસમે માળે બેઠેલા એકસો વીસ વરસની ઉમરના અંધળા બોહેસે છેવટની કોઈ ચોપડીની પ્રસ્તાવનામાં આ કર્યું હતું, તે મેં ચોર્યું. પણ જો સંવાદ સાધવો હોય તો એમની સંખ્યાને

બીજ ભાષાઓના, કલાઓના મિત્રોની સંખ્યા સાથે જોડીએ. એમની આવશ્યકતા પણ સરખી જ છે.

અહીં જોડીએ સંપાદકોની જવાબદારી. નિયતકાલિક કે અનિયતકાલિક, પ્રતીક પુરસ્કાર દાતા કે પુરસ્કાર દેવાને અસમર્થ સંપાદકો લેખકે એવું તો કશુંક નક્કર આપી શકે કે જેને અડી શકાય.

પોતાના સામયિકમાં છાપેલી સામગ્રી વિશે લખે. આવું કવિતા માટે બચુભાઈ કરતા અને જ્યંત પારેખ પોતાની સગવડે અને સુમન શાહ (ક્યારેક પ્રતીક રૂપે) આવું કરે છે. બાકીના ઘણાય મૂક પંગુ પરમાનંદ ઈતિહાસ પ્રભુની પ્રતીક્ષામાં કોઈ સાવ ખોટું બોલવાનું પણ આદરે જે અમારી જેવાના જરી બહેરા કાનમાં મંદમતિગતિ ગિરિરાજ નહાનાલાલ આર્દરતના અતિશયોક્તિ-ભર્યા ઉચ્ચારના પડધા જેવું લાગે.

‘પ્રત્યક્ષાનાં પાનાં તો કેટલાંય ગ્રંથિત અને લક્ષપાત્ર કલાસાહસોને નોંધવા માટે પણ પૂરાં નથી પડતાં. પણ સામયિકોમાં થતાં પ્રકાશનો માટે એમના સંપાદક બે-ત્રણ પાનાં તો ફાળવે !’ પ્રજાને માટે પ્રતિબદ્ધ થવાનું લેખકોને આહ્વાન કરતા તંત્રીઓ સાહિત્યને માટે તો પ્રતિબદ્ધ થાય ! (વળી કહી આ વિશે તો વિગતે વાત લખવી છે.)

તો સોની રમણ, તમે આરંભથી જ, સોળ વરસથી તાવી-તપાવીને ઘાટ ઘડો-ઘડાવો છો. પણ મારીમાંથી સોનું નિપાલવતા ખાણિયાઓને દારી પૂરું કોણ દે છે ? પછી તો તારી પીને એ મેલાંદેલાંમાં બંધુ ભૂલી જાય એ જ લાગનું ને ! તમે તો એવા નિસર્ગરાગી કે તમને પાણી દેખીને દૂબકી દેવી ગમે. અને અમે તો દારમાં દૂબ્યા તો ય હવે નશો નથી ચડતો એવી રીતે વાસ્તવિકતા સામે ઘૂર્કી રહી છે, કવિતાની ઝૂપડીને કરડીનહોરી તીતરબીતર કરી દીધીલી વાઘણ જેવી.

તો મારા જતભાઈ, હુંય પરજિયો સોની છઉં, વાદેસરી માતા જેની કુણટેવી (કે વાગીસરી માતા !) એવા એક ધંધાના આપણે બેઉ, આ કાગળ વાંચીને મેળવો હાથ. જાલી રાખશો તો કંક આસરો રેશે.

- દિલીપ જીવી

ગત અંકમાં, નોભેલ પારિતોષિક વિજેતા લેઝિકાનું નામ ડોરિસ લેસિંગને બદલે સરતચૂકથી ડોરેથી લેસિંગ છપાયું હતું તે તરફ શ્રી પ્રબોધ જોશીએ સસ્નેહ ધ્યાન ખેંચ્યું હતું. એ માટે, ક્ષમાયાચનાપૂર્વક આભારી છીએ

- સંપાદક

પરિચय ભિતાકશી

સ્વીકાર-સમાવોચના માટે પ્રકાશકો અને લેખકો તરફથી મળેલાં પુસ્તકોની પરિચયનોંધ

કવિતા

આપણાં વર્ષાકાવ્યો – સંપા. હર્ષદિવ માધવ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૬, રી. ૧૫૨, રૂ. ૭૫ ૧૪ ગુજરાતીનાં વર્ષાવિષયક કાવ્યોનું સંપાદન
ઝતુરાજ વસ્તં – સંપા. હર્ષદિવ માધવ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૬; રી. ૧૨૪, રૂ. ૬૫ ૧૪ વસ્તંવિષયક ગુજરાતી કાવ્યો
કુરુક્ષેત્ર (ન્હાનાલાલ) – સંપા. ભોળાભાઈ પટેલ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૭, રી. ૪૭૨, રૂ. ૨૨૦ ૧૪ ન્હાનાલાલના, ૧૯૪૦ સુધીમાં પ્રકાશિત થયેલા ‘મહાકાવ્ય’, કુરુક્ષેત્રનું સંકલિત પુનઃ પ્રકાશન
કોઈ બીજું એક – હરેશ ‘તથાગત’ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ૨૦૦૭, રી. ૧૧૦, રૂ. ૫૦ ૧૪ ૧૦૧ ગજલકાવ્યો.
ગોરખ ગોપાલમૃ – ઈન્દુ શાહ પ્રકા. લેખક, યુ.એસ.એ., ૨૦૦૭, રી. ૧૪૪, રૂ. ૨૫૦ ૧૪ ઈન્દુ શાહનાં કાવ્યો અને એના ફારુક સલાટે કરેલા અંગેજ અનુવાદો.
જીવનનાં ગાણાં – ચાવીકાન્ત દવે બુધસભા, શિશુવિહાર, ભાવનગર, ૨૦૦૭, રી. ૨૪૮, રૂ. ૧૨૫ ૧૪ કાવ્યો.
પ્રાપ્ત્યક્ષ – પ્રાણજીવન મહેતા ઠેમેજ, મુંબઈ-અમદાવાદ, ૨૦૦૭, રી. ૧૬૪, રૂ. ૧૫૦ ૧૪ વિવિધ વિષય/સંશા-જૂથમાં રચાયેલાં કાવ્યો.
ભાવણની કાવ્યકૃતિઓ – ખંડ ૧, ૨ – સંપા. બળવંત જાની ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૭, ખંડ-૧ : રી. ૩૪૦, રૂ. ૧૫૦; ખંડ-૨ : રી. ૬૨૪, રૂ. ૨૩૫ ૧૪ ભાવણની સર્વ કૃતિઓનું સંપાદન, અભ્યાસલેખો ને નોંધો સાથે.
મનહર પદ (મનોહરસ્વામી) – સંશો. સંપાદન રમેશ શુક્લ ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરત, ૨૦૦૭; રી. ૧૫૪ રૂ. ૧૦૦ ૧૪ કવિ નમિદ સંપાદિત કરેલાં ને પદી ભવાનીશંકર દ્વિરેદીએ વ્યવસ્થિત કરી પ્રકાશિત કરેલાં (૧૯૮૭) મનોહરસ્વામીનાં

કાવ્યોનું સંશોધિત સંપાદન.

મૌન તશો મસ્તાનો – સંપા. હારીત દવે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૬; રી. ૧૬૮, રૂ. ૧૦૦ ૧૪ જ્યાનંદ દેનાં કાવ્યોનું સંકલિત સંપાદન.

રાજેન્દ્ર શાહનાં સોનેટ – સંપા. હર્ષદ ત્રિવેદી ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૭; રી. ૨૦૦, રૂ. ૫૦ ૧૪ રાજેન્દ્ર શાહનાં સોનેટોમાંથી પસંદગીનાં સોનેટનું, અભ્યાસલેખ સાથેનું સંપાદન

રધાકૃષ્ણ વિના બીજું બોલ મા – સંપા. ઉષા ઉપાધ્યાય ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૭; રી. ૨૭૨, રૂ. ૧૨૦ ૧૪ મધ્યકાલીન ગુજરાતી કવિનીઓનાં કાવ્યોનું સંપાદન.

વેદનાં શિખરો – અનુ. પ્રદીપ ખાંડવાળા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૭; રી. ૮૬, રૂ. ૮૨ ૧૪ રિલેનાં ‘દુઈનો એવેજી’ કાવ્યોના અનુવાદો અને આસ્વાદો.

વૃદ્ધાવન મોરલી વાગે છે – સંપા. ભોળાભાઈ પટેલ, અનિતા દલાલ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ૨૦૦૭; રી. ૩૨૦, રૂ. ૧૬૦ ૧૪ ભારતીય કૃષાભક્તિ કવિતા – અનુવાદ અને નોંધ.

શબ્દ મેં પ્રેમભક્તી વાગ્યો છે – ઉશનસુ. દર્શક ફાઉન્ડેશન, અમદાવાદ, ૨૦૦૭; રી. ૧૨૮, રૂ. ૮૦ ૧૪ ૧૦૮ કાવ્યકૃતિઓ શૂન્યતામાં પૂરેલા દર્શિયાનો તરખાટ – સંપા. ઉષા ઉપાધ્યાય ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૭; રી. ૪૨૮, રૂ. ૨૫૦ ૧૪ અર્વાચીન ગુજરાતી કવિનીઓનાં કાવ્યોનું સંપાદન.

સરળ – સ્વીકાર પારેખ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ૨૦૦૭; રી. ૧૧૨, રૂ. ૫૦ ૧૪ ગિતો, ગાજલો.

લાગી કથારી પ્રેમની – સંપા. સુરેશ દલાલ ઠેમેજ, મુંબઈ-અમદાવાદ, ૨૦૦૭; ડાબલ તેમી ૫૮૦, રૂ. ૫૦૦ ૧૪ વિશ્વનાં પ્રેમકાવ્યો, વિવિધ લેખકોના ગુજરાતી અનુવાદ સાથે.

વार्ता

અંકુર - મોહમેદ માંકડ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૭; ઢ. ૨૦૦, રૂ. ૫૦ ઓ ૩૬ લેખકે પોતે પસંદ કરેલી પોતાની ૨૬ વાર્તાઓ.

એક નમતી સાંજે - સિમતા પારેખ પ્ર. લેઝિકા, સુરત, ૨૦૦૭ (પ્રાપ્તિસ્થાન - સાહિત્યસંગમ, સુરત), કા. ૧૧૨, રૂ. ૧૦૦ ઓ ૩૬ ટૂંકીવાર્તા સંગ્રહ

ગુજરાતી નવવિકાશયન ૨૦૦૪ - સંપા. ભરત નાયક ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ૨૦૦૬; ઢ. ૨૨૪, રૂ. ૧૧૫ ઓ ૨૦૦૪ના વર્ષમાં સામયિકોમાં પ્રગટ થયેલીમાંથી ઉત્તમ / નોંધપાત્ર લાગેલી વાર્તાઓનું સંપાદન - સંપાદકીય લેખ સાથે.

[ગુજરાતી] ૨૦૦૪ની શ્રેષ્ઠ વાર્તાઓ - સંપા. દીપક મહેતા આર. આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, ૨૦૦૫; કા. ૨૭૪, રૂ. ૧૨૫ ઓ ૨૦૦૪ના વર્ષમાં સામયિકોમાં પ્રગટ થયેલીમાંથી ઉત્તમ લાગેલી વાર્તાઓનું સંપાદન - સંપાદકીય લેખ તથા ૨૦૦૪માં સામયિકોમાં પ્રગટ થયેલી સર્વ વાર્તાઓની લેખકનામ-અનુચારી સૂચિ સાથે.

લાડુની જત્તા અને બીજી વાર્તાઓ - સંપા. રેણુકા સોની ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૭; ઢ. ૨૨૪, રૂ. ૫૦ ઓ ૨૦૦૪ રમણલાલ સોનીના સંગ્રહોમાંથી પસંદ કરેલી ૫૧ બાળવાર્તાઓ.

(શ્રી) ઘનશ્યામ દેસાઈની વાર્તાઓ - સંપા. કિરીટ દૂધપાત ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૬; ઢ. ૧૦૪, રૂ. ૫૦ ઓ ઘનશ્યામ દેસાઈની વાર્તાઓમાંથી પસંદ કરેલી ૧૨ વાર્તાઓ - સંપાદકીય લેખ તથા ઘનશ્યામ દેસાઈની 'મુલાકાત' સાથે.

સંસાર - સંપા. અસ્મા માંકડ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૪; ઢ. ૨૨૪, રૂ. ૫૦ ઓ ૨૦૦૪ ગુલાબદાસ બોકરની વાર્તાઓનું સંપાદન

નવલક્થા

એકલબ્ય - રધુલીર ચૌધરી ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, (પુનઃ) ૨૦૦૭; ઢ. ૨૭૨, રૂ. ૫૦ ઓ ૧૮૬ રૂમાં પ્રગટ થયેલી નવલક્થાનું પુનર્મુદ્રણ.

હિંદ અને છિટાનિયા - ઈચ્છારામ શૂર્યરામ દેસાઈ, સંપા. રમેશ શુક્લ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, (પુનઃ) ૨૦૦૭; ઢ. ૨૭૬, રૂ. ૧૧૫ ઓ ૬૪ ઈચ્છારામ દેસાઈની ૧૮૮૫માં 'એક

રાજકીય ચિત્ર' એ નામે પ્રગટ થયેલો આ ગ્રંથ કથાત્મક રૂપે આવેખાયેલો છે. એનાં સામગ્રી અને સ્વરૂપ વિશેના સંપાદકના સુદીર્ઘ લેખ સાથેનું આ પુનર્મુદ્રણ છે.

નાટક

Three Gujarati Plays by Madhu Rye ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૭; ઢ. ૨૮૪, રૂ. ૧૫૦ ઓ મધુરાયાનનું ત્રણ નાટકોના ગુજરાતી અનુવાદ - એક લેખક દ્વારા, બે નાટકો વિજય પડાકી દ્વારા.

ચરિત્ર

આપણા કાંતિકારીઓ - જિતેન્દ્ર પટેલ પાર્શ્વ, અમદાવાદ, ૨૦૦૭; રૂ. ૧૨૫ ઓ ૧૦૧ કાંતિકારીઓ વિશે એક એક પાનાંનો પરિચય, દરેકનાં (અજિત વાધેલાએ કરેલાં) ચિત્રો સાથે.

જીવરામ ભઙ આવ્યા - સંપા. દિનકર ભોજક થિયેટર મીડિયા સેન્ટર, અમદાવાદ, ૨૦૦૭; ઢ. ૧૪૪, રૂ. ૧૫૦ ઓ જૂની રંગભૂમિના કળાકાર પ્રાણભૂમિ નાયકે લખેલી આત્મકથાનું સંપાદિત પ્રકાશન.

તરસ્યા મલકનો મેઘ - મણિલાલ હ. પટેલ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ૨૦૦૭; ઢ. ૧૮૪, રૂ. ૧૫૦ ઓ ૫૦૦૦ાલાલ પટેલનું કથાપ્રધાન શૈલીમાં લખાયેલું બ્યક્ટિસર્જક-ચરિત્ર

નિબંધ

સુદર્ધન ગદ્વાગુચ્છ : ૪ - સંપા. ધીરુભાઈ ઠાકર ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૭; ઢ. ૫૨૪, રૂ. ૧૮૫ ઓ મણિલાલ ન. દ્વિવેદીના 'બાળવિલાસ', સારસંગ્રહના નિબંધો ગૌરીદાસ ઓઝા ચરિત્ર તેમજ, પરિશિષ્ટમાં, મણિલાલને લગતા અપ્રગટ પત્રો.

વસેત અને ઈહામૃગ - વિજ્ઞુ પંડ્યા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૬, ઢ. ૧૮૬, રૂ. ૧૧૦ ઓ લેખકે પોતાના નિબંધમાંથી કરેલું ચયન.

છાસ્ય સાહિત્ય

શ્રેષ્ઠ હાસ્યરચનાઓ (ન. પ્ર. બુચ) - સંપા. ચિત્રલાલ બોરીસાગર ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ-૨૦૦૭ ઢ. ૨૧૬, રૂ. ૧૦૦ ઓ ન. પ્ર. બુચના હાસ્યલેખો-નિબંધો,

કાવ્યરચનાઓનું સંકલન – અભ્યાસ લેખ સાથે
હાસ્યનો વરઘોડો – શાહીબુદ્ધીન રાઠોડ ઈમેજ, મુખેંદ્ર-
અમદાવાદ, ૨૦૦૭; રૂ. ૧૫૦ ^{૧૪} હાસ્ય-લેખોનો સંગ્રહ.

વિશેચન-સંશોધન

અંગવિષ્યક રૂપુણીએટ્ટાઈસ્ટ – વિષયક રેખાઈ સાહિત્ય અકાદમી, ડિલ્લી,
૨૦૦૭; રૂ. ૬૫, રૂ. ૪૦ ^{૧૪} જ્યંતિ દલાલના જીવન અને
સાહિત્યકાર્યનો સમીક્ષાત્મક પરિચય આપતો લઘુગ્રંથ,
હિન્દીમાં.

પૂર્વિન્દીશ – ઉર્વશી પંડ્યા આદર્શ, અમદાવાદ, ૨૦૦૭; કા.
૧૬૦, રૂ. ૧૦૦ ^{૧૪} નવ વિશેચનલેખોનો સંગ્રહ.

ભોગીલાલ સાંડેસરા – રણજિત પટેલ ‘અનામી’ આદર્શ,
અમદાવાદ, ૨૦૦૭; કા. ૮૮, રૂ. ૫૫ ^{૧૪} ભોગીલાલ
સાંડેસરાના જીવન અને સાહિત્યકાર્યનો સમીક્ષાત્મક પરિચય
આપતો લઘુગ્રંથ.

મુનશી-પન્નાલાલની પૌરાણિક નવલકથાઓ – રાજેન્દ્ર રોહિત
પ્રકા. લેખક, વડોદરા, ૨૦૦૭; વિકેતા ડિવાઈન પાલિકેશન્સ,
અમદાવાદ; રૂ. ૩૪૬, રૂ. ૨૦૦ ^{૧૪} શોધપ્રબંધ.

રચનાબોધ – ગુજરાતી વ્યાસ પ્રકા. લેખક, વડોદરા, ૨૦૦૭,
વિ. પાર્શ્વ, અમદાવાદ; રૂ. ૧૫૮, રૂ. ૧૨૦ ^{૧૪} વિશેચનલેખોનો
સંગ્રહ

લઘુકૃથા : સ્વરૂપ પરિચય – મોહનલાલ પટેલ પ્રકા. લેખક,
અમદાવાદ, ૨૦૦૭; વિ. આદર્શ, અમદાવાદ; કા. ૧૬૦, રૂ.
૧૦૦ ^{૧૪} સ્વરૂપ-ચર્ચા.

વિશેચન – દર્શિની દાદાલાલ પાર્શ્વ, અમદાવાદ, ૨૦૦૭; રૂ.
૩૧૮, રૂ. ૧૭૫ ^{૧૪} ગુજરાતી સાહિત્ય વિશેચન અને કેટલાક
વિશેચકો વિશેનો શોધપ્રબંધ

વિશેચનાત્મક સાહિત્ય (ન્હાનાલાલ) – સંપા. રિમનલાલ ત્રિવેદી
ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૭; રૂ. ૪૦૮,
રૂ. ૧૮૫ ^{૧૪} કવિ ન્હાનાલાલના સાહિત્ય વિશેચન વિષયક લેખ-
ગ્રંથોનું સંકલિત સંપાદન – અભ્યાસલેખ સાથે.

સુંદરમુ – રમેશ એમ. ત્રિવેદી આદર્શ, અમદાવાદ, ૨૦૦૭,
રૂ. ૧૬૪, રૂ. ૧૦૦ ^{૧૪} સુંદરમુના જીવન અને સાહિત્યકાર્યનો
સમીક્ષાત્મક પરિચય આપતો લઘુગ્રંથ.

ભાષા, ભાષાવિજ્ઞાન, સૂચિ, કોશ

અંગવિષ્યક રૂઢિપ્રયોગો – બિપિન આશર પ્રકા. લેખક,

રાજકોટ, ૨૦૦૭; વિ. સાહિત્યધારા, રાજકોટ; રૂ. ૧૧૮, રૂ.
૧૨૦ ^{૧૪} શરીરનાં અંગો વિષયક રૂઢિપ્રયોગો, અર્થ સાથે –
રૂઢિપ્રયોગો વિશેના સંપાદકના લેખ સાથે.

સ્વાધ્યાયસૂચિ (પુસ્તક ૧થી ૧૫) – સંપા. જ્યંત ઉમરેઠિયા
પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા, ૨૦૦૭; ડબલ કાઉન, પૃ. ૨૮૬,
રૂ. ૨૧૫ ^{૧૪} સ્વાધ્યાય સામયિકમાં પહેલાં ૨૫ વર્ષ (૧૯૬૩-
૧૯૮૮) દરમિયાનમાં પ્રકાશિત સામગ્રીની વર્ષવાર, લેખકવાર,
વિષયવાર કરેલી સૂચિ.

હસ્તપ્રત વિજ્ઞાન – જ્યંત પ્રે. ઠાકર ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ,
અમદાવાદ, ૨૦૦૬; રૂ. ૧૮૨, એની પુરવણી રૂ. ૫૬, બંનેની
કિમત રૂ. ૨૦૦ ^{૧૪} ‘ભારતની પ્રાચીન લિપિઓ’થી માંડીને
‘સમીક્ષિત આવૃત્તિની સમસ્યાઓ’ સુધીના વિષયોને ચર્ચાનું
પુસ્તક. પુરવણીમાં વિવિધ લિપિપત્રો છે.

વ્યાપક / અન્ય

અનુવાદગ્રંથો (ન્હાનાલાલ) – સંપા. બળવંત જાની ગુજરાત
સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૭; રૂ. ૫૬૮, રૂ. ૨૫૫
^{૧૪} ‘ભગવદ્ ગીતા’, ‘મેઘદૂત’ ‘શિક્ષાપત્રી’ આદિ ગ્રંથોના
ન્હાનાલાલે કરેલા અનુવાદોનું સંકલિત પ્રકાશન – સંપાદકીય
લેખ સાથે.

આપડી લીલી ભોમકા – મંગળુભાઈ ખુમાણ પર્યાવરણ અને
સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટ, અમરેલી, (બીજી આ.) ૨૦૦૭; રૂ. ૮૦,
રૂ. ૬૦ ^{૧૪} પર્યાવરણ કેન્દ્રી વિચારણાના લેખો.

નોરતાનું રહસ્ય – નોરતમ પલાણ પ્રવીણ પ્રકાશન, રાજકોટ,
૨૦૦૭; રૂ. ૬૪, રૂ. ૪૦ ^{૧૪} ‘નવરાત્રિ’ – ઐતિહાસિક અને
પૌરાણિક પરિવેશમાં.

પથપ્રકૃતિ – જિતેન્દ્ર તળાવિયા પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક
ટ્રસ્ટ, અમરેલી, (પુનઃ) ૨૦૦૭; રૂ. ૬૪, રૂ. ૬૦ ^{૧૪} પર્યાવરણ
અને પ્રકૃતિ વિષયક વિચારણા.

યોગ : સમાધિ – ઔષ્ણો (રજનીશ) ઉપનિષદ્ ચેરિટેબલ ટ્રસ્ટ,
૨૦૦૭; રૂ. ૨૨૬, રૂ. ૧૪૦ ^{૧૪} પતંજલિ યોગસૂત્ર પર
આધારિત ઔષ્ણોનાં પ્રવચનોનો દુભાષીએ કરેલો અનુવાદ.

લોકગુજરી – અંક ૧૮ અને ૧૯ – સંપા. બળવંત જાની
ગુજરાત સાહિત્ય અકાદમી, અંક-૧૮, ૨૦૦૫-૦૬, રૂ. ૨૦૮,
રૂ. ૮૦; અંક-૧૯, ૨૦૦૭-૦૮; રૂ. ૨૭૨, રૂ. ૧૩૫ ^{૧૪} લોકસાહિત્ય વિષયક વિવિધ લેખકોના લેખોનું સંપાદન.

વાર્ષિક સૂચિ ૨૦૦૭

અંક ક્રમ : ૧ જાન્યુ-માર્ચ, ૨ એપ્રિલ-જૂન, તૃ જુલાઈ-સપ્ટે., ૪ ઓક્ટો.-ડિસે.

લેખસૂચિ

કવિતા

	અંક : પૃષ્ઠ
કથાચોત્તીરી (સંપા. કાન્તિલાલ બી. શાહ), અંજની મહેતા	૧ : ૭
છોડીને આવ તું (રાજેશ વ્યાસ 'મિસ્ટિકન') હર્ષદ ત્રિવેદી	૩ : ૫
દક્ષિતવાણી (સંપા. હરીશ મંગલમુ) સિલાસ પટેલિયા	૨ : ૫
નંદબત્તીરી (શામળ, સંપા. કીર્તિદા શાહ) કાન્તિભાઈ બી. શાહ	૩ : ૧૨
પંદરમી વિદ્યા (શામળ, સંપા. રમેશ મ. શુક્રલ) કાન્તિભાઈ બી. શાહ	૩ : ૮
□મલબારીનાં કાવ્યરત્નો (બહેરામજી મલબારી) ચંદ્રકાન્ત ટોપીવાળા	૩ : ૩૮
સહજતથા (હેમંત દેસાઈ) હરીશ વઠાવવાળા	૩ : ૭

વાર્તા

કાન્ધાની કાબર (બાળવાર્તા : સતીશ મ. વ્યાસ) શ્રદ્ધા ત્રિવેદી	૨ : ૧૪
તમુની વાત (અંજિત ઠાકોર) ઈલા નાયક	૩ : ૧૫
દક્ષિતવાર્તાસ્થૂષિ (સંપા. મોહન પરમાર) ચંદ્ર મહેરિયા	૨ : ૭
વિદેશી વાર્તાવૈભવ (અનુ. પંકજ સોની) રમણ સોની	૧ : ૨૭

નવલક્ષ્ય

□મલક (દલપત ચૌહાણ) ચંદ્રકાન્ત ટોપીવાળા	૧ : ૩૧
---------------------------------------	--------

નાટક

હાથીરાજ અને બીજાં નાટકો (પ્રવીણ પંડ્યા) રાજેન્દ્ર મહેતા	૨ : ૧૦
---	--------

નિબંધ

શનિમેખલા (મધુસૂદન ઢાકી) યજોશ દવે	૧ : ૧૫
----------------------------------	--------

ચરિત્ર

ગાંધીજી, ચેપ્લીન અને હું (જયંતિ પટેલ) અમૃત ગંગાર	૧ : ૧૦
જેઝો કર્દી મૂકી ગયાં (જિતેન્દ્ર દેસાઈ) જિજ્ઞા વ્યાસ	૩ : ૧૭
પ્રકાશન - નહીં કાયરનું કામ (દીનાનાથ મહેરોત્ત્રા, અનુ. જિતેન્દ્ર દેસાઈ) કિશોર વ્યાસ	૩ : ૨૪
મારી આત્મકથા (ચેપ્લીન, અનુ. રવીન્દ્ર ઠાકોર) વિજય શારતી	૩ : ૨૦
સર્જન પ્રક્રિયા અને નારીચેતના (સંપા. ઉષા ઉપાધ્યાય) સિલાસ પટેલિયા	૨ : ૧૨

વિદેશન

અધ્યાંદસમીમાંસા (ચંદ્રકાન્ત ટોપીવાળા) ચિનુ મોદી	૨ : ૧૫
તાણવાળા (હેમંત ધોરડા) ધ્વનિલ પારેન	૧ : ૨૦
નરસિંહનાં પદ્દો - નવા પરિપ્રેક્ષયમાં (જયંત કોઈરી) નરોત્તમ પલાણ	૩ : ૨૭
□પ્રવેશિકા (મગનભાઈ દેસાઈ) ચંદ્રકાન્ત ટોપીવાળા	૨ : ૨૦

બાલકથા-સાહિત્ય (શદ્વા નિરેદી) ઈશ્વર પરમાર	૨ : ૩૦
વાર્તાપર્વ (બાબુ દાવલપુરા) અજયસિંહ ચૌહાણ	૧ : ૧૮

સૂચિગ્રંથ-સમીક્ષા

Catalogue of Native Publications (સંપા. ગ્રાન્ટ અને પીલ) દીપક મહેતા	૪ : ૭
ગુજરાતી આદિમુદ્રિત ગ્રંથોની સૂચિ (સંપા. અચ્યુત યાણિક, કિરીટ ભાવસાર) દીપક મહેતા	: ૪ : ૬
ગુજરાતી સામયિક લેખસૂચિ ૧૯૭૫, ૧૯૭૬ (સંપા. કનુભાઈ શાહ, કિરીટ ભાવસાર) કિશોર વ્યાસ	૪ : ૧૨
[ગુજરાતી] સામયિક લેખસૂચિ : ૧૯૮૬-૨૦૦૦ (સંપા. રમણ સોની) મણિભાઈ પ્રજાપતિ	૪ : ૧૪
પરબ સૂચિ (સંપા. ઈતુભાઈ કુરકુટિયા, પારુલ દેસાઈ, રમેશ દવે) જ્યંત મેઘાણી	૪ : ૧૬

અન્ય / વ્યાપક (ચિંતન, સંકલન, ફિલ્મ, આરોગ્ય વગેરે)

અમૃત ધાયલ (પરિચય પુસ્તિકા, વિનોદ જોશી) ઉર્વી તેવાર	૧ : ૨૮
અરધી સદીની વાચનયાત્રા (વિવિધ-પ્રકારી લખાણો, સંપા. મહેન્દ્ર મેઘાણી) ઉંકેશ ઓઝા	૧ : ૨૮
આઈન્સ્ટાઇનનું વિજ્ઞાનજગત (પરિચય પુસ્તિકા : જે. જે. રાવળ) પના નિરેદી	૧ : ૩૦
ઝોતીરાવ કુલે (પરિચય પુસ્તિકા સંજય ભાવે) ઉર્વી તેવાર	૧ : ૨૮
પુસ્તકોનું ગામ (પરિચય પુસ્તિકા : મહેશ દવે) પના નિરેદી	૧ : ૩૦
ફિલ્મિંગ ધ ગોડાજ (ફિલ્મસંશોધન : રેચલ ઇવાયર) અમૃત ગંગર	૩ : ૩૬
ભાગ્યકંતી ધરાશ્રેષ્ઠી (તબીબી વિજ્ઞાન : મનુ જાપી) કિરણ શિંગલોત	૧ : ૨૩
ભારતીય ચિત્રપટ સૃષ્ટિયે આદ્ય પ્રવર્તક (ફિલ્મ સંશોધન : શશીકાન્ત કિણીકર) અમૃત ગંગર	૩ : ૩૨
મકરંદ દવે (પરિચય પુસ્તિકા : અશોક વૈદ્ય) ઉર્વી તેવાર	૧ : ૨૮
વિષ્ણાત ભ્યુલિયમ્સ (પરિચય પુસ્તિકા : જ્યા મહેતા) પના નિરેદી	૧ : ૩૦
વરેષ્ય * તે તે સ્વરૂપ વિભાગમાં પણ આ ફુતિઓ નિર્દેશી છે.	
મલક (નવલકથા : દલપત ચૌહાણ) ચંદ્રકાન્ત ટોપીવાળા	૧ : ૩૧
મલબારીનાં કાબ્યરત્નો (કવિતા : બહેરામજી મલબારી) ચંદ્રકાન્ત ટોપીવાળા	૩ : ૩૮
પ્રવેશિકા (વિવેચન : મગનભાઈ દેસાઈ) ચંદ્રકાન્ત ટોપીવાળા	૨ : ૨૦

સંદર્ભવિશેષ

અધ્યયનનો આધારસંભાળ : સામયિક સૂચિ – જ્યંત મેઘાણી	૪ : ૧૮
ગુજરાતીમાં સૂચિકાર્ય (સૂચિઓની સૂચિ) સંકલન ભાગ્ય જાની	૪ : ૨૮
પ્રકાશ વેગનું સૂચિક્ષણે પ્રદાન – મણિભાઈ પ્રજાપતિ	૪ : ૨૩

સંસ્થાવિશેષ

ગુજરાતી વિશ્કોશ ટ્રસ્ટ – ઉંકેશ ઓઝા	૩ : ૪૨
ગુજરાતી સાહિત્ય પરિપ્રેક્ષા – ઉંકેશ ઓઝા	૨ : ૨૪
[ભારતીય] સાહિત્ય અકાદમી – ઉંકેશ ઓઝા	૧ : ૩૪

પ્રત્યક્ષીય : રમણ સોની

ઓળખીએ અભિમુખને –	૩ : ૩
મિત્રાંશુ સૂચિકારોડસિસ્મ –	૪ : ૩
[સ્વાગત] ફાર્બર્સ ગુજરાતી સભા ટ્રેમાસિક	૧ : ૩
સંપન્ન ‘દાસ્તિ’ ગ્રંથસ્વરૂપે	૨ : ૩

પ્રત્યક્ષસૂચિ ૧૯૯૬-૨૦૦૦

સીધા સંપર્કમાં મૂકી આપનાર હાથપોથી – કિશોર વ્યાસ	૪ : III
સર્વગ્રાહી લઘુચિત્ર – રમણ સોની	૪ : II
સૂચિકાર્યના અનુભવની કેરી પર – કૃતિ પટેલ, સપના મોદી	૪ : VI
પ્રત્યક્ષની સૂચિ (૧૫ વર્ષ) – કૃતિ પટેલ, સપના મોદી	૪ : IX

સામયિક લેખસૂચિ ૨૦૦૬

'કવિતા'થી 'નિબંધ' સુધી – કિશોર વ્યાસ	૧ : ૩૭
'ચરિત્ર'થી આગળ (પૂર્ણ) – કિશોર વ્યાસ	૨ : ૨૭

પત્રચર્ચા

'ઓળખીએ અભિમુખને' : (પ્રત્યક્ષીય) વિશે – દિલીપ જવેરી	૪ : ૩૪
કિશોર વ્યાસે કરેલી સમીક્ષામાં ક્ષતિ – રાજેન્દ્ર મહેતા	૪ : ૩૩
ગુજરાતી ગજલનું છંદોવિધાન ગુજરાતી જ હોય – ચિન્નુ મોદી	૨ : ૪૦
ચિન્નુ મોદીની ગજલવિચારણા સામે કેટલાક મુદ્દા – હેમંત ધોરડા	૩ : ૪૭
'જળને પડદે'ની સમીક્ષા વિશે – મુનિકુમાર પંડ્યા	૧ : ૫૧
'જ્ઞાનસ સભા ત્રૈમાસિક' : (પ્રત્યક્ષીય) વિશે – વિજય પંડ્યા	૨ : ૪૨
'સાહિત્ય અકાદમી' વિશે (ઉકેશ ઓઝા) સામે પ્રશ્નો, અને પૂર્તિ – રાજેન્દ્ર મહેતા	૨ : ૪૧

લેખક (સમીક્ષક)સૂચિ

અજ્યાસિંહ ચૌહાણ ૧ : ૧૮	ધ્વનિલ પારેખ ૧ : ૨૦
અમૃત ગંગર ૧ : ૧૦, ૩ : ૩૨, ૩ : ૩૬	નરોત્તમ પવાણ ૩ : ૨૭
અંજની મહેતા ૧ : ૭	પના નિવેદી ૧ : ૩૦
ઠિલા નાયક ૩ : ૧૫	ભાર્ગવ જાની ૪ : ૨૮
ઈશ્વર પરમાર ૨ : ૩૦	મહિબાઈ પ્રજાપતિ ૪ : ૧૪, ૪ : ૨૩
ઉર્વી તેવાર ૧ : ૨૮	મુનિકુમાર પંડ્યા ૧ : ૫૧
કાન્તિભાઈ બી. શાહ ૩ : ૮, ૩ : ૧૨	યદેશ દવે ૧ : ૨૫
કિરણ શિંગલોત ૧ : ૨૩	રમણ સોની ૧ : ૩, ૧ : ૨૭, ૨ : ૩, ૩ : ૩, ૪ : ૩, ૪ : II
કિશોર વ્યાસ ૧ : ૩૭, ૨ : ૨૭, ૩ : ૨૪, ૪ : ૧૨, ૪ : III	રાજેન્દ્ર મહેતા ૨ : ૧૦, ૨ : ૪૧, ૪ : ૩૩
કૃતિ પટેલ ૪ : VII,	વિજય પંડ્યા ૨ : ૪૨
ચંદુ મહેરિયા ૨ : ૭	વિજય શાસ્ત્રી ૩ : ૨૦
ચંદ્રકાન્ત ટોપીવાળા ૧ : ૩૧, ૨ : ૨૦, ૩ : ૩૮	શ્રદ્ધા નિવેદી ૨ : ૧૪
ચિન્નુ મોદી ૨ : ૧૫, ૨ : ૪૦	સપના મોદી ૪ : VII
જ્યંત મેઘાણી ૪ : ૧૬, ૪ : ૧૮	સિલાસ પટેલિયા ૨ : ૫, ૨ : ૧૨
જિશા વ્યાસ ૩ : ૧૭	હરીશ વટાવવાળા ૩ : ૭
ઉકેશ ઓઝા ૧ : ૨૮, ૧ : ૩૪, ૨ : ૨૪, ૩ : ૪૨	હર્ષદ નિવેદી ૩ : ૫
દિલીપ જવેરી ૪ : ૩૪.	હેમંત ધોરડા ૪ : ૪૭
દીપક મહેતા ૪ : ૭, ૪ : ૮	

આ અંકના લેખકો

દીપક મહેતા	: ૫૫, વૈકુંઠ સૌસાયટી, લલુભાઈ પાર્ક, અંધેરી (પાશ્વમ) મુંબઈ ૪૦૦૦૦૫૮ p ૦૨૨-૨૬ ૨૪૩૦૦૮
કિશોર વ્યાસ	: ૬, મહેતા સૌસાયટી, કાવોલ પંચમહાલ ૩૮૮ ૩૩૦ p ૦૨૬ ૭૬ ૨૩૬૮૮૭
મહિભાઈ પ્રજાપતિ	: યુનિવર્સિટી ગ્રંથાલય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ p ૮૮૨૫૦૪૬ ૨૦૫
જયંત મેઘાણી	: પ્રસાર, ૧૮૮૮ આત્માભાઈ એવન્યૂ ભાવનગર ૩૬ ૪૦૦૨ p ૦૨૭૮-૨૫૬ ૮૦૨૨
ભાર્ગવ જાની	: ગ્રંથપાલ, શામળદાસ આર્ટ્સ કોલેજ, ભાવનગર ૩૬ ૪૦૦૨ p ૮૮૨૫૭૦૭૮૮૪
રાજેન્ડ્ર મહેતા	: ૨૭ કૃષ્ણકુમાર વિદ્યાનગર, ભાવનગર ૩૬ ૪૦૦૨ p ૮૮૨૪૨૮૬ ૧૮૨
દિવીપ જીવેરી	: ૩૦૧ વોલ્ડોફ્ઝ, હીરાનંદની એસ્ટેટ, ઘોડબંદર રોડ, થાણે ૪૦૦૬૦૭ p ૦૨૨૬૬૨૭૬૮૧૧
કૃતિ પટેલ	: ગણેશ ભુવન, ખંડેરાવ માર્કેટ પાછળ, વડોદરા ૩૮૦૦૦૧ p ૮૮૨૫૭૨૭૩૬ ૧
સપના મોદી	: બી લ/૧૦ અંદરધારા એવન્યૂ સહજાનંદ સોમિલ, સમા-સાવલી રોડ, વડોદરા ૩૮૦૦૦૮ p ૮૮૨૨૭૧૩૮૫૪

‘નેપથેથી પ્રકાશવર્તુળમાં’ (૧૯૮૬) તથા ‘ચહેરા અને રસ્તો’ (૧૯૮૮) પછીનું પ્રત્યક્ષ-પ્રકાશન

સામયિક-લેખ સૂચિ

સંપાદક રમણ સોની

૧૯૮૬-૨૦૦૦નાં વર્ષો દરમયાન ગુજરાતીનાં ૨૨ જેટલાં સામયિકોમાં પ્રગટ થયેલ સૈદ્ધાંતિક લેખો-સમીક્ષાઓ-આસ્વાદો-ચર્ચાઓ-કેદ્ધિયતો વગેરેની, કયા લેખકે કયા પુસ્તક/વિષય અંગે કયા સામયિકમાં કયારે લખેલ - એ વિગત દર્શાવતી આ સૂચિ (૨૦૦૬) લેખકો, અભ્યાસીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓ માટે એક મહત્વાનું, હાથવગું સંદર્ભસાધન છે.

કવિતા-વાર્તા આદ્ય ૧૪ વિષયો દ્વારાયો અને અના ૨૭ યેટાલિવાઓમાં સામયિકોમાં મુદ્રિત લેખોની માહીતી પદ્ધતિયું દર્શા કરીની આ સૂચિ ૪૦૦૦ ઉપરાંત આવિકદર્શકો (entries) કાઢાવે છે જેમાં ૫૦૦ ઉપરાંત લેખકો (સમીક્ષક), વિવેચકો) ની લેખાલાભથી નિર્દેશ પાડી છે.

તેમી કદનાં ૧૫૨ પાનાના આ પુસ્તકની બજારક્રિમત રૂ. ૮૫ થાય પરંતુ પ્રત્યક્ષ-પ્રકાશને વાચકો-ગ્રાહકો-વિદ્યાર્થીઓ-અધ્યાપકો-અભ્યાસીઓને માટે CIIIના ધોરણ મુજબ રૂ. ૩૮ રાખી છે.

(ટપાલથી મેળવવા દર્શનારે રૂ. ૪૦ (મ.ઓ.થી) પ્રત્યક્ષના સરનામે મોકલવા)

સામયિક લેખસૂચિ વિશે

અભ્યાસીઓના આભિપ્રાયો



- p વિવિધ પ્રકારની સૂઝપૂર્વક તૈયાર થયેલી શ્રદ્ધેય સાહિત્યસૂચિઓ ફુશળ અભ્યાસીઓને અરીસાની ગરજ સારે છે. સૂચિમાંથી અનેક વિષયો એમને સંશોધન-વિવેચન માટે મળી રહેતા હોય છે... આ સૂચિમાં ઘણી માહિતી છે પણ માહિતીનો ખડકલો નથી... ગ્રંથને અંતે મૂકેલી લેખકસૂચિ દ્વારા કયા લેખકે કયા વિષય પર શું લખ્યું છે એની વિગત મળે છે... આવી વૈજ્ઞાનિક સૂચિ આપીને સંપાદકે અત્યાર સુધી ગુજરાતી સાહિત્યના અભ્યાસ માટે તૈયાર થયેલા કેટલાક મજબૂત આધારોમાં એકનો ઉમેરો કર્યો છે. (પુસ્તકના ફેલે પરથી) - જ્યંત ગાડીત
પ રૂપેરંગે અને ઉપયોગિતાની નજરે પણ એક સુંદર પ્રકાશન... હા બધી જ દસ્તિએ જરૂરી કામ, અમે તો પ્રસન્ન પ્રસન્ન અને કેટલું સુધાર મુદ્દા ! - નરોત્તમ પલાણ
p સામયિકલેખસૂચિ એકદમ વ્યવસ્થિત રીતે તૈયાર થઈ છે. રોમાંચક, આનંદપ્રદ. આ કામ ચાલુ રાખવું જ જોઈએ. - જ્યંત પારેખ
p તમે આ સંપાદન અત્યંત ચીવટથી, ચુસ્ત શિસ્તથી ને નિષાભરી કાળજીથી કર્યું છે તેથી એ શાસ્ત્રીય બન્યું છે. - ચિમનલાલ નિવેદી
p ગુજર ભાષામાં કદાચ આવું આ પ્રથમ પ્રકાશન છે, પાછું ગુણમુખ કરાવે એવું પણ ખણું. - રાહીશયામ શર્મા
p સંશોધન-સંપાદનનું ક્ષેત્ર ઉજ્જવલ થતું જાય છે તે સંઝોગોમાં તમારી પાસેથી આવી મૂલ્યવાન સૂચિ મળી એનો આનંદ. - રત્નલાલ બોરીસાગર
p આ સૂચિ એકદમ વૈજ્ઞાનિક પદ્ધતિથી અને વપરાશકારને સહજ સહાયક બને એવી user friendly રીતે તૈયાર કરવામાં આવી છે. - ભોળાભાઈ પેટેલ



દિવાઇન પબ્લિકેશન્સ

પુસ્તક પ્રકાશક અને વિકેતા

૩૦, નીજે માળ, કૃષ્ણ કોમ્પ્લેક્સ, જૂનું મોડલ સિનેમા, ગાંધીચોડ, અમદાવાદ-૧ ફોન : ૯૮૨૫૧૭૨૮૧૮, ૮૪૨૭૦૧૨૮૮૫

ગ્રંથાલયને સમૃદ્ધ કરે તેવાં દિવાઇન પબ્લિકેશન્સનાં પ્રકાશનો

આડા કુંગર જીબી વાટ	(નિબંધસંગ્રહ)	મહિલાલ ડ. પટેલ	૫૦/-
સર્જકનો સમાજલોક	(નિબંધસંગ્રહ)	મહિલાલ ડ. પટેલ	૧૦૦/-
નિરાકૃત	(નિબંધસંગ્રહ)	સ. પ્રવીષ દરજી	૧૧૦/-
કેશુભાઈ દેસાઈની વાર્તાસૂચિ	(વાર્તાસંગ્રહ)	સંપ્રાગજીભાઈ ભાસ્યી	૧૦૦/-
આચામખુરશી	(વાર્તાસંગ્રહ)	અજ્ય ઓઝા	૬૦/-
હું ચૂપ છું	(વાર્તાસંગ્રહ)	લીના કાપડિયા	૧૦૦/-
હોળાષ્ટક	(નવલક્ષ્ય)	કેશુભાઈ દેસાઈ	૧૦૦/-
ચિત્તાથી ચિત્તન તરફણ...	(ચિત્તનાત્મક)	મુરારિલાલ ત્યાગી	૧૦૦/-
ઓશેનું કેળવકીદર્શન	(શિક્ષણ)	સંસ્વામી આનંદ વૈરાગ્ય	૨૦૦/-
શિવમહિમાનઃ સ્તોત્રમુ	(ધાર્મિક)	સં. રહિમન રાવલ	૫૦/-
દિવારસ્વન્ધ	(શિક્ષણ ચિત્તન)	ચિજુભાઈ બદેકા	૪૦/-
ચાર નવલક્ષ્યકારો	(વિવેચન)	ભરત મહેતા	૧૬૦/-
સરોજ પાઠકનું કથાસાહિત્ય	(વિવેચન)	ડૉ. ઉર્વશી પંડ્યા	૧૩૫/-
પિંગળશીભાઈ ગઢવીનું શેષ સાહિત્ય	(વિવેચન)	ડૉ. નવલાલ ઓડેદ્રા	૮૦/-
મુનશી-પન્નાલાલની પૌરાણિક નવલક્ષ્યાઓ	(વિવેચન)	ડૉ. રાજેન્ડ રોહિત	૨૦૦/-
આઠીતરી ગુજરાતી મૌલિક દીર્ઘ નાટક	(વિવેચન)	ડૉ. પ્રભુદાસ પટેલ	૧૭૫/-
ત્રણ લઘુક્ષ્યાઓ	(વિવેચન)	ગણપત સોઢા	૮૦/-
મૃત્યુ માંગય	(ચિત્તનાત્મક)	ડૉ. કલાધર આર્થ	૧૦૦/-
રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્કરણો	(સંસ્કરણ)	અનુ. અંબાલાલ પુરાણી	૧૦૦/-
મનોવિશ્લાનની સંશોધન પદ્ધતિઓ	(અભ્યાસ)	ડૉ. અરવિંદ શાહ	૧૬૦/-
જીવન ફીલક વિકાસ	(અભ્યાસ)	ડૉ. અરવિંદ શાહ	૧૭૦/-
અસાધારણ મનોવિશ્લાન	(અભ્યાસ)	ડૉ. અરવિંદ શાહ	૨૦૦/-
સ્વાસ્થ્ય મનોવિશ્લાન	(અભ્યાસ)	ડૉ. અરવિંદ શાહ, ડૉ. ગંધર્વ જોશી	૧૫૦/-
હું હેક્ટર હું દરદી	(આત્મકથનાત્મક)	ડૉ. પ્રદીપ પંડ્યા	૩૦/-
સંશોધન પદ્ધતિઓ અને આંકડાશાસ્ત્ર	(અભ્યાસ)	ડૉ. અરવિંદ શાહ	૧૪૦/-
જાતીયતા અને દાંખ્યતાનું મનોવિશ્લાન	(અભ્યાસ)	ડૉ. અરવિંદ શાહ	૧૨૫/-
લલીતકલા સંશોદોશ	(સંશોદોશ)	અભિજિત વ્યાસ	(પ્રેસમાં)
હોકારો	(લેખો)	ડૉ. કાન્તિ રામી	(પ્રેસમાં)

સંસ્કૃત મહાકવિ શ્રેણી

મહાકવિ વાલ્ભિક્લિ	આચાર્ય જ્યાનંદ દબે	મહાકવિ બાણિ	ડૉ. વિજય પંડ્યા
મહાકવિ વ્યાસ	ડૉ. શાંતિકુમાર પંડ્યા	મહાકવિ શૂદ્રક	ડૉ. વર્સંત પરીખ
મહાકવિ ભાસ	ડૉ. ઊર્મિ શાહ	મહાકવિ શ્રીહર્ષ	ડૉ. રવીન્ડ્ર ખાંડવાળા
મહાકવિ કાવીદાસ	ડૉ. ગૌતમ પટેલ	મહાકવિ જગન્નાથ	ડૉ. આર. પી. મહેતા
મહાકવિ અશ્વધોષ	ડૉ. વિજય પંડ્યા	મહાકવિ ભવભૂતિ	ડૉ. ગૌતમ પટેલ / ડૉ. વિજય પંડ્યા
મહાકવિ ભારતિ	ડૉ. જશવંતી દબે	પ્રત્યેક પુસ્તકની કિંમત રૂ. ૫૦	
મહાકવિ માધ	ડૉ. હર્ષદીપ માધવ		

આ ઉપરાંત અન્ય પ્રકાશકોનાં ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી ભાષાનાં પુસ્તકો આપના ઓર્ડર મુજબ પૂરાં પાડીશું, તો આજે જ આપનો ઓર્ડર મોકલવા વિનંતી છે. વિસ્તૃત માહિતી માટે અમને મોબાઈલ કરો : ૯૮૨૫૧૭૨૮૧૮